

Date of Publication 10<sup>th</sup> Posted on Every Month

₹ 20




# પરબુ

સમાનો મન્ત્ર : ૧ (૪૦વેદ)  
સમાની પ્રપા : (અથર્વવેદ)

તંત્રી : યોગેશ જોખી

ડિસેમ્બર : ૨૦૨૦  
વર્ષ : ૧૫, અંક : ૬



૨૦૧૮ના શાન્દીઠ એવોઈથી સંભાનિત મલયાળમ ભાષાના મહાકવિ  
**અંકૃતમ અચ્યુતન નમ્ભૂતિરિ**

(જ. ૧૮ માર્ચ ૧૯૨૬, કુમરનલ્લુર, જિ. પાલકકાડ, કેરળ  
- અ. ૧૫ ઓક્ટોબર ૨૦૨૦, શ્રીસુર, કેરળ)

## ગુજરાતી સાહિત્ય પરિષદનાં મહત્વનાં પ્રકાશનો



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૧

(ઈ. ૧૧૫૦-૧૪૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,  
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનભાઈ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૪+૩૧૨, કિંમત રૂ. ૨૧૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૨/ખંડ-૧

(ઈ. ૧૪૫૦-૧૬૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,  
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૬+૪૮૨, કિંમત રૂ. ૨૮૦/-




ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૨/ખંડ-૨

(ઈ. ૧૬૫૦-૧૮૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,  
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૬+૮૮૫, કિંમત રૂ. ૨૫૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૩

(દલપત્રરામશી કલાપી)

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,

યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ : પૃ. ૧૬+૬૫૬, કિંમત રૂ. ૫૦૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૪

પ્રથમ આવૃત્તિ સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,

યશવંત શુક્લ સહાયક સંપાદક ચિમનલાલ ત્રિવેદી

શોધિત વર્ધિત આવત્તિ સંપાદક : રમણ સોની

પાંકુ પૂર્ણ પૃ. ૧૬ + ૬૦૦ કિંમત રૂ. ૫૫૦/-

સમાનો મન્ત્ર : (ગુજરાતી)

સમાની પ્રપા (અર્થવર્વેદ)

# પરબ

સ્થાપનાવર્ષ : ૧૯૬૦

વર્ષ : ૧૫

ડિસેમ્બર : 2020

અંક : ૬

પરામર્શનસમિતિ

સિતાંશુ યશશ્વર  
પ્રમુખ

કૃત્તિદા શાહ  
પ્રકાશનમંગ્રી

તંત્રી  
યોગોશ જોધી

## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેઘાણી જ્ઞાનપીઠ ◆ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશનવિભાગ), ગોવર્ધનભવન,

ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નાટીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ફોન : ૨૬૫૮૭૮૪૭ • Email : gspamd123@gmail.com

## પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- ◆ 'પરબ' દર માહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
  - ◆ 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
  - ◆ 'પરબ'નું વાર્ષિક લવાજમ ₹ ૧૫૦ છે.
  - ◆ વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ ₹ ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.
  - ◆ ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
  - ◆ પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક ₹ ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક ₹ ૩૦૦ છે. સભ્ય થવા ઈચ્છનારે પરિષદના નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
  - ◆ પરિષદના આજવન સભ્યપદનું શુલ્ક ₹ ૨,૦૦૦ છે તથા સંસ્થા આજવન સભ્ય ફી ₹ ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
  - ◆ 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓડર અથવા ઇમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.
- લેખકોને :
- ◆ 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
  - ◆ લેખકોએ પોતાનું લખાણ ફૂલસ્કેપ અથવા A4 સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અથરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઈનલોન્ડ કે ચબરખીઓમાં ફૂતિ મોકલવી નહીં. પ્રતેક ફૂતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ ફૂતિઓ મોકલવા વિનંતી.
  - ◆ સ્વીકૃત ફૂતિની જાણ કરાશે. ટપાલ-ટિકિટો ચોંટાડેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત ફૂતિ પરત કરવામાં આવશે, અન્યથા ફૂતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.
  - ◆ પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઇસ' પાછળ, નદીકિનારે, પો.ઓ. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

**Parishad Email : gspamd123@gmail.com**

E-mail : parabgsp@gmail.com                      vruttparabgsp2018@gmail.com  
Web-site : [www.gujaratjisahityaparishad.org](http://www.gujaratjisahityaparishad.org) ફોન અને ફેક્સ : ૨૬૪૮૭૮૪૭  
[www.gujaratjisahityaparishad.com](http://www.gujaratjisahityaparishad.com)

પરબ

ISSN : 0250-9747

ધૂટક ક્ર. ₹ ૨૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : કીર્તિદા શાહ (પ્રકાશનમંગી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮ \* તંત્રી : યોગેશ જોધી \* મુદ્રણસ્થાન : ભગવતી ઓફસેટ, અમદાવાદ-૩૮૦૦૦૬

## અ નુ ક મ

પ્રમુખીય : દ્વિદલ પણ્ણ, સિતાંશુ યશશેન્દ્ર 6

કવિતા : આકાશ, વર્ષા દાસ 14 ભીંતો, રમણીક સોમેશ્વર 15 બે ગજલ, ભરત વિજુદા 16 બે ગીત, જિગાર જોખી ‘પ્રેમ’ 17 બાક્સિસ, વહીદા ડ્રાઈવર 18 કયાં છે રૂચિ, રિયાજ દામાણી 18 રંગબેરંગી કુળગાઓ, યોગેશ જોખી 19

વાર્તા : મેં તો ઘટ ઘટ દેખા સાંઈ, પ્રવીણ ગઢવી 20

આસ્વાદ : નવપરિણિત પેલાં : એકત્વથી પૂર્ણત્વ પ્રતિ, ચંદ્રકાન્ત શેઠ 31 સુભાજિત સ-રસ-વતી ધારા, વિરાટ છતાં અશક્તિ !, વિજય પંડ્યા 37

વિશેષ : ‘કદાચ, સૂરજ ઊગે...’, ભરત મહેતા 40

અનુવાદ : જન-જનના રચનાકાર : અંકિતમ, આલોકરંજન, અનુ. પીયુષ ઠક્કર 43

વિવેચન : સર્જનાત્મક સાહિત્યમાં ભાવનની સમસ્યાઓ, ચન્દ્રકાન્ત ટોપીવાળા 48

શ્રદ્ધાંજલિ : કલાવિદુષી કપિલા વાત્સયાયન, ભરત દવે 53 ફાખર વાલેસ, પ્રહુલ્લ રાવલ 61

સાહિત્યવૃત્ત : સંકલન : પરીક્ષિત જોશી 65

પત્રસેતુ : નરોતમ પલાણ 66 યશવન્ત મહેતા 66 થોભણ પરમાર 67

વાર્ષિક સૂચિ : ઊર્મિલા ઠાકર 68

આ અંકના લેખકો : 88

# પ્રમુખીય

## દ્વિદલ પણ્ડી

સિતાંશુ યશશ્વન્દ

### લેખાંક-૪

કવિતાની બધું જોતી નજરે આપણે

વીસમી સદીના ઉત્તરાર્ધના પૂર્વ યુરોપના કવિ ચે'શાહ મીવોશ (Czeslaw Milosz. 1911, Lithuania - 2004, Poland) પોતાના એક પુત્રકના શીર્ષક વિશે વાત કરતાં કવિતા અને સમાજ વચ્ચેના સંબંધનો મર્મ એક જ વાક્યમાં આબાદ ચીંધી આપે છે. એ કહે છે : 'I have titled this book *The Witness of Poetry* not because we witness it, but because it witnesses us.' કોઈ પણ ભાષાના સમગ્ર સાહિત્યની સાખ કોઈ એક સમયગાળાના સાહિત્યકારોના કે સમાજના હાથમાં નથી, કેમ કે, મીવોશ માને છે કે કવિ (અને સમાજ) કવિતાના કામના સાક્ષી હોય એથી વધુ તો કવિતા એમનાં કામની સાક્ષી બને છે - 'it witnesses us.' અનેક આકમણો અને જુલ્દી પર-શાસનોને સહીને પણ ટક્કાર અરીખમ રહેલા દેશ, પોલેન્ડ-નો કવિ અહીં જે કહે છે એનો મર્મ પહેલી નજરે કદાચ ન પકડાય તો એ નજર નોંધીને નીરખવા જેવો છે. જોઈએ. (નવયુવાન ઉમાશંકરની નજર 'ગુલે પોલાંડ' પર નોંધાઈ હતી, એ યાદ આવે.)

મીવોશનું વાક્ય ફરી ફરી વાંચવાલાયક છે : '... not because we witness it, but because it witnesses us.' કવિતા આપણને જુઝે છે અને આપણી આંતરશ્બૂભી આલેખતી જાય છે. એક ભાષાની, એક પ્રદેશની પ્રજાના આંતરજીવનનો આલેખ એની ભાષાની કવિતાના, સાહિત્યના પટ પર અંકાયેલો હોય છે. હેમયન્ડ્રથી હેંડ સ્વરાજ સુધીનું ગુજરાતી સાહિત્ય, નરસિંહથી નર્મદ સુધીનું, સઘન વાચને વાંચો તો હજારેક વરસના ગુજરાતી પ્રજાના જીવનનો મર્મ પામી શકો. સેહાળ છતાં નિર્ભમ નજરે કવિતા બધું જોતી રહે છે ને જોયેલું લખતી રહે છે. સાહિત્ય જેવું સંસ્કૃતિ (અને વિકૃતિ)નું સાક્ષી બીજું કોણ ? દરેક પ્રજાની સાખ એના સાહિત્યના હાથમાં હોય છે.

સાંપ્રત ગુજરાતી સાહિત્યકારોની (લેખકો, વાચકો, આયોજકોની) સાખ પણ દીધ અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવતા ગુજરાતી સાહિત્યના હથે છે. નિર્ભય અને નિસ્ત્વાર્થ સાથીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદનું પણ એવું જ સમજજવું. પરિષદ પોતે બધું જુએ છે અને ઉકેલવી અધરી એવી પોતાની એક ગુપ્ત લિપિમાં બધું નોંધતી રહે છે.

રણજિતરામ-ગોવર્ધનરામની, બળવંતરાય ઠાકોર-ગાંધીજીની, નિરંજન ભગત-

ઉમાશંકરની પરિષદ ઉપર આપણે નજર રાખવાની છે એવો ભ્રમ આપણે રાખીએ નહીં. ગુજરાતી પ્રજાની એ પરિષદ સમકાળીન સાહિત્યકારોની ગતિવિધિઓ ઉપર, પોતીકી રીતે, ચાંપતી નજર રાખે છે, એની શતાધિક વર્ષોથી ઘણું જોઈ ચૂકેલી આંખોથી એ આપણને જુએ છે. એટલે, આપણી માતૃભાષાના માતબર સાહિત્યને અને એની માતબર સાહિત્ય પરિષદને બરાબર સમજીને આપણે સહુ વિચારીએ, લખીએ, વર્તીએ, એની જવાબદારી આપણી સહિત્યારી છે.

ગુજરાતી સાહિત્યના અને સાહિત્ય પરિષદના ચાહક એવા આપણે સહુ, આપણા સહુની ‘કા ભાષા’ અને આપણે ‘કિમારીત ત્રણેત કિમ્બુ’, એ સવાલો પોતાને નિરંતર કરતા રહીએ. પરિષદના સાચે જ આજીવન સત્ય થવું, એ જે તે વાત નથી.

\*

કોઈ સર્જનશીલ સાહિત્યકાર કોઈ સક્રિય સાહિત્યિક સંસ્થાનો આજીવન સત્ય બને, એક ઊંડા સર્જનાત્મક અર્થમાં, એ એક મોટો ‘પેરેડોક્સ’ છે. પોલેન્નના કવિ મીવોશ, ૧૯૮૦માં એમને નોબેલ પારિતોષિક મળ્યું એના સ્વીકાર-પ્રવચનમાં કહે છે : ‘There is a paradox inherent in the poet's calling. Savagely individualistic, pursuing goals which are visible only to his few intimate friends, he grows accustomed to be branded as difficult and obscure, only to discover one day that his poems constitute a link between people and that he must assume, whether he wants it or not a symbolic role.’

કવિ મીવોશ જેની વાત અહીં કરે છે એ ‘ઈન્હેરન્ટ પેરેડોક્સ’, ‘અંતર્નિહિત અંતરવિરોધ’ને પૂરો સમજ્યા વિના સાહિત્યકાર અને સાહિત્યિક સંસ્થાઓ વચ્ચેનો સર્જકતાભર્યો, સર્જકતાપોષક સંબંધ સમજી, સ્થાપી, ટકાવી ન શકાય. અને, સાથોસાથ, સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાનો ઉમાશંકર, દર્શક, નારાયણ દેસાઈ, નિરંજન ભગત આદિએ હઠતાથી સેવેલો આગ્રહ પણ સમજપૂર્વક ટકાવી ચરિત્રાર્થ કરી ન શકાય. આજથી ગ્રાણ વર્ષ પહેલાની પરિષદની મધ્યસ્થ સમિતિની આ ગાળાની પહેલી બેઠકમાં એના કેટલાક સત્યોએ સ્વાયત્તતા સાચે રહેવાને બદલે રાણ્ણામું આપી પરાયતતાનો સાથ આપવાનું પસંદ કર્યું હતું, એ હકીકત હવે પછીના ગાળાની મધ્યસ્થ સમિતિની પહેલી બેઠક આવી રહી છે, એ અવસરે યાદ આવે છે અને યાદ દેવડાવવાનું જરૂરી બને છે. પરિષદના એ કોમળ-દંદ વર્તનનો મર્મ કવિ મીવોશની ઉપર નોંધેલી મીમાંસા દ્વારા કંઈક સમજી શકાય. પેલો ‘અંતર્નિહિત અંતરવિરોધ’ કેવો સર્જકતાભર્યો તણાવ પેદા કરે, એ આપણા આજાના સંદર્ભે જોઈએ.

મીવોશ બે મુદ્રા રજૂ કરે છે : કવિ, સાહિત્યસર્જક, ‘સેવેજલી ઈન્ડિવિઝ્યુઆલિસ્ટિક’, ‘આદિમ આવેગે વૈયક્તિકતાનો આગ્રહી’ હોય છે. એટલે શું ? એટલે એ કે કવિ વિવિધ સત્તા-તંત્રોને ઈશારે, એમની મહેરભાનીથી, એમની ગુપ્ત પરવાનગી મેળવીને કે દેખીતી આજીથી પોતાનું સર્જન કરતો નથી, કરી શકે નહીં. આવા સત્તા-તંત્રો રાજ્યસત્તાના પરબુ ફિસેભાર, 2020

પ્રતિનિધિઓ જ હંમેશાં હોય એવું નથી. ધર્મસત્તા, નાણાંની વ્યવસ્થા સંભાળનારી સત્તા વગેરેનું બનેલું એક સંકુલ સત્તા-તંત્ર આધુનિક સમયમાં રસાઈ ચૂક્યું છે. એ જે હોય તે, પણ ‘આદિમ અવેગે વૈયક્તિકતાનો આગ્રહી’ એવો સાહિત્યકાર એવા તંત્રનો ‘પર-તંત્ર’ ન હોઈ શકે. સાહિત્યકાર ‘સ્વ-તંત્ર’ હોય. સ્વ-તંત્ર, ન કે અ-તંત્ર. એનો અર્થ એકે એ જે તંત્રમાં રહેવાનું પસંદ કરે, એ તંત્ર એણો અને એના જેવા અન્ય લેખકોએ સહિયારી રીતે, કોઈની દખલગીરી કે હુકમ વગર રચ્યું હોય. ૧૮૦૫માં, જ્યારે દેશ સ્વ-તંત્ર નહોતો ત્યારે થોડાક ગુજરાતી લેખકોએ સહિયારી રીતે સ્થાપેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું તંત્ર એ લેખકોએ પોતે, પોતાની શરતે રચ્યું હતું. દેશ સ્વતંત્ર થયો એ પછી રચાયેલી સમગ્ર દેશની ‘સાહિત્ય અકાઉમી’ પણ એ જ રીતે ઘડાયેલા બંધારણ મુજબ સ્વ-તંત્ર બની અને આજ સુધી સ્વ-તંત્ર છે. ગુજરાત રાજ્ય સ્વધાર્યું એ પછી બનેલી આપણા રાજ્યની સાહિત્ય એકેડેમી શરૂઆતમાં એ અર્થમાં સ્વ-તંત્ર નહોતી, રાજ્યસત્તાને અધીન હતી. પણ પછી, ઉમાશંકર જોશીના સૌભ્ય-દઠ સ્વચનથી અને ‘દર્શક’ આદિની પહેલથી એ પણ સ્વ-તંત્ર, સ્વધાર્ય બની. થોડાં વર્ષો પૂર્વે ગુજરાત શાસનનું એ ગૌરવ પોતાને હાથે જ ખંડિત થયું. એ પાછું ગૌરવવંતી બને અને એ સાહિત્ય એકેડેમી પાછી સ્વ-તંત્ર, સ્વધાર્ય બને, એ માટેનો પરિષદનો જ નહીં, ગુજરાતના અનેકાનેક વિચારવંત સાહિત્યકારોનો સક્રિય અને દઠ આગ્રહ છે, એના મૂળમાં છે પરિષદની તંત્ર-રચનામાં અનુસ્યૂત સ્વધાર્યતાની સહજતા, સહ-જ, એટલે કે જન્મજીત અનિવાર્યતા.

\*

કવિ મીવોશે જેને ‘અ પેરેડોક્સ ઇન્ફેરન્ટ ઈન ધ પોઅદ્રેસ કોલિન્ગ’ કહે છે એ કવિકર્મનો અંતર્વિરોધ આ છે : જોકે કવિતા ‘અનન્ય પરતંત્ર’ છે, તે છુતાં કવિ એ પણ જાણો છે કે ‘his poems constitute a link between people and that he must assume, whether he wants it or not a symbolic role.’ પજા પોતાની સાથે સહૃદ્યી વધારે અંતરંગ ગોઠિ પાડે તે પોતાની ભાષાની કવિતા દ્વારા. એટલે એ ભાષાના કવિએ પોતાની નિતાંત અંગત એવી જાતની સાથોસાથ, એ ચાહે કે ન ચાહે તોપણ, એક ‘સિભોલિક રોલ’ કહેતાં પ્રતીકાત્મક ભાગ ભજવવાનો હોય છે. કવિકર્મનો આ અંશ શો છે ?

કવિ મીવોશની સર્જકતાનો પરિચય આપતાં નોબેલ પારિતોષિક સમિતિએ નોંધ્યું છે કે ‘Strong passion but also strict discipline and unerring perspicacity mark Milosz's work.’ ‘બળકટ આવેગ’ અને ‘સખત શિસ્ત’ એ બન્ને એકસાથે જેમાં હોય એવા કવિ, પોતાની દ્વિદલ સર્જકતાની ભીતરથી જ, ‘સખત શિસ્ત’ની શક્તિ વડે સમજ શકે છે કે એણે સ્વભાવાભાષી સમાજ માટે કેવો અને કયો ‘રોલ’ અદા કરવાનો છે.

આપણા આજના સંદર્ભ એમાં (ઉમેરીએ કે જેમ સાહિત્યકારે તેમ સાહિત્યની બળકટ સંસ્થાઓએ (સવિશેષ ગુજરાતી સાહિત્ય પરિષદે) પણ આવું કામ કરતા રહેવાનું છે. આપણી સાહિત્યિક આબોહવાની સ્વ-તંત્રતાની જગતાણીનું, તેમજ વાપક સંસ્કૃતિની

સ્વ-તંત્રતાની જળવણી કરવાનું કામ કરતા રહેવાનું છે. ગુજરાતી ભાષાસાહિત્યની શક્તિશાળી અને આત્મશિસ્તયુક્ત દરેક સંસ્થાએ. જેમ કવિકર્મ તેમ સંસ્થાકર્મ પણ સ્વશિસ્તે, નિર્ભયપણે કરવું જ રહ્યું.

\*

એ કવિકર્મ અને એ સંસ્થાકર્મ જટ પરિણામ લાવશે, એ આશાએ એ બેમાંથી એકે કામ ન થાય. જેને કવિ-યશ-પ્રાપ્તિમાં, તેથે ઝટપટ, રસ હોય એ ભાગ્યે જ કવિતા રચી શકે. સત્તાગ્રસ્ત સંસ્થાને જેમણે ઝટપટ સ્વાયત્તતા અપાવવી હોય, એમના ધત્તો પણ ભાગ્યે લાંબા ચાલે. કાવ્યપ્રાપ્તિ અને સ્વાયત્તતાપ્રાપ્તિ, બન્ને પેલા નોબેલ કમિટીએ કવિવર મીવોશમાં નિહાળેલી શક્તિ-ત્રિવેણીના તીર્થે પૂરી સાધના કર્યે નીવડે, એવી જણસો છે. એ ગ્રાણ શક્તિઓ તે ‘Strong passion but also strict discipline and unerring perspicacity’, પ્રબળ આવેગ, કડક શિસ્ત અને ચૂક્યા વિના મૂળ સુધી જવાની, તલાવગાહન ક્ષમતા. કવિની એ સાધનામાં, સંસ્થાની એ તપશ્ચયમાં આપણે પાછા ન પડીએ.

કવિવર યેટ્રોસના અવસાન પદ્ધી આપેલી નિવાપાંજલીમાં કવિવર ઓડેને લખેલી મારી પ્રિય પંક્તિઓ આ સ્થળે પ્રસ્તુત બને છે. એ કહે છે : ‘In the nightmare of the dark / All the dogs of Europe bark. // And the seas of pity lie / locked and frozen in each eye.’ એવા જોખમી અંધારા સમયમાં પણ, ‘Follow Poet follow right / To the bottom of the night // IN your unconstraining voice / Still persuade us to rejoice.’

\*

દરબારી ઓટલે કહુંબા ઘૂંઠનાર કિત-દાસ વાડુમયકારો એક તરફ અને બીજી તરફ પરાજ્યમાં પણ સંઘર્ષશીલ રાજવી સાથે રહી, ‘મત ચૂકો ચૌહાણ’ એવા કવિશબ્દ (કદાચ પોતાનાયે અંતિમ શબ્દ) ઉચ્ચારનાર સંગ્રામશૂર કવિ, એ બન્ને, જેમ મધ્યકાળમાં તેમ, કમનસીબે, આજે પણ આપણી વચ્ચે હાજર છે. આજે થોડું નવતર થયું છે. એક તો એ કે અફીણી ઓટલાઓની વિવિધતા વધી છે. અને બીજું એ કે દરેક દરબારમાં જે ભાટાઈ કરનારા છે તેઓ બરદાઈ હોવાનો વેશ આજે આબાદ ભજવે છે. પણ એ બે વચ્ચેનો બેદ (અને એ દરેકનો ‘બેદ’) મેઘાણી પ્રાંગણે, રણજિતરામની સંસ્થામાં, ગોવર્ધન ભવનમાં જો નહીં કળાય અને જળવાય, તો પદ્ધી ક્યાં કળાશે અને જળવાશે? આવી ખેવના સાથે ‘પરબ’નાં આ પાનાંઓમાંનો મારો આ અંતિમ લેખ લખ્યો છે.

સ્નેહવંદન.

\*

## ૨. સમકાળીન ભારતીય કવિતા : આપણી વાત આપણી રીતે

લેખાંક : ઉર્દુ

### બહુભાષી કવિ : ભારતીય સાહિત્યની એક અનોખી ઓળખ

મધ્યકાળીન ગુજરાતી કવિઓ માતૃભાષાનો મહિમા કરતાં સંસ્કૃત ભાષાની સચોટ ટીકા કરી શકતા. પ્રેમાનંદની પંક્તિઓ, ‘આ પાસા વાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત’ અને અભાની પંક્તિઓ, ‘સંસ્કૃત બોલાથી શું થયું? પ્રાકૃતથી શું નાશી ગયું?’ યાદ આવે અને ‘ગુજરાતી ભાષા’ આત્મવિશ્વાસનું આકર્ષક સ્મિત કરતી નજરે ચઢે. એ સ્મિતનું અલબત્ત સ્વાગત.

પણ એ જ સૈકાઓમાં ગુજરાતના કવિઓની એક દ્વિભાષી, બલ્કે બહુભાષી પરંપરા પણ હતી. અખો સ્વયં પ્રજભાષામાં, અન્ય અનેક ગુજરાતી કવિઓ માફક, રચનાઓ કરતો. એવું દ્વિભાષીપણું તો ભારતવ્યાપક હતું. પોતાની માતૃભાષામાં ઉત્તમ રચના કરનાર અનેક પ્રાદેશિક ભાષાઓના ભારતીય કવિઓ પ્રજભાષામાં પણ રચના કરતા. ઉર્દૂ અને ફારસીના યુગમવાળી દ્વિભાષિતા પણ ગાલિબ અને અન્ય કવિઓમાં કેળવાઈ હતી. એવી જ દ્વિભાષિતા સંસ્કૃત વિશે પણ મધ્યકાળના ભારતીય કવિઓમાં હતી. ગુર્જરદેશમાં પ્રાદેશિક બોલીમાં પ્રથમ વાર કાવ્યરચના કરનારા, ઈસવી બારમી સદીના વજસેન અને શાલિભદ્રસૂરિ જેવા કવિઓ તો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના ભારે અભ્યાસી હતા, એ ભાષાઓમાં પદ રચના કરતા અને એ રચનાઓ ગુરુજનો દ્વારા સ્વીકારાયા પછી, ગુરુઅજ્ઞા મેળવી, પ્રાદેશિક બોલી (જે બાદમાં ‘ગુજરાતી ભાષા’ અને ‘ગુજરાતી ભાષા’ કહેવાઈ એ)-માં કાવ્યરચના કરતા, એ વાત હવે તો સારી કોલેજોના વિદ્યાર્થીઓ પણ જાણે.

પંદરમી સદીના કવિ માણિક્યચન્દ્રસૂરિની ગુજરાતી ભાષાની રચના, ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’ તો અપરનામે ‘વાગ્વિલાસ’ તરીકે પણ જાણીતી છે અને સાચે જ ગુજરાતી ભાષાના અનેક વિલાસો એમાં વાંચવા-સાંભળવા મળે છે, એ માણિક્યચન્દ્રસૂરિ સંસ્કૃત ભાષાના કેવા પ્રકાંડ પંડિત અને વિભ્યાત કવિ હતા એ તો એમની રચનાઓ, ‘શ્રીધરચરિત્ર’ (૧૪૦૭) અને ‘ચતુઃપર્વી ચંપુ’ (૧૪૨૮) આદિમાં જોઈ શકાય. મધ્યકાળીન ગુજરાતી સાહિત્યકારોની આવી દ્વિભાષિતાની વિગતે વાત પ્રો. શેલ્ડન પોલોક-સંપાદિત ગ્રંથ, *Literary Cultures in History : Reconstructions from South Asia* (2003)માં પ્રકાશિત, ‘From Hemchandra to Hind Svaraj: Region and Power in Gujarati Literary Culture’, એ મારા વિસ્તૃત લેખમાં ઉપલબ્ધ છે. અહીં તો, પ્રિય વાચક, એટલું જ નોંધીએ કે છેલ્લાં દોઢસો-પોણાબસો વરસોમાં વિવિધ ભારતીય ભાષામાં લખાતું ભારતીય સાહિત્ય જેટલું દરેક પ્રાદેશમાં એક-ભાષા-સીમિત બની ગયું છે, એવું પ્રાચીન ભારતમાં (સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અર્ધમાગધી સહિતની

પ્રાકૃતો, પૈશાચી, અપભ્રંશ આદિમાં વ્યાપ્ત હોવાથી) અને મધ્યકાલીન ભારતમાં (ગ્રજભાષા, સંસ્કૃત, અપભ્રંશ, ફારસી આદિમાં વ્યાપ્ત હોવાને કારણે) એક-ભાષા-સીમિત નહોતું. અવર્થિન ભારતીય સાહિત્યમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં લખનારા મહત્વના લેખકો અંગેજમાં પણ લખતા, તેમજ ફેન્ચ અને પોર્ટુગીઝ ભાષાઓમાં પણ લખતા, પણ એ તો સંસ્થાનવાદી સત્તાઓનો પ્રભાવ. અરુણ કોલાટકર, જ્યંત મહાપાત્ર જેવા મરાઈ અને ઉર્ધ્વા ભાષાના ઉત્તમ કવિઓ અંગેજમાં પણ કાવ્યરચના કરતા, એમાં ઉત્તર-સંસ્થાનવાદની જાંખી થાય છે કે સંસ્થાનોત્તરતાની, એની ચર્ચા અન્યત્ર કરીશું.

આજે જે કાવ્ય વાંચીશું, પ્રિય વાચક, એ આજના ભારતીય સાહિત્યમાં ગુજરાતી સાહિત્યે પોતાની દ્વિભાષિતાની શક્તિથી કરેલા અલગ પ્રકારના પ્રદાનની જલક આપશે. કાવ્ય છે પ્રો. ગૌરીપ્રસાદ જાલાનું, સંસ્કૃત તેમજ ગુજરાતીમાં. એક જ કવિએ એ કાવ્ય બે ભાષાઓમાં લખ્યું છે. વિશેષ મુદ્દો એ છે કે એ રચનાઓમાં આધુનિકતાનું જે તેજ વરતાય છે, એ સંસ્કૃત કવિતાનેથે એક ડગલું આગળ લઈ જાય છે. ગુજરાતના આજના સુકવિ હષ્ઠદિવ માધવની સંસ્કૃત કાવ્યરચનાઓ આજે ભારતવ્યાપક પ્રશંસા મેળવી ચૂકી છે, અને એમાં જે આધુનિકતાનો સંરૂપર્થ છે, એ પણ ન વીસરાય.

ગૌરીપ્રસાદ જાલા (મુંબઈની સેન્ટ ઐવિર્સ કોલેજના સંસ્કૃતના ઉત્તમ પ્રોફેસર, મોટા ગજના સંશોધક, ભારતભ્યાત વિદ્વાન, અને અમારા સહુ, વિદ્યાર્થીઓના મહામહિમાવંતા જાલાસાહેબ) -ની કાવ્યરચના, બન્ને ભાષાઓમાં, જોઈએ.

કો નામણું?	નામણું કોણું?
સાહસરિણિલિઙ્ગ કરે વિષય	દેખું કાં
મણલે મુદ્દો	મનાત સુલેણી ધારી
ભાગલાલાલમું...	પૂણીને જોગ હેઠથે?
સાધ એણ કલુણ તુ કિ	—હેઠથા કરે?
વિદ્યાર્થીયાયમું।	બ્યાધ, જિસું અંદે તુ
* * *	દોયદા મણે?
‘અદો સાલાદા કરે કથમું...	* * *
દુઃખને તુ માનદમું।	‘મણી... કે ને
સાલ કર એણ।	સાલદોનો માનદી અંડો,
અસો વ ...નાયનમું... ન વાયસો!	ગણે કથાં કે?
સાયા તુ હશુ એણ;	ન કે... ન કાણ... ન કાય...
કરેં તુ માણસેયાળિ !...	સાલદો ને... નાય કે પાણે?
ભાગલાલિ સાલદું સુના તુના...’	દુરીણી હેઠાં લેણુ...’
—ભાગલાલાલમું... જાનાલાલમું... જાનારાલમું...	—અને એ હેઠથા કરે!
ગૌરીપ્રસાદ જી. જાલા	ગૌરીપ્રસાદ જી. જાલા
	૨૮૧૦૧૦

- સૌપ્રથમ તો આજે દુર્લભ એવી આ બે રચનાઓ મને મેળવી આપનાર બે મિત્રોનો આભાર માનું : ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયમાં (કોરોનાગ્રસ મુંબઈમાં લાંબું અંતર કાપીને) જઈ, સેન્ટ ઐવિર્સ કોલેજના ‘રશ્મિ’ નામના સામયિકના અંકો

ફંકોળી, કાવ્યો શોધી મને મોકલી આપનાર મારા સાથી, સંસ્થાના ગ્રંથપાલ-કાર્યાલય-મંત્રી શ્રી રાજેશ દોશીનો ઉખાભર્યો આભાર. પણ એના મૂળમાં, અમને એ સામયિક સુધી પહોંચાડનાર તો સેન્ટ એવિયર્સ કોલેજ, મુંબઈના મારા અગ્રગામી, તેજરસ્વી અને સ્નેહાળ સહાધ્યાથી, ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્યના અગ્રણી નિષ્ણાત પ્રો. દીપકભાઈ મહેતાનો સાદર અને સસ્નેહ આભાર.

\*

અભાવનું કાવ્ય છે, ‘નિહિલ’નું. આધુનિક સંચેતનાનું.

(પણિતવેગાથી ભરેલી સંસ્કૃત ભાષામાં અનેક રેઢિયાળ ‘મહાકાવ્યો’ લખતા આધુનિક સમયમાં જીવતા કવિબંધુઓનાં લખાણોથી આ કાવ્ય શીર્ષકથી જ જુદ્દું પડે છે.)

‘કો નું અય્યે?’ ‘કોણ આ?’ , કવિ શીર્ષકમાં જ પૂછે છે. એ જુએ તો છે ઈશ્વરને. આમ જુઓ તો તો કવિને પ્રભુ-સાક્ષાત્કાર થઈ ગયો છે ! હાજરાહજૂર છે એમને તો ભગવાન. તેથે જેવોતેવો નહીં, હાથમાં સૂરજની ઝણહળતી મશાલ લઈને આવેલો. ગુજરાતીમાં લખ્યું છે, ‘સ્વર્ણની મશાલ’. હવે સંસ્કૃત જુઓ : ‘સહસ્રરાશિમદીપિકાં કરે વિધાય’ ! - છે ને બબ્ય ! શું કરે છે એ ? ‘પૃથ્વિનો ગોળો ફેરવે / ફેરવ્યા કરે.’ સંસ્કૃત જુઓ : ‘મંડલં ભુવૌ ભમત્યનારતમ્’ ! એક હાથમાં (દક્ષિણ કરે ?) સૂરજની મશાલ જાલી છે, બીજા હાથમાં (વામ કરે ?) પૃથ્વીનો ગોળો પકડ્યો છે. એને ગોળ ગોળ ધુમાવતો રહે છે, ઝાણ પરમેશ્વર ! રનેસાંના કોઈ માઈકલ એન્જેલો કે દ વિન્સીનું જાજરમાન બિત્તિચિત્ર, જાણે કે ! પણ સંસ્કૃત પદાવલી સાંભળો : ‘મંડલં ભુવૌ ભમત્યનારતમ્’ ! ભારેખમ ‘ભ’, ગુજરાતા અનુસ્વારો, ‘ત્ય’નો થડકો, અને પંચકલ સંધિનાં વેગીલાં આવતનો ! ‘નિશીથ હે નર્તક રુદ્ર રમ્ય’માં ગુજરાતી વાણી જે પ્રમાણ પાથરે છે એવો પ્રમાણ અહીં એક ગુજરાતી કવિ સંસ્કૃતમાં પ્રગટાવે છે ને ?

અને છતાં, સંસ્કૃત ભાષા છે, દેવભાષા છે, સાક્ષાત્કારનું જ તેજ, ગતિ અને બબ્યતાભર્યું કલ્પન છે, છતાં આ આધુનિક કવિ સ્તુતિ આરંભતા નથી, ‘નિહિલ’-સભાનતાથી જાણે પૂછે છે : ‘કો ન્વયમ્?’ ‘કોણ આ?’

કેમ એવું પૂછે છે, કવિ ? કેમ કે છે તો ઈશ્વર પણ ‘બ્યગ્ર એષ’ એ – બ્યગ્ર છે. કેમ ? કશુંક ખોવાઈ ગયું છે. કશાકનો અભાવ છે. ‘ઉત્સુકેન ચક્ષુધા નુ / કિં વિમાગયત્યયમ્?’ ‘બ્યગ્ર, ઉત્સુક આંખે શું શોધવા મશે ?’

રચનાનો પૂર્વાર્ધ અહીં સમાપ્ત થાય છે. બસ, એક કલ્પન. કેવળ કલ્પન. એજરા પાઉંડને મન વર્સી જાય એવું, ઈશ્વરની બ્યગ્ર, ઉત્સુક આંખોનું અને એના સનાયુબદ્ધ દેહની બે પ્રચંડ ભુજાઓનું કલ્પન. દક્ષિણ કરે સહસ્રરાશિ સ્વર્ણની મશાલ પકડી છે, વામ કરે પૃથ્વીનો ગોળો ધુમાવ્યા કરે છે. શોધ્યા કરે છે કશુંક. તાક્યા કરે છે એક અભાવને. કોઈ પરંપરાબદ્ધ કવિ એ સાક્ષાત્કારી ક્ષણે સ્તુતિ લલકારવા લાગે !

પણ આ અનોખો ગુજરાતી કવિ તો સવાલ કરે છે : ‘કોણ આ?’ બલ્કે, ‘ખરેખર કોણ છે આ?’ ‘કો નું અય્યુ?’

અને કાવ્યનો ઉત્તરાર્ધ શરૂ થાય છે : બ્યગ્ર ઈશ્વરની સ્વગતોક્તિ છે. લાભશંકર

ઠાકરની કવિતામાં આવે એવો અર્થનાં વલયોનું આવર્તન કરતો જાણો બબડાટ છે, સ્વયં ઈશ્વરનો પ્રલાપ, જાણો ! ઈન્ટરનલ મોનોલોગ ઓફ ગોડ ! ‘માં...ડ મેં / સજર્યો’ તો માનવી આંહીં / ગયો ક્યાં એ ?’ // ‘અહો પ્રયત્નતઃ કથં કથમ્ / ઈહાસ્તુજું તુ માનવમ્ / ગતઃ કવ એષઃ ?’ - પ્રિય વાચક, ઈશ્વરનો આ ઈન્ટરનલ મોનોલોગ જેવો ગુજરાતીમાં જામે છે, એવો તો દેવભાષામાંથે નથી જામતો, કેમ ? યુ એગ્રી વિથ મી, ઓલ ફેન્ડ ?? - બને કે ઈશ્વરની માતૃભાષા ગુજરાતી હોય ?! કેમ કે જુઓ એના નિરાશાના ઉદ્ગારો : ‘ન એ... ન આ... ન આય...’! એક પછી એક ચીજોને એ જોતો જાય છે કે કદાચ એ ચીજ માનવ હોય, જેને બહુ મહેનને એણે ઘડ્યો હતો, એક વાર...! હવે એ જ ઉદ્ગારો સંસ્કૃતમાં સાંભળો: ‘અસૌ ન... આધ્યયમ્... ન વાધ્યસૌ.’ - ચાલે, જોકે; પણ જામે નહીં ! ગુજરાતીમાં પેલાની વધી જતી નિરાશા વધારે સુરેખ અનુભવી શકાય. પણ ઈશ્વર છે, જે તે નથી. હઠીલો છે. કહે છે : ‘સજર્યો મેં... નાશ શેં પામે ? ફરીથી ફેરવી જોઉં....’

હવે આ આધુનિક, દ્વિભાષી, ગુજરાતી કવિની કસોટીની આ કાવ્યની અંતિમ પંક્તિઓ આવે છે. કવિ એમાં ભગતાણું કરી બેસે છે ? (ઉમાશંકર, દર્શક, ગાંધીજી, બધા ખુશ થઈ જાય ! પ્રભુ પણ પ્રસન્ન થઈ જાય, જો આ કવિ કાવ્યાંતે આસ્તિક થઈ જાય, ભગવાનને છેવટ ભારતમાં ભગવાન જરી જ્યો, એવી પંક્તિ લખી નાખે તો ! એ કવિ એવી ભૂલ નતી કરતા, સંસ્કૃતમાં લખતા હોવા છતાં ! આધુનિક કવિ છે; એમના ગ્રાંટરોડ સ્ટેશન પાસેના સ્વચ્છ, એકાંત ઘરમાં સુરેશ જોધી સાથે ચર્ચાઓ કરતા, મહામહિમ આચાર્ય રામપ્રસાદ બક્ષી જેમ જાલાસાહેબ પણ નવી ગુજરાતી કવિતાને હેતની નજરે જોતા, એકલતા એટલે શું એ તો જાલાસાહેબ ભરજુવાનીથી ઘરભંગ થયાથી અંતરંગપણે સુસંયતપણે જાણતા-અનુભવતા.

કાવ્યની છેલ્લી બે પંક્તિઓ જેવી ગુજરાતીમાં તેવી સંસ્કૃતમાં (દરેકમાં પોતીકી રીતે) શોભે છે :

‘ભામયાનિ મંડલં ભુવ: પુનઃ...! / ભામયત્યનારતમ્... અનારતમ્... અનારતમ્.’

— ‘અને એ ફેરવ્યા કરે !

આ કાવ્ય એ કવિએ 28-10-[19]60, એ દિવસે રચ્યું, એવી તારીખનોંથી ‘રચિમ’ સામયિકમાં છે.

તો, એ દિવસે ઈશ્વર માણસને ગોતવા માટે પૃથ્વીનો ગોળો ધૂમાવતો હતો, કેમ કવિ ? સાહેબ, તમે આજ નથી પણ, કવિ, આજેયે એ ગોળો સૂરજના તરકમાં હજ્યે એમ જ ગોળ ગોળ ઘૂમ્યા કરે છે. કઈ રીતે ? શા વાસ્તે ? પેલો દેખાયો, પેલાને ? ન જાને...

સમા, વડોદરા

૨૬ નવેમ્બર, ૨૦૨૦



### આકાશ | વર્ષી દાસ

મને એમ કે હું શાંત સ્થિર પ્રલોભક ભૂરું આકાશ છું  
અને મારી પારદર્શક હળવી કાયાથી હું ખુશ છું.  
પણ રાત પડતાં હું અંધારિયું અપારદર્શક ને ભારે થઈ જાઉં છું  
ને તેમાં ચાંદી ને તારા જગમગવા માંડે છે.

પો ફાટતાં હું કેસરવરણું થઈ જાઉં છું  
ને ધીખના બાપોરે જળહળતું પીળું.  
શું મારાં વસ્તો હું જલ્દી જલ્દી બદલી શકું છું ?  
કે પછી નિર્વસ્થ છું એટલે એકેય રંગ ટકતો નથી ?

ધૂળની રજકષો ને સૂર્ય મને રંજિત કરે છે  
ઈન્દ્રધનુષથી મને શાણગારે છે,  
ને તે અલોપ થતાં સુધી સૌ મને વખાડો છે.  
કેવું ક્ષાણભંગુર છે મારું અસ્તિત્વ !

સાચું કહું તો હું શાશ્વત અફાટ અંતરિક્ષ છું  
કેટલાંય મને આરપાર વીંધીને ચાચ્યાં જાય છે  
પછી તે પંખી હોય કે પવન,  
વિમાન, રોકેટ કે હોય ખરતો તારો...  
કોઈ પણ...  
કારણ કે હું સહુને આલિંગતું આકાશ છું.

## ભીતો | રમણીક સોમેશ્વર

ભીતો વિશે  
 કોઈ લખી લખીને  
 શું લખે!  
 પણ મારા સાહેબ,  
 કેમ ભૂલી જાવ છો તમે  
 કે  
 ભીતોના હોવા  
 અને ન હોવા વચ્ચે તો  
 સમાયેલી છે  
 આપણી આખી હયાતી  
 ભીતો હોય  
 ત્યારે તમે  
 લખી શકો છો ભીતો પર  
 મનમાં આવે તે બધું જ  
 ભીતો પર હાથ પછાડી  
 તમે  
 સાંભળીય શકો છો  
 સંગીતના સ્વરો  
 કે  
 જન્મી જવા  
 પ્રેરણા આપી શકો છો  
 તમારી અંદર બેઠેલા  
 કોઈ  
 મહાન ચિન્તકારને  
 ઓમ કરીને તમે  
 ઢારી શકો છો  
 તમારી અંદરના  
 જવાળામુખીઓને  
 કે  
 ઉછાળી શકો છો  
 કુબાડે નહીં એવા

સમુદ્રાને  
 મોટેમોટેથી બોલીને  
 (ક્યારેક બરાડીને)  
 તમે આશાસન લઈ શકો છો  
 કે છેવટે  
 ભીતો તો સાંભળે છે !  
 પણ સાહેબ,  
 એટલું યાદ રાખજો કે  
 ભીતોને કાન હોય છે  
 પણ  
 એ આમળી શકાતા નથી  
 હોય છે જ્યારે ભીતો  
 ત્યારે કેટકેટલું હોય છે  
 આપણી સાથે  
 માથે છત  
 ખૂણા-ખાંચા  
 થોડી તિરાડો...  
 બારીઓની વાત છોડો  
 બારીઓ બંધ હોય  
 અથવા તો  
 હોય જ નહીં  
 ત્યારે તો બને છે  
 આ ભીતો  
 અને  
 ભીતો હોય નહીં ત્યારે...?  
 શ... શ... શ...  
 ચૂ... પ!  
 કાન સરવા કરીને  
 ઊભી છે  
 આ ભીતો...

## બે ગજલ | ભરત વિંગ્ઝડા

### ૧. તપાસ કરો

દરેક વાતને ખોલો અને તપાસ કરો,  
હુંખોના મૂળને શોધો અને તપાસ કરો !

પડ્યા દટાઈને જમીનમાં જ ઈતિહાસો,  
કશું ન સાંભળો ખોટો અને તપાસ કરો !

કરાવ્યો કોણે અહીંયાં અસત્યનો મહિમા,  
તમે સમૂહને રોકો અને તપાસ કરો !

તમે છો એક અને તમને એવું કહેશો કે  
દરો દિશાઓમાં દોડો અને તપાસ કરો !

અહીં નથી તે બધું એ તરફ છે શા માટે,  
બધી દીવાલને તોડો અને તપાસ કરો !

તમારી વસ્તુઓ મૂકીને સામા પદ્ધતામાં,  
આ તોલમાપને તોલો અને તપાસ કરો !

કદાચ તળમાં પડી હોય છે અશુદ્ધિઓ,  
આ જળ જરાક ડહોળો અને તપાસ કરો !

### ૨. દેહનો સોદો

દેહનો સોદો કરી નાખે છે,  
જીવને નોખો કરી નાખે છે !

અન્યની વાત વધારે ત્યારે,  
એ મને ઓછો કરી નાખે છે !

સાવ સીધી ને સરળ વાતોમાં  
આવીને ગોટો કરી નાખે છે !

હોય છે ઘરમાં અને ઘરને એ,  
ગામનો ચોરો કરી નાખે છે !

કંઈ ચતુરાઈ કરીને ચહેરો,  
કેટલો ભોળો કરી નાખે છે !

સાવ સામે જે ઊભો છે એને,  
ભીત પર ફોટો કરી નાખે છે !

## બે ગીત | જિગર જોધી ‘પ્રેમ’

### ૧. અલબેલા પંખી

જાળી જાંખરાં ડાળાં

જે મળશે એમાં રે રાજુ અમે અસલ અલબેલા પંખી બાંધી લઈયું માળા

આંખોને તો વ્યાપ ગગનનો ગળથૂથીમાં પાયો

ઉડવું તો એવી રીતે કે જડે નહીં પડણાયો  
ક્યાં ક્યાં વેર્યા ટહુકાઓ જુ ક્યાં ફેલાવી પાંખો એના શું કરવા સરવાળા

થાક બાક તો ઉપરછલણું ચીતરેલું એક ટેકું

કયાંય કદી જોયું છે થાકીને કોઈ પંખી બેહું  
રાજ્યપાની પાંખો પહેરી અમે વિહારીએ કુંગર-કોતર-જરણાં-નદિયું-નાળાં.

### ૨. એવી એક ડાળખી

એવી એક ડાળખીની વાત

એક છિડો ધરતીના ભૂળ સુધી લંબાતો; બીજો નકને સાથાત્ર  
ડાળખીનાં પાન જૂલે જાણે કોઈ હિંદોળો આફૂડો આફૂડો જૂલે  
વાયુ ને વીજળી તો પાંદડાંની રેખાઓ; નિત નવા ભેદભરમ ખૂલે  
એવી એક ડાળખીએ બેહું એક પંખી ને પીંઘાંમાં દરિયાઓ સાત.

થડ તો કેમેય કરી પૂરું પમાય નહીં – જાણે વાળાઉકેલ્યો કોયડો  
કેતા રે જળની કાંઈ માયાની ભીન્યુથી બાંધેલો અભાસી ઓરડો  
ડાળીએ પાંદડાંઓ વેર્યાં તેં એમાંથી ઊંધા છે દિવસો ને રાત.

## બક્સિસ | વહીદા ફ્રાઇવર

હે મને ગાઠ નિક્રા બક્ષનારા!  
મારા સ્વજનો, મિત્રો,  
લાગતાંવળગતાંઓ  
ઊંઘ મને તાજગી આપે છે  
ઊંઘ મને નવનિર્મિત કરે છે  
હું પૂરા જોમથી ફરીથી મધ્યું છું  
કંઈક નવીન કરવા  
બધી ઊંઘ સરખી નથી હોતી  
ક્યારેક સુગર મિશ્રિત પેશાબ  
બે વાગે ખેલેલ પાડે છે  
તો વળી ક્યારેક  
સપનામાં પેઢાની ધાર પર ચાલતાં  
લથોડિયાં ખાઈને પડું છું  
ત્યારે  
જમીનના અળસિયા મારા પર ચઢે  
હું કાદવમાંથી તીમી થવા મધ્યું

સપનામાં વળી  
તાર પર લટકતી હોઉં છું  
મને ઊંચાઈનો ખૂબ ડર છે  
હું નીચે જોતી નથી  
નીચે કબ્રસ્તાન છે  
નિરવ શાંતિ  
ખુલ્લી કબરમાં મડું ઊંઘી ગયું છે  
હું હવામાં અધર ઊરું છું  
ખૂમબરાડા કરવા છે મારે  
કિંતુ અવાજ અદરથય  
કોઈની શિખામણ યાદ આવે  
રાત્રે ધુવડ અવાજ સાંભળી લે...  
....  
હું ફસડાઈ પડું છું  
ગાઠ ઊંઘમાં  
પંગ પર...

## ક્યાં છે રુચિ | રિયાજ દામાણી

પાણી આપી જાતિ પૂછી.  
વાત મને આ કાયમ ખૂચી.  
દસે દિશાએ દરવાજા છે.  
ખોલો તાણું બ્યો દઉં કૂંચી.  
અંદર જગ્યા આપે સૌને,  
એ મેરી છે સોથી ઊંઘી.  
કામ કર્યું સહુએ જોવાનું,  
કોણે, કોની આંખો લૂછી ?  
કણ કણમાં વસવાટ કરે છે,  
એની કરવી શી જાસૂસી !  
ટોળામાં જવે છે લોકો,  
અમને એમાં કયાં છે રુચિ ?

## રંગબેરંગી કુંગાઓ | યોગેશ જોણી

નાનકડા પૌત્રનો જન્મદિન;	કાપી કેક;
નભળાં ફેફસાં થડી	ખાધી, ખવડાવી સહુને
દમિયલ કૂકો મારું છું	પછી
ને કુંગામાં ભરું છું –	ટાબરિયાએ
વૃદ્ધ હવા	ફટ ફટ ફટ ફટ કોડ્યા
અને	બધાય કુંગા॥
લાકડીના ટેકે	રંગબેરંગી.
ડગુમગુ ચાલતો	કુંગામાં ભરેલી
મારો સમય...	મારી દમિયલ હવા
રંગબેરંગી	ભજી ગઈ હવામાં;
અનેક કુંગાઓ કુલાવ્યા;	ઘરમાં તો
કેટલાક કુંગા॥	ન રહ્યો એકેય કુંગાઓ
એની મેળે	કૂટચા વગરનો
જવા લાગ્યા ઉપર !	પણ
કેટલાક	હજ્યે કેટલાક કુંગાઓ
અધ્યર ઉધાણવા છતાં	રહી ગયા બાકી
આવવા લાગ્યાં	મારી આંખોમાં
ની	મારા હૈયામાં...
ચે...	
તો કેટલાક	ન વહી શકેલો
રહ્યા ત્યાં ને ત્યાં	કેટલોક સમય
સ્થિર !	હજ્યે
પછી એ બધા	બ્લોક કરે છે
રંગબેરંગી કુંગાઓથી	મારા હદ્યાની
શાંગાર્યો ડ્રોઝિંગરૂમ.	નણીઓને...
પૌત્રના	સતત
નાનકડા દોસ્તો આવી ગયા;	રાહ જોયા કરું છું –
ફુક મારીને	ક્યારે
પૌત્રે	કૂટશે
પેટાવ્યો જન્મદિન,	મારી ભીતરના
ગાયું સહુએ –	રંગબેરંગી કુંગાઓ ?!
‘હેપી બર્થ ડે ટુ યુ...’	ક્યારે ?!



## મેં તો ઘટ ઘટ હેખા સાંઈ

પ્રવીષા ગઢવી

**‘કૃયાં** ગયો બાપુ ?’ અમરાજી ગાયકવાડે ખડકીમાં પ્રવેશતાં જ પૂછ્યું.

રોજના નિયમ મુજબ ગવરીબાઈ ઓરડામાંથી તાંબાંકુંડીમાં પાણી લઈ દોડતાં બહાર આવ્યાં.

અમરાજીએ જોડા ઉતાર્યા, એવા બેસીને એમના પગ ધોતાં કહે, ‘શી ખબર ? રાજારામ હારે આ ઘડીએ બા’ર ગયો.

‘કંસારનાં આંધણ મેલો. બાપુ માટે મેં મહારાજા ગોવિંદરાવ સરકારને બે હાથ જોડી વિનંતી કરી કે મારો મુલગો અફારનો થયો. રખડી ખાય છે, તે કાં’ક ઠેકણો પાડો... તો તરત કહે, અમરાજી, તમારી સેવાની કદર મને છે. જાઓ, મુલગાને પાગાની જમાદારી આપી.’

અમરાજી ગાયકવાડ સરકારના સરદાર હતા અને એમને સાવલી પાસે ગોઠડાની જાગીર હતી. સરકાર ઝુકમ કરે ત્યારે પચીસ ઘોડા લઈ સેનામાં જવું પડતું અને કાઠિયાવાડમાં ચોથ ઉઘરાવવા કાઠી લોક સાથે ધીંગાળાં કરવાં પડતાં.

માનાજી રાવના અવસાન પછી પેશવા સરકારે ગોવિંદરાવને મુતાલિક પદ સોંઘું હતું. સતારાના શાહુ મહારાજે દાભાડેના ઉપસેનાપતિ દમાજીને સમશેર બહાદુરનો પિતાબ આપ્યો હતો. દમાજીના દાતક પુત્ર પિલાજી રાવે પેશવાની સંમતિથી ગુજરાતમાં ગાયકવાડ સરકારનો પાયો નાંખેલો.

થોડી વારે બાપુ ફરીને પાછો આવ્યો.

‘બાપુ, કાલથી તારે પાગાની જમાદારી સંભાળવાની છે.’ જૂલા પર બેઠાં બેઠાં સોપારી કાતરતાં અમરાજીએ કહ્યું.

‘જી, વરીલ.’ કહ્યું બાપુ પગે લાગ્યો. પછી આઈને પગે લાગ્યો. ગવરીબાઈએ દુખણાં લીધાં.

‘લે હાલ, જમવા બેસી જા. કંસાર તૈયાર છે.’ ગવરીબાઈએ પાટલા પાથરતાં કહ્યું.

બાપ-દીકરો સાથે જમવા બેઠા. ગવરીબાઈએ કંસારના થાળમાં ગરમ ગરમ કંસાર પીરસ્યો, પછી વાઢીમાંથી ધીની ધાર કરી એની મધમધતી સુવાસ આવી. બાપ-દીકરીએ આમટીના સબડકા સાથે કંસારના કોળિયા લીધા.

‘કાલે થોડા દિવસ માટે હું ગોઠડા જાઉં દ્યું.’ જમીને ચળું કરતાં અમરાજી બોલ્યા.

\*\*\*

બીજે દિવસે બાપુ ઘોડે ચઢ્યો. ગવરીબાઈએ કંકુ-ચાંદલો કર્યો અને અક્ષત ઉછાળ્યા. બાપુ ગયો પાગાની ચોકીએ અને અમરાજાએ પણ મૌંમાં અફીણની કાંકરી મૂકી ઘોડો મારી મૂક્યો સાવલી-ગોઠાની દિવશામાં.

બાપુને થોડા દિવસમાં સમજાઈ ગયું કે જવાબદારી કરવી કેટલી અધરી છે ! આખો દિવસ કચ-કચ અને કજિયા ચાલ્યા કરે. ચોરોને પકડી તેમની પાસેથી લાંચ લેવાની ને સરકાર સુધી પહોંચતી કરવાની. ચાદિયા આખો દિવસ કોઈની ને કોઈની બાતમી આપ્યા કરતા. કોઈ માણસ સારાં કપડાં પહેરે તો તેથી ગુનો ગણાતો અને ચાદિયા તેની છાતી પર ભારે પથ્થર મૂકી તેની પર બેસી જતા અને માણસનો દમ કાઢી દમડી પડાવી લેતા. તેમાંથી જમાદાર અને સરકારનેય ભાગ મળતો. શહેરમાં ધોળે દિવસે ચોરીઓ થતી. ચોરે ને ચૌટે ચોર-ગઠિયા બેસી રહેતા અને જતા-આવતાને લુંટી લેતા. સરકાર ચોરીમાંથી ચોથ લેતી, એટલે બાપુ જમાદાર શું કરે ? બાપુને એમાં ભાગ લેતાં જાણે રૂપિયા લોહીવાળા હોય એમ થયા કરતું. બાપુનો જીવ ફૂણો હતો. એ હુદ્દાયા કરતો પણ વરીલે માંડ ટેકાણું પાણ્યું છે, એટલે આવી કપરી જમાદારી કર્યા સિવાય છૂટકો નહોતો. બાપુને થતું જાણે ગોવિંદરાવનારાજમાં ધોળે દિવસે અંધારું હતું.

લોકોય ઝડપાળું હતા. પાહેશી ઘર ચણાવાનું લે, એટલે બાજુવાળો વાંધો પાડે જ. દોરાવા જગ્યા માટેય ઝડપો થાય. ચાદિયા પંચાતમાં પડી બેઉ પાસેથી લાંચ લે. ચણેલી દીવાલ ચાર વાર તો તોડવી પડે. બાપુને આવો કજિયાવાળો ભાગ લેતાં જીવ ચાલતો નહિ. પણ શું થાય ? જમાદારીમાં સરકાર પગાર આપતી જ નહિ. પાછો માંડ ચૌદ વર્ષનો હતો અને હજુ મૂછનો દોરો ફૂટ્યો હતો ત્યારે આનંદી સાથે પરણાવી પણ દીધો હતો. આઈ ભજિતભાવ ખૂબ કરતી પણ સોના-રૂપાના દાગીનાની લાલચી હતી અને સાચવીને કોઈમાં સંતારી દેતી.

બાપુ સાંજે ઘરે આવે ત્યારે એનું માથું પાકી ગયું હોય. કાળજાળ ગરમી અને કાળો કકળાટ. આનંદી તાંબાકુલીમાં હંકું પાણી ભરી રાખતી, તેનાથી ન્હાઈ, આનંદી પાસે માથામાં તેલ ઘસાવે ત્યારે એને ઢાક થાય.

‘આઈ, મને આ જમાદારી નથી ફાવતી. જીવ કોચવાય છે.’

‘તારા વડીલને કહેજે ને બેટા !’ ગવરીબાઈએ લુચ્યું સ્મિત કર્યું.

વડીલને કહેવાની હિંમત બાપુમાં નહોતી. જમાદારીનો કાંટાળો તાજ પહેરી રાય્યા વગર આરો-ઓવારો નહોતો !

\*\*\*

એક દિવસ સાંજે બાપુ થાક્યોપાક્યો આવ્યો હતો, ત્યાં રાજારામ આવ્યો.

‘બાપુ, દેથાણથી નિરાંત ભગત આવ્યા છે. આજે હરિવિરહનું ગાન ગાવાના છે, આવવું છે તારે ?

‘રાજારામ, મને ભજન-ભગતિમાં કાંઈ સૂઝ નથી.’

‘અરે હેંડ ને, તબલાં-મંજુરાં સાંભળીશું. મજા આવશે.’

વાળું કરીને બાપુ ગયો. નિરાંત ભગત કરજણના તાબાના દેથાણ ગામના પાટીદાર હતા. પરંતુ હળ-બળદ છોડી તંબૂરાના તાને ચઢ્યા હતા. દર પૂનમે હાથમાં તુલસીક્યારો પકી ડાકોર જતા, ડાકોરજીનાં દર્શન કરી ગદ્દગદ થઈ જતા. એમાં એક વાર રસ્તે એક મુસલમાન ફકીર દાદુ પીર મળ્યા. તેમણે હસ્તીને કહ્યું, ‘અલ્યા, ખુદા પથ્થરમાં નથી, ગેબમાં છે. આ તુલસીકુંડા કા ખોટા ભાર કર્યું ઉપાડતા હૈ?’ ફકીરજાનાં વચન એને હદ્યસોંસરાં ઊતરી ગયાં. ત્યારથી નિરાંત ભગત નિરાકાર ઉપાસનામાં વળ્યા, વારતિથિમાં આત્માનું સ્વરૂપ નિહાયું. સાખી, કુંડળિયા, જૂલણા, પદ, ધોળ, છપ્પા મનના ઊંડાશમાંથી ઊતરવા લાગ્યાં.

અમ્ભીયંદની હવેલીએ બાપુ અને રાજારામ પહોંચ્યા ત્યારે નિરાંત ભગત આવી ગયા હતા. હરિવિરહનો મહિમા ગાતા હતા :

‘ગુરુ ગોવિંદને લિભના ના જાણું  
એક જાણું મન ભાવ્યા રે...’

ધીરે ધીરે બાપુ નિરાંતની વાણીમાં તહ્વીન થવા લાગ્યો :

‘વાસનો મોટો વેશ ધરી  
સમજણ શી કરી ?  
આશ ન પરહરી ઢોંગ ધારી  
માન મોટા કરે, એટલે અનુસરે  
મનમાં કૂદાયો રે ભૂલ મારી...’

બાપુને પહેલેથી ઢોંગી લોકો ન ગમે. નિરાંત ભગત એના મનની જ વાત કહેતા હતા જાણો ! એમ બાપુને લાગતું હતું :

‘જીવનમુક્ત તો તેને કહેવાય છે  
એવા પુરુષ પરમાણું,  
વાણી જુઓ તો વિકાર નહિ  
જેમાં ઊઘડયું હીરાનું શાણું’

કેટલી સરળ બાનીમાં ઊંચી વાત ! બાપુની આંખમાં આંસુ ઊભરાણાં. દૂર બેઠો બેઠો નિરાંત ભગતનો ચરણ સ્પર્શ કરી રહ્યો.

મોડી રાતે વાણીનો વિરામ થયો. બાપુને પહેલી વાર મનની શાંતિ-અંતરની શાંતિનો અનુભવ થયો.

\*\*\*

નિરાંત ભગત જ્યારે જ્યારે વડોદરે આવે ત્યારે બાપુ અને રાજારામ જાય અને તેમની વાણી સાંભળે :

‘સાર સંસારમાં નામ નારાયણું  
કાળ પુરણ કરે ભરમ ભાગે  
જે મન ચિંતવે તે હરિ હા ભાણે  
જો જ્યે જીવ તો લંક ભાગે !

\*\*\*

‘ਬાપુ, દીવાનજી તારી ફરિયાદ કરતા હતા કે તું જમાદારીમાં ધ્યાન આપતો નથી. નિરાંત ભગતનાં ભજનોમાં પડ્યો છે, તે જમાદારીમાં તારું ધ્યાન શાનું હોય?’ અમરાજીએ ઝૂલા પર ઝૂલતાં ઝૂલતાં હોકે ગડગડાવતાં પૂછ્યું.

‘જમાદારીમાં મારો જીવ ચોંટો નથી, વડીલ !’ બાપુએ કબૂલ્યું.

‘તો બાબાશાહી રૂપિયા ધરમાં કયાંથી આવશે?’ અમરાજી હસી પડ્યા, એવો મોંમાંથી ખુમાડાનો ગોઠો બહાર નીકળ્યો.

\*\*\*

‘આઈ, વડીલને કહે ને કે મને ગોઠડાની જાગીર આપે અને આ જમાદારીમાંથી છોડાવે. જમાદારીનાં ખોટાં કરતૂત મારાથી થતાં નથી.’ બાપુએ ગવરીબાઈના ખોળામાં સૂતાં સૂતાં મોં પર પાલવ ઢાંકી કહ્યું.

‘બેટા, અમારો બાઈલોકને મોંઢે બાર બાર મણનાં ખંભાતી તાળાં લાગેલાં હોય છે. અમારું કામ તો સ્સોકું સંભાળવાનું, મંજૂસને તાળાં મારવાનાં અને બનીઠની પૈઠળી સાડી વીઠી માલવાનું હોય.’ ગવરીબાઈ ગળગળાં થઈ ગયાં.

\*\*\*

નિરાંત ભગત સંભળાવતા હતા :

‘મન મળવાનો આંતરો,  
આડી માયા મેલી.  
સઉ પાસેથી પાછું વળ્યું,  
છત તો રહી છેલી !’

‘મૃત્યુ સુધી કોણ આવે છે ? મર્યાનથી કે ધરમાંથી કાઢો... કાઢો થઈ રહે છે. નીચે સાથરો કરે છે. પરસાળમાં ઠાઠડી બાંધે છે અને ‘રામ બોલો ભાઈ રામ’ કરતાં સૌ લાકડાંભેગાં કરે છે. જે મુખ મિથાન ખાતાં તે મુખાંનિ ખાય છે !’ વાણી પઢી નિરાંત ભગત વાતે ચઢ્યા.

‘બાપુ, તું ગોઠડાની જાગીર જાય છે કે નહિ ? જી તો ધીરા ભગતને જરૂર મળજે. એ મારા શુકુ છે.’

‘મારે તો ધણુંય જવું છે પણ વડીલ માને તો ને ? મને તો પાગાની જમાદારી વસમી થઈ પડી છે. ખોટાં કામ કરવા જીવ માનતો નથી ને ખોટાં કામ કરવાં પડે છે. ના કરું તો સરકાર નારાજ થાય છે !’ બાપુએ મનની વ્યથા નિરાંત ભગત આગળ ઢાલવી.

‘સૌ સારાં વાનાં થશે, બાપુ. મનમાં મારું નામ એટલે કે નિરાંત રાખ.’ કહી હસતા હસતા નિરાંત ભગતે ઊંઠતાં ઉમેર્યું, ‘ઈમની ધરવાળી આકરા સ્વભાવની છે. તોય ‘મળો કુભારજા જો નારી જ્ઞાની માને તેને સારી !’ એમ ધીરો ભગત એને સારી માને છે. શું કરે બિચારા ?’

\*\*\*

અમરાજ અરકનો રૂપાનો ખાલો લઈ હીચકે બેઠા જૂલતા હતા. અંદરના રસોડામાંથી ગોશેત પાકવાની સુગંધ આવી રહી હતી. ગોશેત બન્યું હોય ત્યારે અમરાજ અરાક પીતા.

બાપુને ન તો હોકાની ટેવ કે ન તો પીવાની ટેવ. એની લેહ તો ભક્તિમાં લાગી હતી.

‘આ તારો નિરાંત ભગત નવરો છે તે આંતરે દા’ને વડોદરે આવે છે.’

‘પાટીદારો બોલાવે છે એટલે આવે છે અને વાણીનો લાભ આપે છે.’

‘આપણી ગોઠડા જાગીરમાં ધીરો ભગત છે, એય ગાંડો છે. કશું કમાતો-ધમાતો નથી. ગરાસની જમીનની ઊપજ પર જીવે છે. વળી ભાદરવાના ઠાકોર જતુભાએ લગનનો લાગો કરી આપ્યો છે, તે બેઠો બેઠો રોટાલા ખાય છે અને કાંઈક કાફીયું જેણું લખી વાંસની ભૂંગળીમાં બંધ કરી મહીસાગરમાં વહાવે છે તે કંઠે નહાતું-ધોતું-ઢોર ચારતું લોક તરતી ભૂંગળી ઉપાડી લે છે અને એની કાફીયું વાંચે છે-ગાય છે.’ અમરાજને અરાક ચઠ્યો હતો. એટલે ખુશ હતા.

‘વીલ, મારે ધીરા ભગતને મળવું છે.’ બાપુએ હિંમત કરી.

‘બાપુ, મને એમ થાય છે કે હવે ગોઠડાની જાગીર તું સંભાળ. આ જમાદારી તને ગોઠતી નથી, તો છોડી દે. હું વડોદરે રહી રાજભટપટમાં પહું, કાં મહેલ મળશે કાં કેદ!’ અમરાજ હસ્સી પડ્યા. ગાયકવાડ સરકારમાં સરદારો માટે કેદ કે મહેલની નવાઈ નહોતી.

બાપુ તો આ સાંભળી રાજીના રેડ થઈ ગયો. એને તો જાણે ગોળપાપડીનો થાળ મળ્યો. બાપુને ગોળપાપડી પ્રિય હતી.

\*\*\*

ગોઠડા હવેલીએ પહોંચી, બાપુ સીધો ધીરા ભગતના ખોરડે ગયો. ધીરો ભગત ત્યારે પાટલી પર કિતાથી કાગળ પર કાફી ઉતારતા હતા.

‘ધીરાજુ, હું અમરાજ ગાયકવાડનો મુલગો, બાપુ. નમસ્કાર!’

‘ઓહોહો! અમારા જાગીરદારનો દીકરો મારે આંગણે! ધન ધરી ધન ભાગ! સાંભળો છો સવિતાભાઈ, અમરાજના દીકરા બાપુ ગાયકવાડ આવ્યા છે. કળશ્યો પાણી લાવો.’ ધીરા ભગતે સાદ પાડ્યો.

‘હમણાં હું નવરી નથ. વલોણું કરું છું. તેઠીને જાતે લઈ લ્યો!’ ઓરડામાંથી કર્કશ અવાજ આવ્યો.

‘હરિ હરિ...!’ બોલી ધીરો ભગત તેઠીને અંદર ગયા અને કળશ્યો પાણી લઈ આવ્યા.

‘નિરાંત ભગતે આપને મળવા કર્યું હતું.’ કળશ્યામાંથી ઊંચેથી પાણી પીતાં બાપુએ કહ્યું.

‘હા, એય અખેદાસ જેવા છિપ્પા અને મારા જેવી કાફીયું રચે છે.’

‘અત્યારે શું લખો છો?’ બાપુએ પૂછ્યું.

‘ક્રોપદી વખાહરણ આખ્યાન લખું છું. ભરસભામાં પાંચાલીને કૌરવોએ નાગી કરેલી.’

‘લોક કહે છે કાંઈ તો ધીરાની.’ બાપુએ હાથ જોડ્યા.

‘હા, સરકાર, કંઈ કેટલીય કાંઈયું મહીસાગરમાં વહાવી દીધી.’

‘હા, પણ એ મહીકાંઠાના વેર વેર જીવતી છે, રમતી છે ભગત!’ કહી બાપુ ગાવા લાગ્યો,

‘તરણા ઓથે કુંગર રે  
કુંગર કોઈ દેખે નહીં..’

ધીરા ભગત હસી પડ્યા.

‘મને ઘણી કાંઈયું મહોંકે છે.’ કહી બાપુએ બીજી કાંઈ ગાવા માંડી -

‘ખબરદાર મનસુભાળ,  
ખાંડાની ધારે ચઢવું છે;  
હિંમત હથિયાર બાંધી રે,  
સત્યની લડાઈએ લડવું છે.’

‘ભગત, કાઈઓ સામે લડવું સહેલું છે, પરંતુ સત્ય કાજ લડવું અધરું છે હોં!’  
બાપુએ કબૂલ્યું.

ધીરા ભગત હસતા રહ્યા. ત્યાં સવિતા બહાર આવી.

‘સવિતાબાઈ, આ બાપુ ગાયકવાડ, અમરાજના પોતરા.’

‘તે જાગીરદાર આપણે આંગણે પધાર્ય છે તો કાંઈયું સંભળાવવાના બદલે કાં’ક  
વધારો માગો.’ સવિતા એના સ્વભાવ મુજબ બોલી.

‘રૂપિયે આનો વધારો, બસ આઈ! બાપુ હસી પડ્યો.

‘ભગત, ભૂંગળીઓ તૈયાર હોય તો આલો, હું મહીસાગર બાજુ જાઉં છું.’ બાપુએ  
ગુઠતાં કહ્યું.

આજની ગુતરી છે, સાંભળો :

‘આત્મતત્ત્વ શોધો રે,  
જ્ઞાનીજન ગોતો ધરમાં;  
બોલે તે નહિ બીજો રે,  
ઓળખી લેજો અંતરમાં.’

ધીરા ભગતે કાગળની ભૂંગળી વાળીને વાંસની ભૂંગળીમાં મૂકી અને ઉપર દાટો  
માર્યો. પછી દીવાની જ્યોતથી લાખ ચોંટાડી અને ભૂંગળી બાપુને આપી.

\*\*\*

વળી થોડા દિવસ પછી બાપુ ભગતના ખોરડે ગયો, ત્યારે ધીરા ભગત પાસે કોઈ  
બેહું હતું અને સવિતા ગુર્સે થઈ બોલતી હતી, ‘બેંસ વહૂકી જવા આવી છે અને જે આવે  
તેને માટે દૂધનો ઉકાલો માંગો છો. કામધંધો કરવો નહિ ને ગાંઠના ગોપીયંદણ...’

‘ચિતા ન કરો, આઈ. સાંજે દૂધાળી બેંસ આવી જશે!’ બાપુએ હસતાં હસતાં કહ્યું.

‘આવો, આવો, જાગીરદાર સાહેબ. પણ ભગતે આ કાફીયુંથી ચોપડા ચીતર્યા ઈના કરતાં વહીવંચાના ચોપડા ચીતર્યા હોત તો, બે દોકડા મળત.’ સવિતાએ છણકો કર્યો.

‘આઈ, ભગતને કાફીયું લખવા દો. બધુંય ભુલાશે પણ એ નહિ ભુલાય. ભદરવાનો લગનનો લાગો હવેથી બમણો, બસ!’ બાપુએ સવિતાને શાંત પાડી.

‘બાપુ, આ વીરો ભગત ગોકડા, વાંકાનેરના છે. એમણે ‘બખુવાહન આઘ્યાન’ રચ્યું છે, તે સંભળાવવા આવ્યો છે.’ ધીરા ભગતે વીરા ભગતનો પરિચય આપી વીરા ભગતને કહ્યું, ‘આ બાપુ ગાયકવાડ. ભક્તિભાવવાળા જાગીરદાર છે.’

વીરા ભગતને ટેટલાંક કડવાં સંભળાવ્યાં. પછી બીતાં બીતાં બાપુએ કહ્યું, ‘ભગત, મને એક પદ ઉતરી આવ્યું છે તે સંભળાવું?’

‘અરે વાહ! વાહ! જરૂર!’ ભગતે પડાયે પડેલા પખવાજ પર થાપ મારી.

‘વિષ્ણુ બિસ્તિમલ્લામાં ભેદ નથી ભાઘ્યો,  
અલખ અલખ એક લહીએ રે...’

‘અહાદા! બાપુસાહેબ, રામ અને રહેમાન, અલ્લા અને ઈશ્વર બધું એક જ છે, એમ મારા ગુરુજી જીભાઈ શાક્ષીજીએ સમજાવેલું. વેદાંત એમ જ કથે છે. બ્રહ્મ નિરાકાર છે અને સર્વત્ર વ્યામ છે.’ ધીરો ભગત ખુશ થઈ ગયા.

‘છાપ, તિલક ને માળા રાખે, કૂડકપટ ને અસત ઘણું ભાખે.’

\*\*\*

‘સુણો સુણો તમે બામણ લુખા ખાખ, રવડી રવડી લુવો શું કાખ ?’

\*\*\*

‘આ લો, બાપુસાહેબ, કુલેરના લાડુ ખાઓ. આજે નાગપાંચમ છે.’ સવિતા બાપુસાહેબ પર ખુશ થઈ ગઈ હતી.

\*\*\*

બાપુ જમીનદારીના કામકાજમાંથી નવરો પડે કે પદો ઉતારવા બેસી જાય :

‘શાંતિ પમાડે તેને સંત કહીએ રે...  
એના દાસના તે દાસ થઈને રહીએ રે ભાઈ...’

\*

‘હરિગુણ ગાય તેને હરિ જેવા જાણો રે...’

\*

‘રામનામ લેહ લાગી રે...’

થોડા દિવસ થાય અને પદો સંભળાવવા ધીરા ભગતને ખોરડે પહોંચી જાય.

‘લ્યો આઈ, આનંદીએ ચિરોટે મોકલ્યા છે, તે ચાખો.’ બાપુએ વાંસની ટોપલી સવિતાને પકડાવી. સવિતા ચિરોટે ચાખીને તરત બોલી, ‘આ તો જાણો અમારાં કચ્છી ખાજાં!’

‘બાપુ, આ મારી કાફી ચાખો!’ ધીરા ભગતે હસીને તંબૂરો જાલ્યો.

‘મૂરખ કહે મેં માયા મૂકી,  
ત્યાગ કરો સંસાર;  
માયા તાં સુધી કાયા રહેશે,  
સંગે સરજાળ હાર.  
કાયા વડે ધીરા રે, માયા વસ્તુ જડે.’

‘વાહ! ધીરા ભગત! વાહ! જવીએ તાં સુધી માયા રહે છે, સાચી વાત છે.’ બાપુ આફિરીન થઈ ગયો.

‘બાપુસાહેબ, તમે કંઈ લાવ્યા છો?’

‘જી, ભગત. સાંભળો :

‘ગુરુજી, તમે કો’છો રે,  
બ્રહ્મ તારી પાસે વસ્યો;  
મને નવ દીસે રે,  
કયાં વસે એ તો રસ્યો.  
માથું બ્રહ્મ કે બ્રહ્મમાં માથું ?  
બ્રહ્મમાં આંખ કે આંખમાં બ્રહ્મ ?’

— ધીરા ભગત હસી પડ્યા અને બાપુને ઘબ્બો માર્યો. ‘બ્રહ્મ પામવું, સમજવું મુશ્કેલ છે, બાપુ!’

‘નાકમાં વસિયો કે મુખમાં ?  
એ વિશે મુને થાય ભ્રમ!  
સંશોનિવારો રે,  
ભ્રમમાંથી જાઉ ખસ્યો !’

બાપુ ગાયકવાડે પદ પૂરું કર્યું.

‘બાપુસાહેબ, મને ઘણી વાર થાય છે કે આ બ્રહ્મ એક ભ્રમ જ છે!’ ધીરા ભગતે ઊભા થતાં કહ્યું.

\*\*\*

અમરાજીએ થોડા વર્ષ પછી બાપુને વડોદરે સરદારી કરવા બોલાવી લીધો. વડોદરાની ગાદી પર હવે આનંદરાવ આવ્યા હતા. અમરાજી જમાબંદીના સલલાકાર (સલાહકાર) થયા હતા. ધીરો ભગત મોક પાયા હતા. નિરાંત ભગતને અવસ્થા થઈ હતી એટલે વડોદરે આવવાનું ઓછું થયું હતું. હવે બાપુને સૌ ભજન-કીર્તન માટે બોલાવવા માંડ્યા હતા. ધીરા અને નિરાંત ભગતનું સ્મરણ કરી બાપુ પહેલું પદ ગુરુતર્પણનું ગાતો :

પરથમ સદ્ગુરુનો સત્યંગ સાચો,  
બીજો જે કરો તે કાચો;  
હરિનામ ભૂલ્યા એ જ પડ્યો ખાંચો,  
માટે તમે સદ્ગુરુને નિશાદિન જાચો.’

પછી એક પછી એક ભજન તંબૂર-જાંડ-પખવાજના તાલે ઊપડતાં :

‘ભમ જળ ભાગો રે, તો પામો મુક્તિને.  
ભમ કાઢી નાંખો રે, જણાવું જુક્તિઓ.’

\*\*\*

‘હરિને પાણાણ કહે તે જ ગાંડો  
એ તો સદા છે અખંડ ને ના થાય ખાંડો.’

\*\*\*

‘અખંડ એક આત્મા રે, બીજું બાકી સર્વ ધૂળ.’

\*\*\*

‘માળાનો મર્મ નવ જાણો, આંખો મીંચી મણકા તાણો.’

\*

મોરી રાતે હવેલી આવીને બાપુ સૂર્ય જતો.

\*\*\*

એક હિવસ બાપુ કચેરીએ બેઠો હતો, ત્યાં અંત્યજ વાસમાંથી થોડા લોકો આવ્યા. ‘બાપુસાહેબ, આપની વાણી સાંભળવાનો લ્હાવો લેવો છે. અમારા મોલ્લાની બહાર ચોક જેવું છે, ત્યાં આપ પધારો એવી વિનંતી છે.’ અંત્યજો હાથ જોડી ઊભા રહ્યા. સૌએ ટૂકી પોતડી અને ફાટેલી બંડીઓ પહેરી હતી, માથે ચીંથરા જેવી પગડીઓ બાંધેલી હતી.

‘બહાર ચોકમાં શું કામ ? આપણા મોલ્લે હું આવીશા.’ બાપુ હસ્સી પડ્યા.

‘ના, બાપુસાહેબ ! આપણા ધરમનું રસાતાળ જાય અને અમે પાપમાં પડીએ !’ અંત્યજોએ ફરી હાથ જોડી પગડી ઉતારી.

‘અરે મારા ગાંડા ભાઈઓ, ધરમનું રસાતાળ નહિ જાય, ધરમ ચોખ્ખો થશે. હું ધૂતાધૂતને દોષ માનું હું. મારે મન સર્વ જીવ બ્રહ્મસ્વરૂપ છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી.’ બાપુએ હસ્સીને કણું.

અંત્યજો રાજુ થઈને ગયા.

સાંજે અંત્યજોના મોલ્લામાં આવેલા વડના ઓટલે બાપુ સાથે રાજારામ અને નરભેરામ તબલાં, તંબૂર, મંજુરાં લઈને આવ્યા. બાપુએ તંબૂરો હાથમાં લીધો. ગુરુવંદના કરી ભજન ઉપાડ્યું :

‘ઊંબાડિયું એક હાથમાં લેઈ  
કેરવે બાળ અપાર

અજિનયક નહિ પણ ચક દેખાશે  
મિથ્યા એ વિચાર  
ભમ છે એવો રે  
ભજો નવ ભક્તિને...’

\*\*\*

‘ભાઈ રે, હરિનામની ટેક તમે જાલો રે,  
બીજું ભૂષયાંને ભોજન આલો રે...’

\*\*\*

‘ભડી ભણીને શું ભડીએ રે,  
ભાઈ, ભણવાનો કોઈ પાર નથી.  
મૂળ વિદ્યાને કોઈ ના જાણો,  
ધડ્યા ભડોલા મુવા નથી.’

મોરી રાત સુધી ભજન ચાલ્યાં. અંત્યજો ગદ્ગાદ થઈ વાણી ઝીલતા રહ્યા.

છેલ્લે બાપુએ ભજન ઉપાયું :

‘આરતી કીજે અંતરમાંદી,  
મેં તો ઘટઘટ દેખા સાંદ્ય...’

‘વા! બાપુસાહેબ! વા! સાંદ્યસાહેબ તો ઘટઘટમાં બિરાજે. સચ વાત કીધી, સરકાર!’  
સૌ અંત્યજો ઊભા થઈ તાલીઓ દેતા નાચવા લાગ્યા.

\*\*\*

અમરાજ સાંજે રોજની જેમ રૂપાના પ્યાલામાં અરાકનો ધૂંટ લેતા અને હુક્કાની નેહમાંથી ફૂકું દેતા બેઠા હતા.

‘બાપુ, મેં સાંભળ્યું કે તું કાલે રાત્રે અંત્યજોના મોહ્લામાં ભજન કરવા ગયો હતો.’  
‘હા, વડીલ.’ બાપુએ ડોકું હલાવ્યું.

‘આખું જગત ચાંભાડોથી અભડાય છે. પુણેમાં તો ઈમનો કોઈ પડ્છાયોય લેતું નથી. ગળે કુલડી અને પૂઠે ઝડુ રાખવાં પડે છે ને તું એવા લોકના મોહ્લે ગયો ને ઈમનાં પાણી પીધાં?’

‘વડીલ, બ્રહ્મવિદ્યામાં એવા કોઈ ભેદભાવ નથી. સૌ આત્મામાં પરમાત્મા વસ્યા છે. ઈના રાજમાં કોઈ ઊચિનીય નથી. આ તો પેશવાઓનો ઘમંડ છે.’

‘બાપુ, ઈ લોક ચામડાં ચૂંધે, ઈમને નોં અડાય, સમજાયો?’ અમરાજ હીંચકા પર ટહ્હાર થયા. એમની તલવાર જેવી મૂછો ફરકવા માંડી.

‘આપણે ગોશેત કર્યાં નથી ખાતા વડીલ? ને મચ્છીમારથી કેમ અભડાતા નથી?’  
બાપુએ દલીલ કરી.

‘બાપુ, હવે તું અભડાઈ ગેલો કહેવાય. મારાથી તને આ હવેલીમાં કે જાગીરમાં નહિ રખાય. તું બીજું ધર શોધી લે, કાં આવા ઉધામા બંધ કર.’ અમરાજને અરાક ચઢી

ચૂક્યો હતો. ત્યાં ગવરીબાઈ આવી ચઢ્યાં.

‘ના, ના, એવો જુલમ મત કરો.’

‘અરે, તારો વિઠોબા અભડાઈ જશે!’

‘રાખો હવે, વિઠોબાના આંગણામાં જ મહાર ચોખામેળાનાં હડકાં દાટ્યાં નથી ?’  
ગવરીબાઈની જ્ઞાન ખૂલ્યી ગઈ.

બાપુ એકદમ ઊભો થઈ ગયો, ‘વડીલ, આપની હવેલી અને જાગીર આપની  
પાસે રાખો. હું અંત્યજોના મોહ્લામાં ઝોપડી બાંધીશ અને રહીશ.’

‘અમે બગડ્યા, અમે બગડ્યા લેજો, જાણી રે...’

એવી પોતાની કરી સંભળાવી બાપુ સડસડાટ ખડકી બહાર નીકળી ગયો.

ગવરીબાઈ ખડકીની બારસાએ માથું પછાડી રડવા લાગ્યાં. આનંદી પણ રડતી  
રડતી દોડીને આવી અને એમને બાથમાં લઈ લીધ્યાં.



ગુજરાતી સાહિત્ય પરિષદનું  
નવું ઈ-મેઈલ આઈડી

gspamd123@gmail.com

‘પરબ’ માટે ઈ-મેઈલ આઈડી

‘પરબ’ માટે કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકાશે. ‘પરબ’નું ઈ-મેઈલ આઈડી :

parabgsp@gmail.com

કૃતિ નીચે નામ, સરનામું લખવા વિનંતી.

## નવપરિણીત પેલાં : એકત્વથી પૂર્ણત્વ પ્રતિ

ચંદ્રકાન્ત શેઠ

### નવપરિણીત પેલાં

નવપરિણીત પેલાં

બે ચાલ્યાં જતાં જોડાજોડ,  
ક્યારેક વળી આગળપાછળ ચાલે,  
ભીતર એવાં એકમેક મહીં લીન, જાણો  
ચાલ્યું જતું એક.

એમની દાસ્તિ પડચેથી તડકો ચમડી ઊઠ્યો,  
આકાશ હાસભર્યું ઊંડો ઊંડો ઉઘાડ કાઢી રહ્યું.  
ધરા દીસે તૃણેતૃણે પુલકિત  
વૃક્ષોય તે જાણો હમજાં ઓ ડોલી ઊઠ્યાં.

આંખો એકમેકની આંજયે જતાં આંખોથી જ.  
વચ્ચે વચ્ચે ઊંડો – આકાશઊંડો પ્રશ્ન ક્યારેક ટીકી રહે :  
'તું તાંડું કોઈ સત્ય શોધે છે મારામાં ?'  
'તું જ માનું સત્ય...' નમી, નીચેથી પુષ્પ ચૂંટી બોલી, 'આ પુષ્પને પૂછ.'  
'શોધ એ જ સત્ય...'  
વહેળો ઓરંગાતી કેડી એને દૂર કશે તેડી ગઈ.

પડખેથી પતંગિયું ઉતાવણું એક ઊડી ગયું,  
ચિછી જાણો વસંતની ફરકી ગઈ—  
આ રીતે ચાલ્યાં ન જવાય ગુમસૂમ, જરી આમતેમ  
દાસ્તિ તો કરી જો. શોધે છે તું...? શું...?  
જોને તે જરીકમાં વિશ્વ બહું ગૂંગાળાવ્યું.  
શું કરીશ ? — આ મૌનનો ઝૂમો... ભલે છૂટે  
કાન પર રૂમનૂમવા ટેને જરી એને.  
આંખોની પાંપણોને સ્પર્શી છો જતી ધસી પર્વ આકૃતિઓ.  
ફોરમોની વીજા બજી રહી છે લોહીવહેણમાં ભળવાને.  
કિરણોનો સ્વાદ રોમ રોમ ભલે લઈ લે જરી,  
લહરીની લટને પંપાળી લે.  
ઇન્દ્રિયોથી પી લે વિશ્વ.

ભરી લે ભીતર તારી વિશ્વ બધું.  
કુતગિની પાછો ફરી ખોબોએક ફૂલ ધરી, બોલ્યો :  
‘કયાં શોધું ? તું જ...?’

નીચે વહેળાના બણોળા ધરામાં  
ભેખડની છાયામાં તરતા સરતા સહેલતા હંસયુગલને  
શુંધ સૂર્યદું, ખીણે ચ્યમકાવી દેતા કકડાટથી ઊંચે ઊડદું,  
ફેલાતી-વીજાતી સફેદ પાંખોથી અવકાશ ભરાઈ ઊઠાં,  
તડકાની વેલ પર ઊંડતા ધવલ ધવલ ફૂલના ગુઢ્ય.

એક શુશ્રે પ્રતીતિથી પ્રણાયીઓનાં નેત્ર વિશ્વસત  
વિસ્ફારિત. – જાણે સ્વયં સર્વત્ર વ્યાપી રહ્યાં. વચ્ચે ત્યાં  
મૂંગા મૂંગા પ્રશ્ન ફોર્ઝી કરે : ‘આ સો અનેક  
તે જ તું એક ?’ શું આપણે એક તે જ આ...?’

વિશ્રાન્તિની કાણે ક્યારેક જાણે થતું –  
અંદરથી કોઈકે કમાડ ઠોક્યાં.  
બધાર જ જાણે ન હોય સવસ્વ.  
આંખો હવે જોયા કરે આમતેમ ઊલટથી  
સર્જનના પ્રથમ પરોછે જેવી પ્રભુની ઠરી.  
કાન હવે એકધ્યાન સુણી રહે  
મૌનનો ગંભીર શાસોઅધ્યવાસ.  
હાથ સ્પર્શે બારણાને, ખુરશીને, છોડને, હવાને  
જાણે કોઈ માનવીને – માર્દવથી, આર્જવથી.

વિશ્વ આખું રસી દીધું; એકરસ લોહી સાથે –  
મજજા સાથે કરી દીધું.

દૈત કષણાંશ તો શમી જતું :  
પંચમહાભૂત પંચમહાભૂતને મળે,  
પ્રાણો પ્રાણોમાં ઢોળાય,  
મન મનમાં સમરસ છલકાય,  
પરસ્પરાનુભવ અને નિજાનુભવ,  
આનંદ – પ્રતિબિંબતો આનંદ.  
અરેરો તોયે બટકણું છટકણું અદૈત એ.  
બાથમાં તોય અલગ, સાથમાં તોય દૂર, ક્યારે ક્યારેક...!  
બેનાં બે. બેનાં ત્રણ ચાર... ચારનાં બાર... પણ બેનાં બે !

શરીરનો તાગ લીધાં કર્યો છે માનવીએ યુગોમન્વન્તરોથી.  
હાથતાળી દઈને શરીર સરકી જાય. શરીરનું કોતુક ભલે  
માનવીને પશુથી તિર્યગ્યોનિથી ઊંઘો ઊતરતો દાખવે;

જનનમાં કલમો કરી મહામાનવો નિપજીવવા એ  
મથે ભલે ભાવિ સાથે સુપેરે એકસૂત્ર થવા;  
પ્રાણ્યની દીક્ષા એસ્તો માનવીની જીવનની દીક્ષા, માનવ્યની દીક્ષા.  
નહીં તો દુનિયાની અર્ધા વસ્તી પ્રત્યે હોત એની કૂણી દટ્ઠિ ?  
ભૂતથી છૂટી, કોડભરી જહેમત અને ઉઠાવત ભાવિના સર્જનની ?

ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જણાં, એક ધરતી ને બીજાં આભ...

નવપરિષીત પેલાં  
બે જે ચાલ્યાં જતાં પણો  
ભીતર એવાં એકમેક મહીં લીન  
જાણો ચાલ્યું જતું એક.

ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જણાં...

આકાશ અને પૃથ્વીના આદિયુગલનાં આ વારસોએ શું  
તર્જનીએ તર્જની ગુંથી (જે કોઈ વાર પરસ્પર બતાવાઈ પણ હશે સ્તો !)  
એકમેક-શું આનંદ-ધૂમરીઓ લઈ—  
બંનેએ અસીમ કાળમાં હમેશા માટે કંગળાઈ જવાનું ?  
કદાચને સમાન્તર...! મળવાનું, હા, અંતે મળવાનું અનંતમાં.

બેનાં બે ! એકત્વ પૂર્ણ બંનેનું અન્ય એ એકમાં !

પ્રત્યેક પૂરેપૂરું એક બને,  
તો જ પૂરું જામે બંનેનું એકત્વ.  
પ્રત્યેક જણ સાત ડગ પોતાની સાથેય તે  
નહીં ચાલે કયારેક ને કયારેક ?—  
આત્મા તો રાવિકા...  
સાત ડગ પ્રભુની સાથેય તે  
પ્રત્યેક નહિ ચાલે શું કયારેક ને કયારેક  
નવપરિષીત પેલાં  
બે જે ચાલ્યાં જતાં પણો...?

- ઉમાશંકર જોશી

**આપણા** પ્રાજ્ઞ કવિ ઉમાશંકર જોશીના ‘સમપદી’ના કાવ્યસંપુટમાનું ત્રીજું પગલું  
તે ‘નવપરિષીત પેલાં’. એ પદનું આપણે જીવન તેમ જ જગતની વ્યાપક ભૂમિકાને  
ખ્યાલમાં રાખીને જોવા-સમજવાનું રહે.

સર્જન તથા વિસર્જન – આ બે બિન્હુઓ વર્ણે વ્યામ મનુષ્યની આત્મચેતનાની –  
એનામાંની પરમાત્મ-ચેતનાની લીલામય ગતિના રસ-રહસ્યને અવગત કરવામાં કોઈ  
પણ સાચા સર્જકને ઊરી નિસબત – ઉત્કટ દિલચસ્પી હોવાની જ. ઉમાશંકર એ કોટિની

સર્જક-પરંપરાના પ્રશિષ્ઠ કવિ. ‘સમપદી’ની એમની કવિતાનું શુષ્વ-કેન્દ્ર છે ‘એકદેન્દ્ર વ્યક્તિત્વનું ગઠન-ગ્રથન’. વાસ્તવિક જીવનમાં કઈ રીતે સિદ્ધ થતું હોય છે તે પ્રકિયાના નિરૂપણનું – આ સંસારમાં માનવીય સંબંધોમાં અને તેમાંથે સ્નેહજીવનના – લગ્નજીવન કે દાંખ્યત્વજીવનના સંદર્ભમાં અવગાહત કરતાં કવિને જે કઈ ‘શુભ’ ને ‘શુભપ્રતીતિ’ થઈ તે અભિવ્યક્તિ પામી છે અહીં ‘નવપરિષીત પેલાં’માં.

ઉમાશંકરે ૧૮૮૧માં આપેલી સાત પદરચનાઓમાંની પહેલી બે રચનાઓ ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ અનુક્રમે ૧૮૮૫ અને ૧૮૮૮માં પ્રગટ થઈ. તેમાં વિષયવસ્તુથી માંડીને તેની રજૂઆતની શૈલીમાં – તેની ભાષા-લયની ઈભાદતમાં તેમની સર્જક-પ્રતિભાએ જે અવનવા પ્રયોગો કર્યા છે તેની તાજળી આપણે માણી શકીએ છીએ. એ જ પરંપરાનો નિર્વાહ થયો છે પશ્ચાદ્વર્તી કાવ્યોમાં.

૧૮૭૧માં કવિ કારમીર ગયા ત્યારે ‘નવપરિષીત પેલાં’ની આરંભની કેટલીક પંક્તિઓ તેમણે ટપકાવેલી. ‘એકદેન્દ્ર વ્યક્તિત્વના ગઠન-ગ્રથન’માં એક સર્જક તરીકેનું પોતાનું કિયાકર્મ કઈ રીતે કલાકીય આયામો સિદ્ધ કરે એ એમની ખોજ હતી. એ ખોજ ‘શોધ’ કાવ્યમાં તો છે જ, અન્ય કાવ્યોમાંથે એનું પ્રયોગ રીતિનું પ્રવર્તન – એનું પગેસું જોઈ શકાય.

‘નવપરિષીત પેલાં’ કાવ્યમાં શરૂઆતમાં તો જોડાજોડ ચાલ્યા જતા નવપરિષીત યુગલને કવિએ ‘પેલાં’ કહીને આંગળી ચીધીને બતાવ્યું. તે પછી તેઓ બંને એકબીજામાં ડેવાં લીન છે, બે મળીને એક થયાની ડેવી વિસ્મયમધુર ઘટના તેમની બાબતમાં ઘરી રહી છે તેનું પણ સંયત વાણીમાં નિરૂપણ કવિએ કર્યું છે. તેમાંથી પેલાં નવપરિષીત યુગલનું સાયુજ્ય ઈહલોકની – સૃષ્ટિ સમસ્તની ડેવી આવકાર્ય ઘટના છે તેનો સંકેત પણ આપણને મળી રહે છે.

દાયોદાય મળતાં જે મૌનમધુર સ્નેહસંલાપ થાય તેનો સંદર્ભ અહીં કવિ પોતાની રીતે રજૂ કરે છે. કવિ કહે છે :

‘આંખો એકમેકની આંજ્યે જતાં આંખોથી જ.

વચ્ચે વચ્ચે ઊડો – આકાશઊડો પ્રશ્ન કારેક ટીકી રહે :

‘તું તારું કોઈ સત્ય શોધે છે મારામાં ?’

‘તું જ મારું સત્ય...’ નમી, નીચેથી પુષ્પ ચૂંટી બોલી, ‘આ પુષ્પને પૂછ.’

‘શોધ એ જ સત્ય...’

(સપ્તપદી, ૧૮૮૧, પૃ. ૨૩)

નિસર્ગની મીઠી નજર હેઠળ સ્નેહી યુગલની સહજીવનની યાત્રા ચાલે છે અને તે સાથે કવિદ્યિના ચમકારા પણ.

કવિ એક પતંગિયાને ઉતાવળથી આવીને ઊડી જતું નિહાળે છે. તુરંત કવિ ઉત્પેક્ષા કરે છે : ‘ચિદ્ધી જાણો વસંતની ફરકી ગઈ.’ કવિ નવપરિષીત યુગલ સૃષ્ટિના સ્નેહ-સૌંદર્ય પ્રતિ ખુલ્લું રહે તેવી ખેવના વ્યક્ત કરતા લાગે છે. સ્નેહના બળે આ સમસ્ત સૃષ્ટિનો મનભર સ્વાદ લે એવીયે કવિની ભાવના જણાય છે. તેઓ સ્નેહજીવનની બુનિયાદમાં

શરીરનું-સર્વ ઈન્ડ્રિયોનું કામ પણ મહત્વનું હોવાનું દર્શાવે છે. તેઓ ઈન્ડ્રિયગ્રાવ્યતા તેમ જ ઈન્ડ્રિયવ્યત્યની રીતિનો પણ પ્રકૃતિવર્ણનમાં લાભ લે છે; એટલે તો ‘ફોરમોની વીજા’, ‘કિરણોનો સ્વાદ’, ‘લહરીની લટને પંપાળી લે’વાનું અહીં બની શકે છે ! આ વિશ્વમાનવતાના અને વિશ્વતોમુખી કવિ ઈન્ડ્રિયોથી વિશ્વને પી લેવાની અને એ રીતે ભીતરને સભર કરવાની વાત કર્યા વિના રહી શકતા નથી.

વિશ્વસમસ્ત સુંદર અને આકર્ષક છે રનેહ અને સંવાદિતાને કારણે. આપણી આ સચરાચર સૂચિમાં એવા તત્ત્વોનું લીલામય દર્શન અવારનવાર થયાં જ કરતું હોય છે. અહીં કવિએ સાભિપ્રાય હંસયુગલ પ્રસ્તુત કર્યું છે. હંસયુગલના પદછે પેલાં નવપરિણીતોનું આત્મયુગલ પણ સૂચવાય છે. હંસયુગલની ઊંડાણ વર્જવતાં કવિ કહે છે :

‘ફેલાતી-વીંઝાતી સફેદ પાંખોથી અવકાશ ભરાઈ ઊઠ્યો,  
તડકાની વેલ પર ઊધડતા ધવલ ધવલ ફૂલના ગુઢ્ય.’

(સમપદી, પૃ. ૨૪)

અહીં કવિકર્મની સભાનતા સાથે કલ્પનલીલાની તાજગી ને ચમત્કૃતિનો સ્વાદ પણ માણવા મળે છે. હંસયુગલના ઉડ્યને અવકાશમાં જે શુભ્રતાનો પ્રકાશ પ્રસર્યો તેણે તો કવિની પ્રતીતિને પણ ‘શુભ્ર’ કરી દીધી ! આવી શુભ્ર પ્રતીતિથી પ્રાણીઓનાં નેત્ર વિશ્વસ્ત ને વિસ્ફારિત હોવાનું કવિ દર્શાવે છે. વળી જેની દાખિમાં પ્રાણી હોય તે તો અનેકતામાં એકતામાં અનેકતાનું દર્શન કરવાની ક્ષમતા પણ સહજતયા જ દાખવી શકે ને ?!

કવિને વળી ભાવ-વિશ્વાન્તિની ક્ષણે કોઈક અંદરથી કમાડ ઠોક્યાં હોય એવું લાગે છે. કવિને પ્રાણીની હવામાં અંદર-બહારનું બધું એકાકાર થતું લાગે છે. પ્રભુને પણ આ સૂચિ-સર્જનના પ્રથમ પરોઢે જે ભાવ થયો હશે તેની સાથે જ હશે ને અનુસંધાન પ્રાણીના સૌ સંબંધોનું – ભાવસંદર્ભોનું ? પ્રાણીની સાથેનો સંબંધ સચરાચર વિશ્વનાં વિરોધી તત્ત્વો વચ્ચેની પારઘરિક સંબંધલીલા બતાવી શબ્દથી મૌન સુધીની સંવાદમય સ્થિતિગતિનું મર્મદર્શન કરાવી રહે છે. હાથનો સર્વ માત્ર બારણા આગળ અટકતો નથી, તેનો જરૂરી ચેતન અને હદથી અનહદ પર્યતનો ઉધાડ-વિસ્તાર પણ સંધાઈને રહે છે. મનુષ્યના પ્રાણીના વિશ્વસમસ્તને રચી દેવાની શક્તિનો કવિને ખ્યાલ છે જ. પ્રાણીચેતના પ્રભુચેતના સુધી વિસ્તાર-પરિણમે એમાં જ અનુભવાય તેનું સ્વારસ્ય.

કવિ સુંદર રીતે ‘નવપરિણીત પેલાં’ની વાત કરતાં નવવરવધૂના સાયુજ્યને આત્મ-પરમાત્મા સુધીના સાયુજ્ય સુધી વિસ્તારે છે. ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા’નો ખ્યાલ કવિના ચિત્તમાં છે જ. ‘નવપરિણીત પેલાં’નું એમનું દર્શન દૈત્યથી અદ્વૈત સુધી વિસ્તારે છે. તેઓ કહે છે :

‘દૈત ક્ષણાંશ નો શમી જતું :  
પંચમહાભૂત મહાભૂતને મળે,  
પ્રાણો પ્રાણોમાં ઢોળાય,  
મન મનમાં સમરસ છલકાય,

પરસ્પરાનુભવ એ નિજાનુભવ,  
આનંદ-પ્રતિબિંબતો આનંદ.  
અરેરે! તોયે બટકણું છટકણું અદૈત એ.  
બાથમાં તોય અલગ, સાથમાં તોય દૂર, કયારેક કયારેક...  
બેનાં બે. બેનાં ત્રણ ચાર... ચારનાં બાર... પણ બેનાં બે !’

(સમપદી, પૃ. ૨૫)

ઉમાશંકરની દષ્ટિએ તો પ્રેમનો પરસ્પરાનુભવ મૂળમાં તો નિજાનુભવ જ હોવાનો. તેઓ નવપરિણિત યુગલના પ્રણયાનુભવનો માનવજીવનના—માનવસંસ્કૃતિના વ્યાપક સંદર્ભમાં પણ જુબે-મૂલવે છે. માનવજીવનમાં પ્રણયતત્ત્વ તો પરમતત્ત્વના અમૃતપ્રસાદરૂપ છે. તેઓ તો સ્પષ્ટ કહે છે :

‘પ્રણયની દીક્ષા એ સ્તો માનવીની જીવનની દીક્ષા, માનવ્યની દીક્ષા.’

(સમપદી, પૃ. ૨૫)

આ પ્રણયદીક્ષાના કારણે જ દુનિયાની અર્ધી વસ્તી કૂણી દષ્ટિ ધરાવતી થઈ હોવાનું એમને લાગ્યું છે. તેઓ પદ્ધી કવિતાના ક્રીમિયાએ લયગાનમાં લહેરાતી આ પંક્તિ રમતી મૂકે છે :

‘ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જડાં, એક ધરતી ને બીજાં (જું ?) આભ...’

(સમપદી, પૃ. ૨૫)

આ પંક્તિને આંશિક રીતે પુનરાવૃત્ત કરતાં આકાશ અને પૃથ્વી (‘ધાવાપૃથ્વી’)ને અનુલક્ષીને ‘આદિયુગલ’નો ઉલ્લેખ કરીને એમના વારસ તરીકે માનવયુગલોને યાદ કરે છે. તેઓ કહે છે :

‘આકાશ અને પૃથ્વીના આદિયુગલનાં આ વારસોએ શું  
તર્જનીએ તર્જની ગુંથી (જે કોઈ વાર બતાવાઈ પણ હશેસ્તો)

એકમેકણું આનંદ-ધૂમરીઓ લઈ—  
બંનેએ અસીમકાળમાં હમેશ માટે ફંગોળાઈ જવાનું ?  
કદાચને સમાન્તર...! મળવાનું, હા, અંતે મળવાનું અનંતમાં.’

(સમપદી, પૃ. ૨૬)

અધ્યાત્મજીવન તેમ જ સંસારજીવનના મૂળમાં છે દૈતથી અદૈત પ્રતિની ગતિ. સંસારજીવનના લીલારસમાં પણ સ્ત્રી-પુરુષનું સાયુજ્ય અપેક્ષિત છે. પરસ્પરનાં પૂરક બનતું અને એમ કરતાં અપૂર્ણતામાંથી પૂર્ણતા સુધી પહોંચતું તેમાં જ જીવનરસની—અધ્યાત્મરસની સંસિદ્ધિ — પરાકાણ અનુભવી શકાય. કવિ સંભવતઃ એવી પ્રતીતિથી પ્રેરાઈને કહે છે :

‘પ્રત્યેક પૂરેપૂરું એક બને,  
તો જ પુંજી બનેબનેનું એકત્વ.’

(સમપદી, પૃ. ૨૬)

આવા એકત્વનો – પૂર્જિતાના પર્યાયરૂપ એકત્વનો અનુભવ, એક જગ પોતાની સાથે જો સાત ડગલાં ચાલે, રાધિકારૂપ આત્મા પરમાત્મા સાથે સાયુજ્ય સાથે તો તે પણ કરી શકે.

(ઉમાશંકરે નવપરિણિત યુગલને અનુલક્ષીને જે ઊંડાશ અને વ્યાપથી આત્મચેતનાથી વિશ્વચેતના સુધીના ફલકને સાંકેતિક રીતે આવરી લીધું છે તે પરંપરાગત – ચીલાચાલુ નીતિરીતિથી કેટલીક રીતે અલગ અને તેથી સર્જનાત્મક દિશાએ ઘણું મહત્વનું બની રહે છે. ઉમાશંકરનું કવિકર્મ – એમનું ભાષાકર્મ અવનવા તરીકાઓ ને આયામોથી અનોખું ને આસ્વાધ બન્યું છે. ‘ઓ ડેલી ઉઠ્યાં’માં ‘ઓ’નો લહેડો; ‘આકાશઉડો’ જેવો સમાસ; વિલક્ષણ લયતરેહવાળા શબ્દપ્રયોગો ને વાક્યવિન્યાસો, લાક્ષણિક વિશેષજ્ઞો ને કિયાપદો – આવી આવી ગુજરાતી વાણીની આકર્ષક ખૂબીઓ ને ખાસિયતો સાથે તેની જે શ્રવણીય લયગુંજ છે તેનો પણ આ કવિ અભિવ્યક્તિમાં પૂરો લાભ લેતા હોય છે. જીવનનાં વૈયક્તિક, સામાજિક અને આધ્યાત્મિક પરિમાણોને પ્રીધી, એ સર્વની સાપેક્ષતાઓના સંદર્ભમાં જે તે વિષયવસ્તુને ગરવી રીતે ને રમણીય રીતે પ્રત્યક્ષ કરી આપવાની કાવ્યલીલાનું આ કૃતિ પણ એક ધ્યાનપાત્ર ઉદાહરણ છે. સ્નેહતત્ત્વનું – સંવાદતત્ત્વનું વૈયક્તિક જીવનમાં, સાંસારિક અને આધ્યાત્મિક સંદર્ભમાં કેવું તો મહત્વ છે તે અહીં સરસ રીતે નિષ્પન્ન થયાની લાગણી થાય છે. કવિની તત્ત્વ અને સત્ત્વનિષ્ઠ પ્રકાશિલતાને વંદીને વિરભીએ.

## સુભાષિત સ-રસ-વતી ધારા વિરાટ છતાં અશક્ત ! | વિજય પંડ્યા

હિન્દુ ધર્મમાં ‘અવતારવાદ’નો વિચાર પણ એક આગવું વિલક્ષણ ચિંતન છે. આ વિચાર પ્રમાણે પરમેશ્વર જે તે સમયની આવશ્યકતા પ્રમાણે અવતાર લઈ નિશ્ચિત કાર્ય સાવે છે. શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ગીતામાં ‘જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મ પ્રબળ બને છે ત્યારે હું અવતાર લઉં છું’ એમ કહું છે. અને આ દર્શન પ્રમાણે દસ અવતાર (ક્યારેક ૨૪ અવતાર)નું નિરૂપણ ભાગવત જેવા ગ્રંથોમાં થયું છે.

તો આજની કવિતા-સુભાષિતનો દસ અવતારોમાંના કાલકર્મમાં તૃતીય વરાહ-અવતાર વિષય છે. વરાહ-અવતારમાં ભગવાનને શું કરવાનું હતું? તો હિરણ્યકાશ રાક્ષસે પૃથ્વીને સમુદ્રમાં છેક રસાતલમાં તુબારી દીધી હતી અને તેને બહાર કાઢવામાં આવે તો, પ્રાણીઓનું પૃથ્વી નિવાસસ્થાન બની શકે અને જીવસૂદ્ધિનો વિકાસ થઈ શકે. એટલે, ભગવાને વરાહ-અવતાર ધારણ કર્યો, રાક્ષસને હજ્યો અને જલૌધ સમુદ્રમાં દૂબી ગયેલી પૃથ્વીને પોતાની દાઢ પર ટેકવી બહાર લાવ્યા.

આ પરિસ્થિતિનું ચિત્ર સંસ્કૃત સાહિત્યનો એક મહાન કવિ જયદેવ પોતાના ‘ગીતગોવિંદ’માં આ પ્રમાણે આલેખે છે. (એક બીજી કવિતા જ ગણો ને ! એકની સાથે બીજી એક !) આપણા ગુજરાતના સંસ્કૃત સાહિત્યના વિદ્ધાને આ જયદેવના કવિતાઓનો

ગુજરાતીમાં નીચે પ્રમાણે અનુવાદ કર્યો છે :

હે કેશવ !  
વરાહ અવતારે,  
આપના દંતાંગે લાગેલી  
ધરિની શોભતી, જાણે  
શશી મથ્યે રાજતી કલંકરેખ નવેલી.  
જય જગદીશ હરે ! જય જગદીશ હરે !

વરાહનું વિરાટ સ્વરૂપ તો કેવું કે વરાહની દાઢના દંતશૂળ પર પૃથ્વીને ટેકવી વરાહ-અવતાર ભગવાન સમુદ્રમાંથી બહાર લઈ આવ્યા. અને કવિ જયદેવની કલ્પના પ્રમાણે દાઢ પર ટેકેલી પૃથ્વી એ ચંદ્રમાના ડાઘ સમી લાગતી હતી. વરાહની દાઢનું દંતશૂળ એ ચંદ્ર અને તેની પર ટેકવેલી પૃથ્વી એ ચંદ્રનો કાળો ડાઘ. અદ્ભુત છે દશ્ય. એક વિરાટ ફલક પર ચિત્રણ થયું છે.

તો અહીં પ્રસ્તુત વરાહ-અવતારનું પદ્ય વિરાટસ્વરૂપના કાવ્યઘટક (poetic motif) ને તાગે છે. પદ્ય આ પ્રમાણે છે :

દંદ્વાપિષ્ઠેષુ સદ્યઃ શિખવિષુ ન કૃતः સ્કંધકણ્ઠૂવિનોદः  
સિન્ધુષ્વઙ્ગગવાગાહઃ ખુરકુહગલતુચ્છતોયેષુ નાપતઃ : ।  
લબ્ધાઃ પાતાલપઙ્કૈ ન લુઠનરતયઃ પોત્રમાત્રોપયુક્તે  
યેનોક્ષરે ધરિત્રાઃ સ જયતિ વિભુતાવિભિન્તેચ્છો વરાહઃ ॥

(કુન્તાક દારા ‘વકોક્તિજીવિત’માં ઉદ્ઘૃત, નગીનદાસ પારેખનું સંપાદન, સંસ્કૃત પાઠ પૃ. ૧૬).

અનુવાદ : પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે પોતાની મહાનતાને કારણે જ પોતાની સ્વાભાવિક ઈચ્છાઓ પૂરી ન કરી શકેલા વરાહનો જય હો ! પર્વતો તો એના દંતશૂળ અડતાં જ ચૂરેચૂરા થઈ જાય એટલે એ તેની સાથે પોતાની ખાંધ ખંજવાળી ન શક્યા; સાગરોનાં પાણી એટલાં ઓછાં હતાં કે એની ખરીથી પડેલા ખાડામાં જ સમાઈ ગયાં એટલે એ તેમાં પડીને નાહીં પડા ન શક્યા; પાતાળના કાદવમાં તો એમના મોઢાનો લાંબો આગળો ભાગ (સૂંઠ) જ દૂબી શકે એમ હતું એટલે એ તેમાં આળોટી ન શક્યા. (અનુવાદ : નગીનદાસ પારેખ).

કવિએ (કવિ અજ્ઞાત છે!) જે રીતે વિરાટ-તાને અથવા તો વરાહના વિરાટ સ્વરૂપને વિવિધ સંદર્ભોમાં મૂકીને તાર્યું છે તેમાં કાવ્યત્વભરી ચ્યમત્કૃતિ છે. જેમ વાસ્તવિક કોઈ વિરાટ સ્વરૂપને નિહાળી આપણી વાચા હરાઈ જાય તેમ આ કવિએ તાજેલા વિરાટ સ્વરૂપમાંથી નિષ્પન્ન થતા કાવ્યના આહ્લાદને આપણે સમ્યક રીતે શાંભમાં મૂકવાની સ્થિતિમાં જાણે રહેતા નથી, એવો આ કવિતાનો દિઝમૂછ કરી દેનારો પ્રભાવ છે.

જે વિરાટ હોય, વિભુ-સર્વવ્યાપી હોય, સર્વસત્તાધીશ હોય તેના માટે તો કશું જ અશક્ય ન હોય ને ! પડા ના ! આ વરાહની વિરાટતા જ તેને નડી છે. વરાહ (લૌકિક ભાષામાં ભૂડ, તુક્કર, સૂવર, સંસ્કૃતમાં શૂકર) પોતાના દંતશૂળ અને પીઠની ખંજવાળ

મિત્રાવવા કઠણ માટી કે પથર સાથે પીઠ ઘસે. પણ આ વરાહ ખંજવાળનો આનંદ લઈ શકતો નથી. પર્વતનાં શિખરો જોઈએ અને ત્યાં પણ જો પોતાનાં દંતશૂણ જેવાં લગડે કે શિખરો નીચે ધ્યાન પડે, ક્યાં પીઠ ખંજવાળે? ભૂંડને તો પાણીમાં પડ્યા રહેવાનું-નહાવાનું બહુ ગમે. તો વિચાર આવે કે, વરાહને તો મોટો સાગર તો છે જ જેમાં આખી પૃથ્વી રૂબી ગઈ હતી. પણ વરાહના પગની ખરીઓથી જે ખાડા પડ્યા તેમાં જ સમુદ્રોનાં (પૌરાણિક ભૂગોળ પ્રમાણે ચાર) પાણી સમાઈ ગયાં. પછી તે સ્નાન (વરાહ-અવતાર છે એટલે સ્નાન!) ક્યાં કરે?

ભૂંડને ખાબોચિયાના કાદવમાં આળોટવું બહુ ગમે. કાદવ તો ઘણો હતો, આખું પાતાળ કાદવથી ચિકાર હતું પણ તેમાં મહા-મહા-કાય વરાહની દાઢનો ભાગ અને તે પણ આગળનો ભાગ જ રૂબી શક્યો હતો. એટલે કાદવમાં આળોટવાની મજા પણ વરાહ પોતાના વિરાટ સ્વરૂપને કારણે ન લઈ શક્યો. તો આવા વિરાટ સ્વરૂપ ધરાવતા અને તેવા સ્વરૂપને કારણે જ વરાહ-અવતારમાં ભગવાન પોતાની ઈચ્છાપૂર્તિ ન કરી શક્યા.

આ તો ભવ્યાતિભવ્ય ચિત્ર છે અને વરાહની વિરાટતાને ભિન્ન સંદર્ભમાં મૂડીને કવિતા અત્યંત આસ્વાદ બની છે.

આસ્વાદનો આદ્ભુત શરીર જ્યાં પછી એક હવે વિચાર પણ આવે કે સાધારણ રીતે સૂગ ઉપાયતાં પ્રાણી હુક્કર કે ભૂંડમાં પરમોચ્ચ સૂષ્ણિનિયંતા ભગવાન અવતાર લે? વરાહના શરીરરૂપે ઈશ્વર અવતારે! આવી કલ્પના અને વિચાર કરનારી પ્રજાની સંવેદનશીલતાનાં વ્યાપ અને ઊંડાણ કેવાં? પણ ‘આ સર્વ ખેખર બ્રહ્મ છે - વૈતન્યરૂપ છે - સર્વ ખલિવદં બ્રહ્મ’, નો ઉદ્ઘોષ કરનારા ચિંતનને આવી કલ્પનાની પાંખો લાગે તો જરા પણ આશ્રય પામવા જેવું નથી.

## સંદર્ભ

૧. વસતિ દશનશિક્ખરે ધરણી તવ લગ્ના

શશિનિ કલઙ્કલેવ નિમગ્ના ।

કેશવ ધૃતશૂકરરૂપે

જય જગદીશાહરે ॥૩॥

(‘ગીતગોવિંદ’, સંપાદક વસંત પરીખ)




## સાહિત્યવૃત્ત મોકલવા માટે ઈમેઇલ આઈડી

આપની આસપાસ થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ, જેમાં આપ ઉપસ્થિત રહ્યા હો, આપે ભાગ લીધો હોય કે પછી આપે આયોજન કર્યું હોય તો એ કાર્યક્રમ વિશેની ટૂંકી નોંધ ઈમેઇલ દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદને મોકલી શકો છો. નોંધ જે ફોન્ટમાં કંપોઝ કરી હોય એ ફોન્ટ સાથે અચૂક મોકલવા. એ માટેનું ઈમેઇલ આઈડી છે : vruttparabgsp2018@gmail.com

## વિશેષ

### કદાચ, સૂરજ ઊગો...

ભરત મહેતા



ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આગામી ગ્રંથ વર્ષ માટે પ્રકાશભાઈ શાહ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. એમણે પહેલી પ્રતિક્રિયા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતામાં માનનાર કવિમિત્ર હરિકૃષ્ણ પાઠકની પંજિથી આપી કે - ‘કદાચ, સૂરજ ઊગો.’ સૂરજ શાનો ઊગવાની વાત પ્રકાશભાઈ કરતા હશે? કદાચ, ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના સૂરજની વાત છે. એમની અનેકવિધ પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓની સમાંતરે ચાલેલી નિતાંત ચિત્તનાત્મક નિબંધની વ્યાપક સૃષ્ટિમાંથી પસાર થનારને એક વાતનું ખસૂસ ગૌરવ થશે કે બૌદ્ધિકોની સમાજમાં જે સાક્ષાત્ હાજરી વર્તાવી જોઈએ તેનું પ્રકાશ ન. શાહ જીવતુંજીવતું ઉદાહરણ છે.

આપણે જ્ઞાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી ત્યારે એમના મનમાંનો ગોવર્ધનરામના ‘સાક્ષરજીવન’ના નાયક સમો હતો જેના દિલમાં દેશાહિત હોય. પરિષદદર્શનની આ વ્યાપકતાનો જ્યાલ એના પરથી આવે છે કે અહીં થેથેલા પ્રમુખો મોટા સર્જકોની સાથોસાથ મોટા ચિત્તકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડ સાહિત્યને જીવનની સમીક્ષા ગણાયું છે, એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ ખેટના નળમાંથી ટપકતી દઢૂરી નહીં, પણ સાગરવેળ... જે આપણા આણુએ આણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે. આપણે ત્યાં રસિક હોય એ ઘણી વાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મધ્યસ્થ અને કારોબારી સત્યથી માંડી ઉપમુખ અને મહામંત્રી તરીકે એમણે સેવા આપી છે. ઉચ્ચ મૂલ્યો સાથે પ્રગાહ નિસભતભેર કર્તૃત્વ-નેતૃત્વના કારણે એમનું નામ ગુજરાતભરમાં જાણીતું છે.

યુવાવયથી જ સામાજિક, સાંસ્કૃતિક, નાગરિક પ્રવૃત્તિઓમાં સક્રિય પ્રકાશભાઈએ સાહિત્યપ્રવૃત્તિ પણ એટલી જ કરી છે. ‘વિશ્વમાનવ’, કે જે સામયિકે ગુજરાતની આધુનિક પેઢીને ઘડી તેના સંપાદનમાં તરુણ વયે તેઓ જોડાયા હતા. ઉમાશંકરે જેને હોમ યુનિવર્સિટી લાઈબ્રેરી સમી કહી તે જ્ઞાનગંગોત્રી શ્રેષ્ઠી અને એના સમૃદ્ધ મણકાઓમાં પ્રકાશભાઈની સહભાગિતા રહી છે. અધ્યાપકની નોકરીને તિલાંજલિ આપી એમણે પ્રજામતની કેળવણીને - કહો કે લોકશિક્ષણને અગ્રતા આપી. દર્શકના શર્જભરાનું કહીએ તો શિંગડાં માંડતાં શિખવાઝું ! જયંતિ દલાલ આપણા એવા જ સર્જક. એમના નિધનથી શતાબ્દીવર્ખના પૂરા ત્રણ દાયકા લગી એમના ગ્રંથપ્રકાશન અને સમૃતિસંમાર્જનમાં પ્રકાશભાઈએ દાયિત્વ નભાવ્યું.

આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈભરાનું પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસભતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, દર્શક, ઉમાશંકર જોશી સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપલાઙ્ગી સાથે અંતેવાસી કહી શકાય તે રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક ભિજાજ, એક આબોહવાનું પ્રતિનિષિત્વ કરે છે. એમનાં લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાનું પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંઝાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા, છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અદી પણ નહીં અને નહીં પણ નહીં.

ગાંધી, ટોલ્સ્ટોય, મુનશી, દર્શક પરનાં એમનાં લખાણોમાંથી પસાર થનારને એમની રસ્શ વિદ્વતાનો પરિચય થશે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય અથ્યક તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો - ‘ગુજરાતી નવલકથામાં સ્વરાજયેતના’ કે ‘સાહિત્ય અને રાષ્ટ્ર’ પણ અહીં યાદ કરી શકાય. એમનાં ‘ટોલ્સ્ટોયથી ગાંધી’ વ્યાખ્યાનો અનન્ય છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટ્રી, શિમલામાં ગેરસ્ટફેલો તરીકે આપેલ સેમિનાર (‘ગાંધીજ રિલિજિયસ ક્રેસ્ટ : અ સ્થિવિલ સોસાયરી પરસ્પેક્ટિવ’) ખાસો જાણીતો થયેલો. આ જ પરંપરામાં મુંબઈ યુનિવર્સિટીનાં કક્કર વસનજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો તેમજ બત્રીસ વ્યાખ્યાનોમાં પ્રસરેલી ત્રણ કૃપાલાની વ્યાખ્યાનમાળાઓ (‘તાં દૂરથી મંગલ શર્જ આપતો’, ‘સ્વર્ગમાં બાકી કરી યારો જો નવજવાં’ અને ‘ભારતવર્ખની સ્વરાજસાધના’) વિશ્વસ્તરની સાંસ્કૃતિક-સાહિત્યિક-રાજનૈતિક વિચારયાત્રા અને પરિવર્તનલીલાને સમજવાની મથામણ શી છે.

પ્રકાશ ન. શાહના વ્યક્તિત્વનું બીજું પાસું નાગરિક સમાજના ઘડતરનું રહ્યું છે. ‘ગાંધી શાંતિ પ્રતિજ્ઞાન’માં તેઓ ૧૯૭૦માં મંત્રી હતા. ત્યારબાદ ગુજરાત લોકસંગ્રહ સમિતિ, લોકસમિતિ, લોકસ્વરાજ મંચ, ઓલ ઈન્ડિયા સેવ એજયુકેશન કમિટી, મૂવમેન્ટ ફોર સેક્યુલર ટેમોકેસી જેવી એકાધિક સંસ્થાઓમાં તેમણે અગ્રભૂમિકા આદા કરી છે. રામનાથ ગોયન્કાના આમંત્રણ અને સુપ્રતિજ્ઞ પત્રકાર પ્રભાસ જોશીના મૈત્રીપૂર્ણ આગ્રહથી એકસપ્રેસ જૂથના ગુજરાતી પત્રોમાં તંત્રીસ્તરની કામગીરી બજાવી. ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદીય સલાહકાર તરીકે તેમ ‘અંડ આનંદ’ના દ્વિજ અવતારમાં પડા એમની ભૂમિકા રહી. એમણે શબ્દને સાબૂત રાખ્યો છે. શબ્દસેવી નમાલો ન હોય, રાજસત્તા-ધર્મસત્તાના શરણે ન હોય એ જંયું છે. તેથી આવા અવાજોને ૧૯૮૮રથી ‘નિરીક્ષક’માં સતત અવકાશ આપતા રહ્યા છે.

છેલ્દે, ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મથામણ ઊભી થયેલી, ભારતની એકમાત્ર લેખકીય મતદાર મંડળ અને ચુંટાયેલ પ્રતિનિધિત્વ ધરાવતી સ્વાયત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મળે, ટકે અને જળવાય, એની સક્રિય ખેવના એમણે કરી. ‘નિરીક્ષક’ સામયિકે આ સ્વાયત્તતાવિમર્શને જીવંત રાખ્યો. ઉમાશંકર જોશી, દર્શક, નારાયણ દેસાઈ અને નિરંજન ભગતની સ્વાયત્તતાની લાહે પ્રકાશભાઈની ઉમેદવારી વાટે પ્રગટ થઈ રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનું છીનવાઈ જવું ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલ તમામ માટે આધાતજનક ઘટના છે એ માટે પ્રકાશભાઈએ ચલાવેલ જુબેશમાં એમના સમગ્ર જીવનમાં કરાયેલાં રસિકનાગરિક કામોનું જ એક સાતત્ય છે.

આજે, ૨૧મી સદીમાં પરિષદ્પરમુખ આવા બહુઆયામી હોવા જોઈએ એમ અમે સૃપદ્યપણે માનીએ છીએ. પરિષદ્દને આવા પ્રમુખ ગ્રામ થયા છે એ આપણા માટે ગૌરવની ઘટના છે. પ્રકાશ ન. શાહને પરિષદ્પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.



## સાભાર સ્વીકાર

### પ્રક્રીષ્ટ

ચતુર ચાણકય રાધાકૃષ્ણન પિલ્લાઈ, ૨૦૧૮, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૨૦, રૂ. ૧૩૫. સાઈન ઓફ ફોર અનુ. જીગર શાહ, ૨૦૧૮, ફેલિક્સ પાબ્લિકેશન, સૂરત, પૃ. ૧૫૮, રૂ. ૧૭૦. વાવણી દિનેશ પટેલિયા, ૨૦૧૮, પ્રણવ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૧૨, રૂ. ૧૨૦. યેતના અને દુઃખોનું રૂપાંતર અનુ. રાજેશ સોલંકી, ૨૦૧૮, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૨૪૨, રૂ. ૩૨૫. સંતાન સૌ તમારાં સંપા. ડંકેશ ઓગા, ૨૦૨૦, વિશ્વગ્રામ, પો. બાસણા, ૧૧૨ + ૮, રૂ. ૧૦૦.

અક્ષિતમ અચ્યુતન નભૂતિરિ મલયાળમ ભાષા અને સાહિત્યનું એક એવું નામ છે જે ‘મહાકવિ’ તરીકે ઓળખાય છે. ભારતીય પરમ્પરામાં મહાકવિ ઘણા નથી થયા અને થયા છે તેઓ મોટા ભાગે પ્રાચીન ભારત સાથે સંબંધ ધરાવે છે. પરંતુ અક્ષિતમનો આપણા સમકાળીન જીવન સાથે સંબંધ છે. પ્રાચીન કાળથી આજ સુધીમાં જીવનની પરિસ્થિતિ, ઉત્પાદનનાં સાધન, ખાનપાન વગેરે અભૂતપૂર્વ રૂપે બદલાયાં છે. એવી સ્થિતિમાં ત્યારથી આજ સુધી સાહિત્ય તો બદલાયું જ છે, સાથેસાથ સાહિત્યના પ્રત્યક્ષ ઉપભોક્તા પાઠકોની જરૂરિયાત અને સમજમાં પણ બદલાવ આવ્યો છે. આજનું જીવન નિરંતર પડકારભર્યું બન્યું છે. વ્યક્તિગત અને સામાજિક સંબંધોમાં સંકુલતાઓ પહેલાના સમય કરતાં ઘણી વધી ગઈ છે. પ્રાચીનની સરખામણીમાં આજના સમાજનું જીવન સરળ નથી જણાતું. એટલે સાહિત્ય કે જે કોઈ પણ સમાજનું પ્રત્યક્ષ પ્રતિબિંબ ધરે છે એ પણ પોતાના સમયના છિસાબથી સંકુલતાઓને પ્રગટ કરે છે. વળી મહાકવિના કવિકર્મમાં ઊંડાણ અને વિસ્તારની નિસ્સીમતા અને ગહનતાની અનિવાર્ય અપેક્ષા પણ રહે છે. અક્ષિતમ એવા સાહિત્યિક ઊંડાણ અને વિસ્તારના જીવંત પ્રતીક છે. મલયાળી સમાજનો સાહિત્યાનુરાગ દેશના કોઈ પણ સમાજની સરખામણીમાં ઘણો ઊંડો ગણાય છે અને એ પોતાના સાહિત્યિક નાયકોનું ચ્યન ઉત્પાદન નથી કરતો. એ સમાજ રચનાકારોનું અદ્ભુત રીતે સમ્માન કરે છે. જોકે શરત એટલી જ કે એમની રચનાઓ જનોન્મુખ હોય જેની પ્રક્રિયા ઘણી સરળ અને સાફ્ફ્યુથરી હોય. એક રચનાકાર જ્યારે બધા માટે વિચારે છે ત્યારે જ એનું લોકપ્રિય હોવું સંભવિત બને છે. આવી પ્રસિદ્ધ સ્થાયી હોય છે અને એવી ઘટના રાતોરાત પણ બનતી નથી.

પ્રતિનિધિ કાવ્યોના પોતાના એક સંકલનની ભૂમિકામાં અક્ષિતમ લખે છે, ‘બધા સાહિત્યકારો વિચારતા હોય છે કે એમને પર્યાત્મ કીર્તિ નથી મળી. મને પણ એવું થાય છે કે મને મારે લાયક કીર્તિ આજે નહીં તો કાલે જરૂર મળશે. જોકે કોઈ સવારે જાગતાવેંત સૌભાગ્ય મારી સાથે વરસ્યાની ઘટના બની નથી.’ અક્ષિતમની આ વાતે સ્પષ્ટતા મળે છે કે એમને મલયાળી સમાજનો ર્નેહ અને સમ્માન અચાનક નથી મળ્યાં. જોકે જે મળ્યાં છે તે સ્થાયી છે. વિવેચનાએ અક્ષિતમની ખૂબ પ્રશંસા કરી છે. એ બધામાં એક વાત મુખરપણે સામે આવે છે તે એમની રચનાઓનાં બંધારણ અને એની પ્રતીકયોજના વિશે છે. સામાન્ય વાચકોને સરળતાથી સમજાય એવાં એ હોય છે. જનોન્મુખ સાહિત્ય અને જન માટેના સાહિત્ય બનેનો અદ્ભુત સમન્વય એમની રચનાઓમાં જોવા મળે છે. એ જ

કારણ છે કે રોજિંદી વાતચીતમાં એમના દ્વારા રચાયેલી પંક્તિઓ એ પ્રકારે વણાયેલી હોય છે કે જાણો એ સહીઓથી સામાન્ય બોલચાલનો જ હિસ્સો રહી હોય.

ઘણી વાર એ પણ જોવા મળ્યું છે કે લોકોએ એમની કોઈ પણ રચના વાંચી ન હોય છતાં એમની લખેલી પંક્તિઓ પોતાની વાતના સમર્થનમાં કોઈક શાસ્ત્રીય પ્રમાણની જેમ પ્રસ્તુત કરતા હોય. આ પંક્તિઓમાં સૌથી વધારે જાણીતી પંક્તિઓ છે, ‘વેલીયમ હુખમાનુની તમસલ્લો સુખપ્રદમ’. સહજ ભાષામાં બસ એટલું જ કે ‘દીકરા, પ્રકાશમાં હુખ છે ને અંધકાર સુખદ’. જોકે આ વાક્ય એક સંપૂર્ણ જીવનદર્શનનું નિરૂપણ કરે છે જે બહુસ્તરીય અર્થ આપે છે. મનુષ્ય જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે એ હુખી થઈ જાય છે. અને અજ્ઞાનમાં રહે છે ત્યાં સુધી એ સુખી રહે છે. જાણવાથી હુખ અને અજ્ઞાનથી સુખ ! આ પંક્તિના અર્થની લવચીકતા જ એને મલવાળમ ભાષાની રોજિંદી બોલચાલનો હિસ્સો બનાવે છે. કોઈ પણ રચનાકાર માટે આ પ્રકારની જનસ્વીકૃતિ એક મોટી ઉપલબ્ધિ જેવી હોય છે. આ પ્રકારની એક બીજી પંક્તિ છે, ‘તેરુવિલ કાકા કોનુનું ચત્પેનાડિ કન્નુગલ, મુલચતી વલિક્યુનું નરવર્ગ નવાતિથિ’. રસ્તા પર મરણ પામેલી યુવતીની આંખોને કાગડો ટોચી રહ્યો છે અને એનાં સ્તનોએ પુરુષસમાજનું અતિથિનવજાત શિશુ વળગેલું છે. આ માર્મિક દર્શય સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પર આકરાં ટિપ્પણ જેવું છે. એક સજ્ગા રચનાકારનું આ જ તો કર્તવ્ય છે અને સમાજનું ઋષા પણ છે કે એ પોતાના સમાજની વિસંગતિઓનું કેવું અને કેટલું પોતાની રચનાઓમાં નિરૂપણ કરી શકે છે.

અક્ષિતમ હાલ ૮૪ વર્ષના છે<sup>૨</sup> અને એમનું કાવ્યજીવન ઘણાંના સરેરાશ જીવનથી પણ લાંબું છે. સ્વાભાવિક છે કે તેઓ કેરળ સહિત ભારતનાં ભધાં જ મહત્વપૂર્ણ સામાજિક-રાજનીતિક પરિવર્તનોથી રૂબરૂ થયા હશે. એ જેવું રસપ્રદ પણ નીવડશે કે એમની આ પરિવર્તનોને લઈને કેવી પ્રતિક્રિયા રહી હશે. એમના દ્વારા રચાયેલા સાહિત્યનો પરિચય મેળવ્યા બાદ એ કહેવું અધરું નથી કે એમને ત્યાં પરંપરાએ આધુનિકતાની ખાતર ખોરાકની ગરજ સારી છે. આધુનિકતાની સ્પષ્ટ વૈચારિક સમજ માટે પરંપરાનું હોવું એટલું જ અનિવાર્ય છે જેટલું બેતરમાં ઊભા પાકને માટે ખાતરનું.

એમના સાહિત્યના વિપુલ ભંડારમાં એમની ઐતિહાસિક ચેતનાને સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે, જેણે એમની કૃતિઓને કાળજીવી નહીં બંકે કાળજીવી બનાવી છે. એમની રચનાઓ સમયવિશેષમાં ન રહીને સમય અને ભૌગોલિક સીમાઓનું અતિકમણ પણ કરે છે. એમાં પોતાના યુગબોધની સાથોસાથ આગામી જીવનની જલકનું સહજ સામંજસ્ય જોવા મળે છે. અક્ષિતમનો સંપૂર્ણ રચનાસંસાર એ વાતનો ઘોતક છે કે પરિવર્તનની પ્રક્રિયા પરંપરાનો જ હિસ્સો છે કે જે નવીનતાના ઉન્મેષ માટે વાતાવરણનું નિર્માણ કરે છે. નવીનતા કે આધુનિકતાનો અક્ષ શૂન્યમાં તો સંભવે નહીં. અહીં એમની એક પ્રસિદ્ધ કૃતિ ‘બાલિદર્શનમ્’નું ઉદાહરણ પ્રસ્તુત જણાય છે. આ રચના રાજ મહાબલીના ઓણમ સમયના પુનરાગમન પર લખાયેલી છે. આ કૃતિની વિશેષતા એ છે કે આ એકસાથે પરંપરા અને આધુનિકતા બનેમાં વિચરણ કરે છે. સાથોસાથ એમાં પરિવર્તન અને

ઐતિહાસિકતાને સહજ રેખાંકિત કરી શકાય છે. કવિતા સ્વમ્રમાં ચાલે છે જેના અંતે ભગવાન મહાબલી પ્રગટ થાય છે. કવિતાના માધ્યમથી કવિએ મલયાળમ સમાજના કભિક પરિવર્તનને દર્શાવ્યું છે. ઓણામ એવો તહેવાર છે કે જે કેરળના દરેક ઘરમાં ગૃહજવવામાં આવે છે. આ સર્વર્સ્વીકૃત તહેવારના માધ્યમથી સામાજિક ચિંતન અને જીવનશૈલીમાં આવેલા બદલાવને કાવ્યાત્મક ઉચ્ચતા સાથે જ અવલોકવામાં આ કવિતાનો ઉત્કર્ષ છે.

અક્કિતમે મહાબલીના આ તહેવારનાં મૂલ્યોને સર્વથા આધુનિક સંદર્ભો મૂડીને જોયાં છે. આ દીર્ઘ કવિતા એ એક વાતનું ઉદાહરણ છે કે પરિવર્તન અને નિરંતરતા પરંપરાને માંજે છે. પરિણામસ્વરૂપ પરંપરા મૂળ અર્થોને યથાવતું રાખીને પોતાના વાસ્તવિક સંદર્ભોમાં આધુનિકતાને અંગીકાર કરી ભવિષ્યોન્મુખી બને છે. સ્વમ્રના અંતે જ્યારે મહાબલી પ્રગટ થાય છે ત્યારે તેઓ ઓણામ પર્વ પર ઘર કરી ગયેલી દેખાડાની પ્રવૃત્તિ પ્રત્યે ક્ષુદ્ર જણાય છે. બસ આ જ મુકામ પર કવિતા આધુનિકતા અને પરંપરા બંનેની વિવેચના પ્રસ્તુત કરે છે. જ્યારે આપણે પરંપરાને જાણવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણો યુગબોધ દઢ થાય છે. એ પછી જ આધુનિકતાને સમગ્રતામાં સમજવાનો અને એની સભ્યક વિવેચના કરવાના માપદંડ સ્પષ્ટ થાય છે. ‘બલિદર્શનમ્’ એ રીતે પણ મહત્વપૂર્ણ છે કે અહીં આધુનિકતાના નામે ખરા અને ખોટાને સમજ્યા વિના આગળ વધતા રહેવાની સામાન્યતાયા સ્વીકૃત પ્રક્રિયાની વિસુદ્ધ ઊભેલી આ રચના છે. આધુનિકતાને નામે સર્વને આત્મસાત્ત કરતા જવું એ સમસ્યાઓને નોતરવા જવું છે અને આ કિયા પેઢી દર પેઢી ચાલ્યા જ કરે છે. આમ જુઓ તો આ પક્ષને આપણે અનાવશ્યક ગણીને ચાલતા હોઈએ છીએ. અક્કિતમ એક જગાએ કહે છે કે, ‘આધુનિકતાના અરીસામાં બધું એવું નથી હોતું જેવું દેખાય છે. એના વાસ્તવિક દર્શન માટે પરંપરા પાસે એની પ્રામાણિક તપાસ આવશ્યક છે.’ આ કથન મલયાળી સમાજની સાથોસાથ બધા જ સમાજોની પરંપરા અને આધુનિકતા સંબંધી ચેતનાની ઊરી વિવેચના છે. કવિનું આ દર્શન જ એમને દરશકો સુધી મલયાળી સંસ્કૃતિના પ્રતીકના રૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. લોક અને સમયની આવી ગંભીર સમજની ભાવભૂમિ પર જ અક્કિતમનો રચનાસંસાર ઊભો છે.

આ પ્રકારના સમાજદર્શન વિશે સમાજની કેવી પ્રતિક્રિયા હોય છે એ જાણવા-સમજવા માટે અહીં ‘બલિદર્શનમ્’ કવિતાની રચનાપ્રક્રિયાને લઈને એક રસપ્રદ પ્રસંગનો ઉલ્લેખ સમુચ્ચિત જણાય છે. અક્કિતમ લાંબા સમય સુધી આકાશવાણી સાથે જોડાયેલા રહ્યા. એક વખતે એમના કેન્દ્ર નિયામકે એમને ઓણામ પર કવિતા લખવા કહ્યું. અક્કિતમે એ લખવાની શરૂઆત તો કરી પણ કશું જ બંધાતું જણાયું નહીં. નિયામકે એમને ઘરે રહી કામ કરવાની રજા પણ આપી. કવિ કેટલાક દિવસો સુધી પાછા પોતાના કામે આવ્યા નહીં. જોકે કામ પર ન આવવાથી કંઈ ઉકેલ આવવાનો ન હતો. કેટલાય છંદોમાં લખવાનો પ્રયત્ન કરી જોયો. કેટલાય પ્રયત્નો લખીને ફાડ્યા પછી આ રચના સામે આવી. જે દિવસે આકાશવાણી પરથી એનું પ્રસારણ થયું તે જ દિવસે ‘માતૃભૂમિ’ અખબારે એ

ઇધાપવાની માગણી મૂકી. રેટિયો અને અખબારના માધ્યમ દ્વારા આ કવિતા જનજીવનનું કાવ્ય બની ગઈ.

મહાકવિ અક્ષિકતમની રાજનીતિક દસ્તિ એક એવું બિંદુ છે જેને લઈને વાત કરવી જરૂરી છે. તેઓ રાજનીતિક વિચારધારાના રૂપમાં એ વાતનું સમર્થન કરે છે કે ક્યાંય કોઈ કોઈનું શોખણ ન કરે. જોકે તેઓ કભૂનિસ્ટ નથી. બલ્કે એમ કહેવું જોઈએ કે વખતોવખત એમણે કભૂનિસ્ટ વિચારધારાની ટીકા કરી છે. તેઓ એક જગ્ગાએ કહે પણ છે, ‘હું બધાં જ ભૌતિક અને માનસિક શોખણોનો વિરોધ કરું છું. હું એક નવા સંસારનું સ્વમું જોવા ચાહું છું જ્યાં બધાં જ લોકો પાસે કામ હોય. હાથ અને જીબ પર કોઈનાં બંધનો ન હોય. મગજ અને પેટ ભરાયેલાં હોય... જોકે ક્ષિતિજ ગમે તેટલી સોહામણી હોય પણ એ હોય છે તો હંમેશાં દૂર.’ આથી એમની રાજનીતિ સંબંધી સ્પષ્ટ સમજનો જ્યાલ આવે છે કે જ્યાં તેઓ બધા જ મકારના શોખણની વિરુદ્ધ ઊભા રહેવાની વાત કરે છે. જોકે તેઓ નિરાશા પણ વ્યક્ત કરે છે કે નજીકના ભવિષ્યમાં એ શક્ય બનવાનું નથી. આ પ્રસ્થાનનિંદુ પરથી કેરળના રાજનીતિક પરિદશને નિરીક્ષણ કરવાથી જાણાય છે કે લાંબા સમય સુધી કભૂનિસ્ટ સરકાર હોવા છતાં ત્યાં શોખણ અને રોજગાર સંબંધી મૂળ પ્રશ્નો યથાવત ઊભા જ છે. એ શોખણમુક્ત સમાજ કે જ્યાં સર્વને રોજગાર મળે એવો યુટોપિયા (કલ્યિત આર્દ્ધ સમાજ) આજે પણ એવો જ છે. જે વિશે એમણે કહેવું કે ક્ષિતિજ ગમે તેટલી સોહામણી હોય પણ એ હોય છે તો હંમેશા દૂર. તેઓ એવા સમાજની ઈચ્છા તો કરે છે પણ રાજનીતિથી સાહિત્યને પૃથક રાખવાની વાત પણ કરતા રહે છે.

કેરળના પ્રસિદ્ધ અખબાર ‘માતૃભૂમિ’ને ગયા વર્ષે આપેલી એક મુલાકાતમાં તેમણે આ ધારણાને ભારપૂર્વક રજૂ કરી છે. રાજનીતિક રૂપમાં સંગેત રહેવું સાહિત્યના બદલે પાર્ટીના હિતમાં છે. એ અર્થમાં સાહિત્યની ઉપયોગિતા કેવળ રાજનીતિક પાર્ટીના વિકાસમાં કરવામાં આવે છે.’ અહીં કવિનું તાત્પર્ય છે કે સાહિત્યનો સંબંધ કોઈ ખાસ વિચારધારાવાળા રાજનીતિક પાર્ટીને બદલે સમય અને સમાજ પ્રત્યે ખુલ્લો દસ્તિકોડા રાખવા સાથે છે. અક્ષિકતમના સમગ્ર સાહિત્યને જોતાં આ એક વાત પ્રમાણિત થાય છે કે ભલે ને તેઓ કોઈ ખાસ વિચારધારા સાથે નહોતા જોડાયા, પરંતુ સમાજ અને સામાજ્ય માનવીને લઈને એમની નિસબત ક્યારેય સંકીર્ણ દસ્તિનો શિકાર બનવા પામી નહીં. રાજનીતિનો ઉપયોગ જ્યારે એકાંગી રીતે થવા લાગે છે ત્યારે એ પોતાના ઉદેશ્યોને સીમિત કરી બેસે છે. જ્યારે આ તો સૌ પ્રત્યે જવાબદાર રહેવાની પ્રક્રિયા છે, જેને કોઈ ખાસ દસ્તિથી બાંધીને રાખી શકાય એમ નથી.

એક સાહિત્યિક વ્યક્તિત્વની સાથોસાથ અક્ષિકતમ સાચા અર્થમાં ગાંધીવાદી, સમાજસેવી, પત્રકાર, પટકથાલેખક વગેરે રહ્યા છે. એક રીતે જોતા આટલા દીર્ઘ જીવનકાળમાં એમના વ્યક્તિત્વે જે રીતે અનેકાનેક સ્વરૂપ અને આયામ ગ્રહણ કર્યો છે તે આમ જુઓ તો દુર્લભ કહેવાય. આઠ વર્ષની ઉમરમાં પોતાની પહેલી કવિતા લખીને એમણે મલયાળમ સાહિત્યમાં પોતાના પદાર્પણની ઘોખણા કરેલી. એક સુધારાવાદી

અને પુનર્જગરણા આંદોળન માટે સક્રિય કાર્યકર્તાના રૂપમાં એમની છબી ઘણી વહેલી સ્પષ્ટ થવા માંડેલી. એમનો સાહિત્યિક વિસ્તાર કવિતા ઉપરાંત કથાસાહિત્ય, નાટક, નવલકથા, અનુવાદ વગેરે સુધી લંબાય છે. ભારતીય જ્ઞાનપીઠનો પપમો જ્ઞાનપીઠ પુરસ્કાર અકિકતામને મળવો એ માત્ર સાહિત્યનું સમ્માન નથી બલ્કે સાહિત્યિક વ્યક્તિત્વના સમન્વિત આયામોનું પણ સમ્માન છે.

#### પાદટીપ :

૧. પપમા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર સામરંભ નિમિત્તે ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કરેલ સ્મરણીકાનો પ્રવેશક. તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કવિના ગામ કુમારનુલૂર ખાતે પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો હતો.
૨. તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૪ વર્ષની વયે કવિનું શ્રીસુર ખાતે નિધન થયું.



## સાભાર સ્વીકાર

### પ્રક્રીણ

સંશોધનશાસ્ત્ર અને સાહિત્યમાં સંશોધન નરેશ શુક્લ, ૨૦૨૦, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પૃ. ૧૦૮, રૂ. ૧૩૫. આલોક કેશુભાઈ દેસાઈ, ૨૦૧૯, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮ + ૧૦૪, રૂ. ૧૨૦. મહાત્મા ગાંધીનો પુનર્જન્મ સંપા. રોહિત શાહ, ૨૦૧૯, ગૂર્જર ગ્રંથ રતન કાર્યાલય, અમદાવાદ, ૧૪ + ૧૫૪, રૂ. ૧૮૦. જિયા એન્ડ દાદા યોગેશ જોખી, ૨૦૨૦, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, ૧૦ + ૧૪૧, રૂ. ૧૮૦. ગાંધીની નજરે દુનિયા મનસુખ સલ્લા, ૨૦૧૯, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, ૧૨ + ૧૪૮. આસ્વાદન સંચાલન, ૨૦૧૯, સાયુજ્ય પ્રકાશન, વડોદરા, પૃ. ૧૩૫, રૂ. ૨૦૦. ગાંધી : સનાતન કાંતિકારી હરેશ ધોળકિયા, ૨૦૧૯, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી સામે, ભૂજ, પૃ. ૬૪, રૂ. ૧૦૦. જીવ્યા કરતાં જોયું ભલું સંગીતા સુધીર શાહ, ૨૦૧૯, સુધીર શાહ, કરીમ ચેમ્બર્સ, ગ્રીજે માર્ગ, અંબાલાલ દોશી માર્ગ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩, પૃ. ૨૪ + ૨૭૨, રૂ. ૨૮૮. સબકો સન્મતિ હે ભગવાન (રેડિયો નાટકો) : યાકુબ કોઠારિયા, ભાલ પ્રદેશ ગુજરાતી સાહિત્ય સમિતિ, ધંધુકા, પૃ. ૨૨૪, રૂ. ૩૦૦.

## વિવેચન

# સર્જનાત્મક સાહિત્યમાં ભાવનની સમસ્યાઓ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ એના ‘માલતીમાધવ’ નાટકના પહેલા અંકમાં પોતાના કડક ટીકાકારોથી નારાજ થઈ જવાબ આપતાં લખેલું કે ચોક્કસ એનો યુગ આવશે જ્યારે મારો સમાનધર્મા કવિ ઉત્પન્ન થશે અને મારી કલાનો આદર કરશે. કારણ કાલ અંતહીન છે અને પૃથ્વી વિપુલ છે. (ઉત્પસ્યતે મમ તુ કોઽપિ સમાનધર્મા કાલો હ્યયં નિરવધર્વિપુલા ચ પૃથ્વી) ભવભૂતિથી માંડી છેક ઉમાશંકર જોશી સુધી આ એક દઢ માન્યતા રહી છે કે કોઈ ને કોઈ સમાનધર્મા મળી રહેશે. ઉમાશંકર જોશી તેથે જ ગુજરાતીમાં ‘સમસંવેદન’ જેવી સંજ્ઞા આપે છે. અહીં લેખક કે કવિની રચના પરને ભાવક તરફથી સમાન સંવેદનની અપેક્ષા રખાયેલી છે. સાહિત્યજગતમાં ચાલી આવેલો ‘સમાનધર્મા’ કે ‘સમસંવેદન’નો જ્યાલ સાહિત્યવિવેચનમાં નવેસરથી વિચારણા માગે છે.

અલબાતા સંસ્કૃતમાં રાજ્યોભર જેવા આચાર્ય એના અલંકારશાખના ગ્રંથ ‘કાવ્યમીમાંસા’ના ચોથા અધ્યાયમાં સાહિત્યજગતનાં બે મહત્વનાં અંગો, કવિ અને ભાવક બંનેની પ્રતિભાની કારયિત્રી અને ભાવયિત્રી તરીકે ઓળખ આપી વ્યાખ્યાઓ બાંધી છે. સા ય ધારયિત્રી ભાવયિત્રી. કારયિત્રી. પ્રતિભા. કવિને ઉપકારક છે, જ્યારે ભાવયિત્રી પ્રતિભા વિવેચક કે આલોચના ઉપકારક છે. રાજ્યોભર કહે છે :

એકસ્ય તિષ્ઠતિ કવેણુહ એવ કાવ્ય  
મન્યસ્ય ગચ્છતિ સુહ્દ્ભવનાનિ યાવત् ।  
ન્યસ્યાવિદગ્ધવદનેષુ પવાનિ શશ્ત્ર  
કસ્યાપિ સજ્જરાતિ વિશ્વકુતૂહલિવ ॥

કેટલાક કવિઓની રચના પોતાના ધરની ભીતર જ રહે છે, તો કેટલાકની મિત્રોનાં ભવનો સુધી પહોંચી જાય છે. કેટલાકની અવિદ્યોના મુખ પર સંચરણ કરતી વિશ્વભ્રમણની ઈચ્છા પૂરી કરે છે. આ કારયિત્રી પ્રતિભા છે, એની વ્યાખ્યા આપી રાજ્યોભર ભાવયિત્રી પ્રતિભાની વ્યાખ્યા આપે છે. રાજ્યોભર દશાવિ છે કે જો કારયિત્રી પ્રતિભા કવિને ઉપકારક છે તો ભાવયિત્રી પ્રતિભા વિવેચક કે આલોચના ઉપકારક છે. ભાવયિત્રી પ્રતિભા કવિના શ્રમને પૂર્ણ કરે છે અને કવિના વ્યાપારતરુને ફિલિત કરે છે. ભાવકસ્યોપકુર્વણ ભાવયિત્રી । સહિ કવેઃ શ્રમભિપ્રાયં ચ ભાવયતિ । તથા ખલુ ફલિતઃ કવેર્વાપાતરસુરન્યથા સોડવકોશી સ્વાત । વળી, રાજ્યોભર આ સાથે ભાવકોની ઉચ્ચાવચ કોટિઓનો પરામર્શ કરી દશાવિ છે કેટલાક અરોચકી સમાલોચકોને સારી રચનાઓ પણ સ્પર્શતી નથી, તો કેટલાક અતૃણાજ્યવહારી આલોચકો સારીનરસી બધી જ રચનાઓ પચાવી જાય છે. તો કેટલાક મત્સરી સમાલોચકો ઈર્ઘ્યવિશ રચનાને નાપસંદ કરે છે. આ

બધાંમાં રાજ્યોખરને મતે તત્ત્વાભિનિવેશી સમાલોચક જ શ્રેષ્ઠ છે, કારણ તત્ત્વાભિનિવેશી સમાલોચક જ અનોખી સૂજ સાથે રસાસ્વાદ માટે સક્ષમ અને તાત્પર્યશોધમાં નિપુણ હોય છે.

આ તો દેખીતા એવા ભાવકોના અભિગમના પ્રકારો છે. પણ ભાવકની ભાવથિતી પ્રતિભા શું છે, એની સામગ્રી શી છે. એ કઈ રીતે કાર્યાન્વિત થાય છે, એ કઈ પ્રક્રિયાનો આશ્રય લે છે, ભાવનતંત્ર શાનું બનેલું છે, ભાવનવ્યાપાર કઈ રીતે જન્મે છે, ભાવનક્ષેત્ર શેનાથી પ્રભાવિત છે, કેટલું પ્રભાવિત છે : આ બધા ભાવકપ્રતિભા-અંતર્ગત ઊંડતા સવાલો છે. સંસ્કૃત કાવ્યમીમાંસાને ભાવનની ચરમકોટિ પર રસમીમાંસા દ્વારા એની દાર્શનિક રીતએ પ્રત્યુત્તરો શોધવાના પ્રયત્નો કર્યા છે. રસમીમાંસા દ્વારા દર્શાવ્યું છે કે ભાવકના સ્થાયી ભાવો પર સાહિત્યના વિભાવ, અનુભાવ અને સંચારીભાવનોનું સંયોજન થતાં સાધારણીકરણથી સમાવિઅવસ્થા ઊભી થાય છે. અને એમાં સ્થાયીભાવનું રસમાં રૂપાન્તર થતાં નિરતિશય આનંદનો અનુભવ થાય છે. એક રીતે જોઈએ તો આ અભિગમ આદર્શિકરણ અને અમૂર્તકરણનો રહ્યો છે.

ભાવથિતી પ્રતિભા પરતે બીજો અભિગમ અનુભવનિષ્ઠ (empirical) અને મૂર્તકરણ (concretization) પણ હોઈ શકે. પદ્ધતિમના જગતમાં વિકાસ પામેલા મનોવૈજ્ઞાનિક સંશોધનો તેમજ અર્થઘટનશાસ્ત્ર (Hermeneutics) તેમજ પ્રતિભાસમીમાંસા (Phenomenology)નાં નિષ્કર્ષો પણ ભાવથિતી પ્રતિભાને સમજાવવા હવે ખેલગાડવા પડશે. એક બાજુ સાહિત્યસ્વરૂપ (work of art) છે અને બીજી બાજુ સાહિત્યકાર્ય (working of art) છે. આ બેનો સંદર્ભ અને સમન્વય હવે કેવળ તત્ત્વવિચારની ભૂમિ પરથી નહીં, પણ મનોવિજ્ઞાન અને અન્ય વિકસિત જ્ઞાનશાખાઓની ભૂમિ પરથી પણ જોઈએ.

આ ઉપરાંત ભાવથિતી પ્રતિભાને વર્તમાનમાં નડતા કેટલાક વિશેષ અવરોધો પણ લેખામાં લેવા જોઈએ. આજના ડિજિટલ વિશ્વમાં પૂરી એકાગ્રતા શક્ય નથી. આપણું હંમેશાં આંશિક ધ્યાન (Partial attention) એકાગ્ર થવા દેંઠું નથી. આથી રાજ્યોખર જેને સમાધિ, સાહિત્યમાં સમાધિ અવસ્થા કહે છે તે શક્ય નથી બનતી. વળી, વર્તમાન વિશ્વચિત્રને અનેક પૂર્વરોકાણો (preoccupations)થી વૈરાયેલું અને વ્યગ રાખે છે. તેથી કેન્દ્રભિન્નું મળતું નથી. ક્યારેક ચોક્કસ વસ્તુઓ પરત્યેનો આપણો અંધાપો (Blind spots) આપણને પૂર્વગ્રહયુક્ત રાખે છે. આ ઉપરાંત Writer's Blockની જેમ Reader's Block હોય છે, જે વાચનને દૂષિત કરતો રહે છે. અધૂરામાં પૂરું આપણા પોતાના પૂર્વગ્રહો (prejudices), પક્ષપાતો (favours) પણ સતત આડે આવતાં રહે છે. પણ આ બધાંમાં સૌથી મોટી અડચણ છે તે સાહિત્યવિષયની અપૂરતી તાલીમ (lack of technical training and background) છે. ભાવથિતી પ્રતિભાને સમજવા માટે આ બધા અવરોધો અને અંતરાયોનાં વિવિધ પાસાંઓ લક્ષમાં આવવાનું કારણ વાચકની અને વાચનની મનોવૈજ્ઞાનિક ભૂમિકા અંગેની સમજનો વિકાસ અને એને અંગેની સભાનતા છે.

પદ્ધતિમના વિવેચનમાં 'વિરેચન' (catharsis)ની ગ્રીક વિભાવના દ્વારા, 'ભબ્ય'ના સિદ્ધાન્તો દ્વારા, વિશ્લેષના જર્મન પ્રભાવ (Alienation effect) દ્વારા, રશ્યિન અપરિચ્છિતીકરણ (defamiliarisation) દ્વારા, અમેરિકન નવ્ય વિવેચન (American new

પરબ ફિસેભાર, 2020

criticism)નો પ્રતિભાવ દોષ (Affective fallacy) તેમજ આશયદોષ (Intentional fallacy)ની વિભાવનાઓ દ્વારા અપેક્ષાની ક્ષિતિજો (Horizons of expectation) દ્વારા ભાવન કે વાચનની વિભાવનાઓનું સતત એક યા બીજી રીતે વિશ્વેષણ થતું રહ્યું છે. જરા વિગતે જોઈએ તો ખેટો અને એરિસ્ટોટલે બતાયું કે વાચન દરમ્યાન સાહિત્ય પોતાની વિશિષ્ટ રચનાને કારણે કદ્દ રીતે મનુષ્યની લાગણીનું વિરેચન (catharsis) કરી એને વધુ વિવેકસ્થિતિમાં મૂકે છે. લોન્જાઈનસે રોજિંદા જીવનમાં સહજ નથી એવી ભવ્ય લાગણીઓ, ભવ્ય વિચારો અને ભવ્ય આચારોથી સાહિત્ય કદ્દ રીતે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં વાચન દરમ્યાન ભાવકને ઊંચકે (Transport) છે એ દર્શાવ્યું. બટોલ્ડ બ્રેઝ જેવાએ અવરોધની સાહિત્યપદ્ધતિ દ્વારા ભાવકને લાગણીમાં વહી જતો અટકાવી સવિવેક સંયત નિર્ણય લેવા સક્ષમ બનાવે છે. રશિયન સ્વરૂપવાદે અપરિચિતીકરણ-(defamiliarization)ની પ્રક્રિયા કદ્દ રીતે મનુષ્યસંવેદનને પુનર્જીવિત કરતી સતેજ કરે છે એ દર્શાવ્યું. અમેરિકન નવ્યવિવેચન પ્રતિભાવદોષ અને આશયદોષની સમજ આપી રચનાના એકમાત્ર કલેવરને કેન્દ્રમાં લાવવા વાયકને સભાન કરે છે. તો, યુગવાર ઐતિહાસિક ક્ષિતિજો પડછે કદ્દ રીતે સાહિત્યનો અર્થ બંધાતો રહે છે એની સાહિત્યિક સાપેક્ષતાને જર્મનો અગ્રેસર કરે છે. એવું પણ બન્યું છે કે કેટલાકે ભાવકના સર્વસામાન્ય સંવેદન પર ભાર મૂક્યો છે, તો કેટલાકે વૈયક્તિક ભિન્નતાને આગળ કરીને પ્રતિભાવો અને પ્રતિક્રિયાને તપાસ્યાં છે. કેટલાકે કવિતાને પદાર્થ (object) તરીકે ન સ્વીકારી કવિતાના માત્ર પ્રભાવને કેન્દ્રમાં મૂક્યો છે. કેટલાકે સાહિત્યનાં વિવિધ વાચનોથી ઉભા થતા પ્રભાવોને લક્ષ્ય કરીને નારીવાદી, દલિતવાદી, સંસ્થાનવાદી-પ્રતિસંસ્થાનવાદી જેવાં વિશિષ્ટ વાચનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજી રીતે કહીએ તો વાચનનું શિક્ષણ (teaching of reading) મહત્વનું બન્યું છે.

આ ભવાં પાછળનું ચાલકબળ અભિગ્રહણ સૌન્દર્યશાસ્ત્ર (Receptive Aesthetics) અભિગ્રહણ સિદ્ધાંત (Reception theory), વાચકનો સિદ્ધાંત (Theory of readers), વાચકનો પ્રતિક્રિયા સિદ્ધાંત (Readers repouse theory) છે. આ અભિગ્રહણ સિદ્ધાંત, બીજી રીતે કહીએ તો ભાવિત્રી અભિગમ અગત્યનો બન્યો છે.

મૂળે તો અમેરિકન નવ્યવિવેચન સંરચના (Structure) અને પોત (Texture)ને આગળ ધરીને સાહિત્યકૃતિને એના લેખકના આશય અને વાચકના અનુભવથી દૂર કરી રહી હતી અને સાહિત્યકૃતિની અંતર્ગત ભાષાના સંબંધો પર સાહિત્યકૃતિને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા પ્રકારના અભિગમને કારણે વાયક કે ભાવકનો તેમજ લેખકનો પણ છેદ ઉડી ગયો હતો. આની પ્રતિક્રિયા રૂપે અભિગ્રહણનો વાયકકેન્દ્રી અભિગમ અગ્રયાધી બન્યો. બીજી રીતે કહીએ તો ભાવક કે વાયકનું આ પુનરાગમન હતું. આ અભિગમમાં વાચનનો એક આકમક આનંદ (Ravishment) ઉમેરાયો. સાહિત્યની સંદિગ્ધતા, એના અવઢવ, એના અતિરેકો, એના મૌન સ્તરો ઉપરોગમાં લેવામાં આવ્યાં : હવે કોઈ એક અર્થ કે સ્થિર અર્થની બેવનાનો ઈન્કાર થયો. દર્શાવાયું કે ક્યારેય વાચનનો કોઈ અંત નથી. કારણ વાયક ક્યારેય પૂરતું વાંચતો નથી કે પૂરું વાંચવાની ક્ષમતા ધરાવતો નથી.

સાહિત્યકૃતિ વચ્ચે આપણે લિસ્સેદાર (Participant) ધીએ. આનો અર્થ એ થયો કે

આ તબક્કે વાચનનું નિશ્ચિત પ્રતિમાન (Model) છીનવાઈ ગયું. વાયક સાહિત્યકૃતિમાં અર્થનો ઉત્પાદક બન્યો. આને કારણે લેખક, વાચક, કૃતિ, સાહિત્યભાષા, વ્યવહારભાષા, સાહિત્યવિશ્લેષણની પરંપરાગત ક્રોટિઓ – આ સર્વ પ્રશ્નાર્થમાં મુકાયાં. પરિણામે વાચનની પ્રક્રિયા કેન્દ્રમાં આવતાં હવે વાચન જ હકીકતે સાહિત્યની વ્યાખ્યા બાંધે છે. પણ આ વાચન એક જવાબદારી પણ ઊભો કરે છે. તમે સાહિત્યકૃતિની વિગતો સાથે શું કરો છો, તમે અર્થઘટનો વચ્ચે કયા અર્થઘટનો સ્વીકાર કરો છો. અર્થઘટનમાં કાંઈપણ ચાલી શકે એવું તો નથી. તમારે કૃતિને અર્થ આપવાનો છે. તમારે તમારા વાચનને, વાચનની ઘટનાને બીજાને ગળે ઉત્તારવા માટે પરિશ્રમ કરવાનો છે. સૌથી મહત્વનું તો એ છે કે તમે વાંચતાં વાંચતાં કોઈ ચોક્કસ અર્થઘટન પર ડેવી રીતે પહોંચ્યા એને પ્રતીત કરાવવાનું રહે છે.

ઉદાહરણ તરીકે લેખક ચેંડ્રકાન્ત પંડ્યાના પુત્ર સતીશ પંડ્યા એક વકીલ હોવા ઉપરાંત સાહિત્યસેવી પણ છે. એમણે એમના પુસ્તક ‘મારી દસ્તિ’ ( )માં કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્ભુ’ અને શૂદ્રકના ‘મૃદુષ્ઠકટિક્મુ’ જેવાં સંસ્કૃત નાટકોમાં ન્યાયતંત્રવિષયક (Judicial criticism) વાચન કર્યું છે, અને એ સાથે સંસ્કૃત નાટ્યરચનાઓને નવી તાજગી બદ્ધી છે. ન્યાયતંત્ર-અંતર્ગત ‘વ્યવહાર’ જેવા પ્રચિલત શષ્ઠનો કોઈ વિશિષ્ટ પારિભ્રાષ્ટક અર્થ થાય છે. ‘વ્યવહાર’ના અનેક અર્થોમાં એક અર્થ છે – દાવો ન્યાય, નિર્ણય વગેરે. વળી, એમાં વાદી, પ્રતિવાદી જે પોતપોતાના પક્ષો રજૂ કરે તેને અંગે સંદેહ ઊભો થાય તેને દૂર કરનારો વિચાર એ પણ વ્યવહાર છે. ‘શાકુન્તલ’ અને ‘મૃદુષ્ઠકટિક્મુ’ બંને નાટકોમાં સતીશ પંડ્યાએ સાંયોગિક પુરાવા (circumstantial evidences)ને ધ્યાન રાખી નાટકના સૂક્ષ્મ તંત્રોને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. ‘વ્યવહાર’ની દસ્તિએ થયેલાં આ બંને નાટકોનાં વાચનો આ નાટકોને જોવામાં જરૂર નવો સંચાર ઊભો કરે છે. આ દશાવિ છે કે અર્થ સંદર્ભગત છે પણ સંદર્ભો સીમાધીન હોય છે.

અહીં સ્પષ્ટ થશે કે વાચકે સાહિત્ય પરત્વે કયા પ્રકારની પદ્ધતિ અપનાવવી જોઈએ, અર્થઘટના અને પ્રતિક્રિયાઓ માટે કઈ ધારણાઓ, ડેવી રીતે સ્વીકારવી જોઈએ, કઈ રીતે સાહિત્યનો અર્થ કરવો જોઈએ એનો આ અભિગમ અણસાર આપે છે. અભિગ્રહણ સિદ્ધાન્ત માને છે કે સાહિત્યનો અર્થ વાચકનો અનુભવ છે. આ અનુભવમાં ધારણાઓ છે, અવફવ છે, સામનાઓ છે, કંઈક પ્રણાલીઓ છે, અપેક્ષાઓ છે – આ બધાંને કાર્યાન્વિત કરવામાં આવે છે. કૃતિનું અર્થઘટન એ આમ રચનાનું વિવરણ છે. સાહિત્યવાચનમાં મહત્વનું એ છે કે તમે જ્યાં પહોંચો છો તે કઈ રીતે પહોંચો છો. તમે સામે આવેલી સામગ્રી સાથે શું કરો છો, તમારા પ્રતિભાવ માટે તમે એ સામગ્રીની વિગતોને કઈ રીતે ખપમાં લો છો. આમ જોઈએ તો અમેરિકન નવ્યવિવેચન જે વાચકની પ્રતિક્રિયાને બાદ કરીને ચાલતું હતું તે વાચકની પ્રતિક્રિયા અભિગ્રહ સિદ્ધાન્તમાં કેન્દ્રસ્થ બને છે.

સાહિત્યનો પરંપરાગત અર્થ દશાવિ છે કે સાહિત્યમાં અર્થ શું છે. જ્યારે એની સામે અમેરિકન નવ્યવિવેચન દશાવિ છે કે અર્થ ડેવી રીતે ઊભો થાય છે. તો અભિગ્રહણ સિદ્ધાન્ત દશાવિ છે કે સાહિત્ય અર્થનું સહસર્જન કરવા શું કરે છે. સાહિત્ય અને વાયક એ પરસ્પર પર પ્રભાવ નાખતી આંતરક્રિયાશીલ ઘટના છે. સાહિત્યરચના એ કેવળ વસ્તુ

નથી પણ ઘટના (event) છે. સાહિત્ય અને ભાવક વચ્ચેની આ આન્તરાક્ષિક્યા (Interactive process)ને કારણે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે ઐતિહાસિક સંદર્ભોથી વાચન અપેક્ષાની ક્ષિતિજો (Horizons of expectation) લઈને સાહિત્ય પાસે જાય છે. વાચકની આ અપેક્ષાઓની ક્ષિતિજોને કારણે જો વાચક નારી હોય, જો વાચક સમલિંગી હોય, વાચક દિવિત કે અશેત હોય, વાચક દિવ્યાંગ હોય તો અર્થઘટનની પ્રણાલીમાં એમનું જુદું જ યોગદાન શક્ય બને છે. બીજી રીતે કહીએ તો આ રીતે સાહિત્યવાચન સામાજિક અનુષ્ઠાન (social practice) તો છે પણ આને કારણે સાહિત્ય અને અભિગ્રહણ વચ્ચેની કિયા ગતિશીલ બને છે. વસ્તુલક્ષી સાહિત્ય-અભિગમથી વિપરીત મનોવૈજ્ઞાનિક અને પ્રતિભાસ મીમાંસાપૂર્ણ આ અભિગમ વૈયક્તિક ભિન્નતાનો સમાદર કરે છે.

રાજશેખરના વિવિધ આલોચકોની જેમ અભિગ્રહણ સિદ્ધાન્તમાં કેટલાક આદર્શ વાચક (ideal readers) હોય છે. કેટલાક વધુ સારા (superior readers) વરિષ્ઠ વાચક હોય છે. કેટલાક સૂચિત વાચકો (implied readers) હોય છે. કેટલાક કલ્પિત વાચક (Virtual readers) હોય છે તો કેટલાક ઇતિહાસગત વાચક (Historical readers) હોય છે. પ્રતિકારી વાચક (Resisting readers)-ની પણ નોંધ લેવાયેલી છે. બીજી રીતે કહીએ તો અભિગ્રહણ સિદ્ધાન્તમાં અર્થ અંગેના અનેક સિદ્ધાંતો અને અનેક પ્રકારના ‘વાચકો’ એમાં દાખલ થયા છે.

કેટલાક રચનામાં રહેલા અર્થને મેળવવા ધારે છે. કૂતિનું Paraphraser કરે છે અને વસ્તુલક્ષી અર્થની શોધ કરે છે. કેટલાક માને છે કે વાચન સમયમાં થતું હોય છે તેથી સંવેદનો, વિચારો, લાગણીઓ, મૂલ્યાંકનો, પ્રતિક્યાઓ સમયે સમયે બદલાતાં રહે છે અને તેથી અર્થ પદાર્થ નથી, પણ પ્રક્રિયા છે એ જોઈ શકાય છે. કેટલાક અર્થને નીપજ (product) માને છે. સામાજિક સંકેતો અને અર્થઘટનો વચ્ચે મનોવૈજ્ઞાનિક કે સમાજવૈજ્ઞાનિક અર્થઘટનો વચ્ચે મનોવૈજ્ઞાનિક અને સમાજવૈજ્ઞાનિક રચના ઊભી કરે છે. આથી ઊલ્લંઘન, બહારનાં તત્ત્વોને સંદર્ભર બાદ કરી રચનાની તરાહ કે ડિઝાઇન પર ભાર મૂકે છે. કેટલાક માને છે કે રચનામાં અર્થ (meaning) એક રહે છે પણ અર્થવત્તા (significance) બદલાયા કરે છે. મહત્વની વાત એ છે કે જે તે વાદમાં માનનારા વાચનને જે કે તે વાદ સાથે જોડવાનો પુરુષાર્થ કરે છે. આ બધું જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે સાહિત્યક્ષેત્રે વાચક અને અર્થ અંગેનો જ્યાલ આખરી નથી લેવાનો. સાહિત્યનું ભાવનક્ષેત્ર એક સંકુલ ક્ષેત્ર છે.

આ બધાં કારણોને લઈને, પ્રારંભમાં આપણે જોયું તેમ ‘સમાનધર્મા’ કે ‘સમસંવેદન’નો જ્યાલ આજે ટકી શકે તેમ નથી. આ જ્યાલ પુનર્વિચારણ મારે છે. ભાવકની હેસિયત અને ભાવનાની પ્રક્રિયા સમયે ઇતિહાસના પડકારો જીલે છે. એટલું જ નહીં, વૈયક્તિક મનોવ્યાપારો પણ સમયે સમયે પરિવર્તિત થતાં આવે છે. અપેક્ષાની ક્ષિતિજો પણ વિસ્તરતી અને સંકોગાતી અને બદલાતી રહે છે. કોઈ એક સમયે ભાવક દ્વારા, ભાવનવ્યાપાર દ્વારા થયેલી પ્રક્રિયા જે તે ભાવકસ્થિતિને પ્રતિબિંબિત કરતી ચાલે છે. □

નોંધ : \* શ્રી મોહનલાલ પટેલ ભારતીય સાહિત્ય વાખ્યાન-માળા અંતર્ગત હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં આપવાનું હતું તે વક્તવ્ય કોરોનાકાલને કારણે અનિશ્ચિત સમય માટે મુલતવી રહ્યું છે.

## કલાવિદુષી કપિલા વાત્સ્યાયન

ભરત દવે



૨૦૨૦નું વર્ષ દુનિયાભરમાં કોરોનાની મહામારીનું વર્ષ છે જેણે અનેકનો ભોગ લીધો છે. પરંતુ આ વર્ષમાં એ સિવાય પણ એવી કેટલીય જાણીતી હસ્તીઓએ વિદ્યાય લીધી છે જેમાં અભિનેતા રિશિકપૂર, ઈરફાન, બાસુ ચેટરજી, પં. જસરાજ, ઈબ્રાહિમ અલ્કાજી, સૌમિત્ર ચેટરજી વગેરેનો સમાવેશ થાય છે. આ યાદીમાં એક વધુ નામ ઉમેરાય છે કલાવિદુષી કપિલા વાત્સ્યાયનનું. કદાચ મોટા ભાગના લોકો આ નામથી એટલા પરિચિત નહીં હોય પરંતુ આ દેશની મહાન સમૃદ્ધ કલાસંસ્કૃતિનો વિશ્વભરમાં પરિય કરાવનાર, ભારતીય કલાઓનો ઈતિહાસ આલેખનાર, વિદેશી કલાવિશેષજ્ઞોમાં ભારતીય સંસ્કૃતિ પરતે ઉત્સુકતા પેદા કરનાર અને ભારતની કલાક્ષેત્રે શાસકોની, શિક્ષણકારોની અને કલાઉપાસકોની દાણી અને દિશા કંડારી આપનાર કોઈ હોય તો તે કલાવિદુષી કપિલા વાત્સ્યાયન (૧૯૨૮-૨૦૨૦) હતાં.

સ્વયં એક ઉત્કૃષ્ટ કોટિનાં વિદ્યાન, લેખિકા અને કલાવિશેષજ્ઞ હોવા ઉપરાંત તેમનો બીજો પરિય એ પણ આપી શકાય કે તેઓ મહાન હિન્દી કવિ સચ્ચિદાનંદ વાત્સ્યાયન ‘અશેય’નાં પણી હતાં. તેઓનું લગ્ન ૧૮૫૫માં થયેલું. ૧૮૮૮માં બંને અલગ થઈ ગયા પછી પણ વાત્સ્યાયન તરીકેની ઓળખ કપિલાજીએ જાળવી રાખેલી. કપિલા વાત્સ્યાયન ભારતીય કલાસંસ્કૃતિના હરતાફરતા ‘અનસાઈકલોપીલિયા’ હતાં. તેમને હૈય અને હોઠે સદાય ભારતીય કલાઓનું ઉત્થાન, જાળવણી, પ્રસાર અને તેનાં ગૌરવ-પ્રતિજ્ઞા રહેતાં આવેલાં. તેમની વિદ્વત્તાથી, તેમના કામથી અને તેમની સર્જનાત્મક કલ્પનાશક્તિથી કપિલા વાત્સ્યાયન ભારતીય સભ્યતા-સંસ્કૃતિનાં એક મુખર પ્રવક્તા,

એક શક્તિશાળી અવાજ બની ગયાં.

તેમના જીવનકાર્યમાં કપિલાજીએ સૌથી વધારે ભાર તો ભારતના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસા પર, કલાસૌદર્ય બાબતે ભારતીય માનસના ખુલ્લાપણા પર અને આપણી પ્રજાના સર્વસમાવેશી દાખિલાણ પર મૂકેલો. કલાઓ પ્રત્યેની તેમની ગહન સમજ અને પ્રતિબદ્ધતા તેમને ૧૯૮૮માં ‘ઈંડિયા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ’નાં સ્થાપક ટ્રસ્ટી બનાવવા દોરી ગઈ જેમાં તેમો વર્ષ ૧૯૮૮ની ૨૦૦૦ સુધી એકેટેમિક ઇરેક્ટર તરીકે પણ રહ્યાં. કપિલા વાત્સ્યાયને તેમની જિંદગીના છ દાયકા નૃત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે જેવાં વિવિધ કલાસ્વરૂપોને સમજવા-શીખવામાં, તેના તબક્કાવાર ઈતિહાસનું અધ્યયન કરવામાં, પ્રત્યેક કલાસ્વરૂપના ઉદ્ગમ અને વિકાસ પાછળનાં કરણભૂત પરિબળોને ખોળવા-સમજવામાં અને એ બધાંનું ઊંડાણથી અધ્યયન, પરિશીલન, લેખન કરવામાં ગાળ્યાં. એ બધાંના પરિપાક રૂપે તેમણે આપણને કેટલાક મૂલ્યવાન કલાવિષ્યક ગ્રંથો પણ આપ્યા.

કપિલા વાત્સ્યાયન જોડેનો મારો પરોક્ષ પરિચય દિલ્હીમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના અભ્યાસકાળથી. નાટ્યશિક્ષણના અમારા અભ્યાસક્રમમાં એક વિષય ‘ભારતીય પ્રશિષ્ટ નાટકો’ (Classical Indian Drama)નો હતો જે માટે કપિલા વાત્સ્યાયનનાં કેટલાંક વ્યાખ્યાનો અમારે માટે ગોઠવવામાં આવેલાં. સંસ્કૃત નાટકો, ભરતનું નાટ્યશાસ્ત્ર, ભારતીય નૃત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને સંગીતની કલાઓ, એ દરેકનો ઈતિહાસ, એ પાછળના ગુઢાથોડો વગેરેની ઘણી ઘણી સમજ ધરાવનારાઓમાં કપિલાજી અજોડ હતાં.

વધુમાં કપિલા વાત્સ્યાયન, મૂળ આપણા ગુજરાતનાં પરંતુ દિલ્હીને કાર્યક્રીત બનાવી, એનાભેસિસીમાં અધ્યાપનકાર્ય કરતા શ્રી ગોવર્ધન પંચાલના ધનિષ મિત્ર રહેલાં. પંચાલદાદાનો વિષય તો હતો ‘નાટ્યગૃહોનું સ્થાપત્ય’ (થિયેટર આર્કિટેક્ચર), પરંતુ તેમની ‘પેશન’ હતી કલાસિકલ સંસ્કૃત નાટકો અને નાટ્યાચાર્ય ભરતમુનિએ વ્યાખ્યાયિત કરેલી ગ્રાચીન ભારતીય રંગભૂમિ. આ અભ્યાસ-સંશોધનમાં અને છેવટમાં ગ્રકાશિત કરાયેલા તેમના બે ગ્રંથોમાં પંચાલદાદાને સૌથી વધારે માર્ગદર્શન કપિલા વાત્સ્યાયનનું મળેલું. એનાભેસિસીમાં કપિલાજીનાં વ્યાખ્યાનો આયોજિત કરવા પાછળ પણ પંચાલદાદાનો જ ઉત્સાહ જવાબદાર રહેલો. એનાભેસિસીમાંથી નિવૃત્ત થયા બાદ દાદા અમદાવાદમાં સ્થાયી થયેલા અને મારાં ઘણાં નાટકોમાં તેમણે સેટિઝાઈન કરેલી તેથી તેમને અવારનવાર મળવાનું થતું. મને યાદ છે કે એ અરસામાં દાદા તેમના અભ્યાસ-સંશોધનમાં ક્યાંય પણ ગ્રંથવાય એટલે અચૂક કપિલાજીને યાદ કરતા.

કપિલાજીનો જન્મ ૧૯૮૮માં દિલ્હીમાં પિતા રામલાલ મલિક અને માતા સત્યવતી મલિકના પંજાબી આર્યસમાજ પરિવારમાં થયેલો. જાણીતા હિન્દી કવિ-વિવેચક કેશવ મલિક તેમના મોરા ભાઈ થતા હતા. નાનપણથી જ કપિલાજી સ્વતંત્ર મિજાજનાં હતાં. શિક્ષણમાં તેમણે અંગ્રેજ સાહિત્ય સાથે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી અને એજ્યુકેશનના વિષય સાથે અમેરિકાના મિશિગાન વિશ્વવિદ્યાલયમાંથી – એમ બે અનુસ્નાતક ડિગ્રીઓ

મેળવેલી. પછીનાં વર્ષોમાં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી વાસુદેવશરન અગરવાલના માર્ગદર્શન હેઠળ કવિ જ્યદેવના પ્રસિદ્ધ કાવ્ય ‘ગીતગોવિંદ’ને ભારતીય દશકલાઓમાં વિવિધ સ્વરૂપે ઉતાર્યા હોવાના વિષય પર જ પીએચડી કરેલું. અને એટલે જ પછીનાં વર્ષોમાં કપિલાજી જેટલા વિસ્તારથી જ્યદેવના ‘ગીતગોવિંદ’ કાળજા સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ વિશે બોલી શકતાં એટલી જ તીવ્રતા અને નિસબ્ધત સાથે પાછ્લો પિકાસોનાં સર્જન વખતની વિષમ રાજકીય-સામાજિક પરિસ્થિત વિશે પણ બોલી શકતાં. પોતાના ગુરુની માફક કપિલાજીએ પણ ભારતીય કલાઓની ઓળખરૂપ વિભિન્ન મથાળાંઓને દૂર કરી દઈ એ કલાઓનાં મૂળમાં એકિસાથે અસ્તિત્વ ધરાવતા સંખ્યાબંધ પ્રવાહોને ખોળી કાઢવા બહુ ઊંઠ સંશોધન કરેલું. આ પછી તેમણે દિલ્હી, બનારસ, ફિલાડેલ્ફિયા અને કેલિફોર્નિયાનાં શૈક્ષણિક સંસ્થાનોમાં અધ્યાપનકાર્ય કરેલું.

કોલકાતા, શાંતિનિકેતનમાં તેમના નિવાસ દરમિયાન પૌર્વિત્ય નૃત્યોના સમૃદ્ધ સાંસ્કૃતિક મૂલ્યને એક વાર પામી લીધા બાદ કપિલાજી કથક શીખવા અચ્યન મહારાજ પાસે ગયા. ભરતનાટ્યમ્ શીખવા માટે મીનાક્ષી સુંદરમ્ પિલ્લાઈ પાસે ગયાં. અમોભી સિંઘ પાસેથી મણિપુરી નૃત્ય શીખ્યાં. હજુ આગળ ઉપર તેમણે કલાકેત્રમાંથી પણ ભરતનાટ્યમ્ અને ઓડિસી નૃત્યશૈલીઓની તાલીમ મેળવી. ૧૯૪૫માં દિલ્હીના ફિરોઝશાહ કોટલાની પાર્શ્વભૂમાં યોજાયેલા સૌપ્રથમ રાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં તેમણે કથક નૃત્યની રજૂઆત કરેલી. કપિલા વાત્સયાન કમલાદેવી ચહોપાધ્યાય અને રુક્મણિદેવી અરુંડલે પાસેથી પણ ધણું શીખવા પામેલાં.

ગોવર્ધન પંચાલની જેમ જ આપણા ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી હકુ શાહના પરિવાર જોડે પણ કપિલાજીનો ઘનિષ્ઠ સંબંધ રહેલો અને એટલે તેમણે એકથી વધુ વાર અમદાવાદની મુલાકાત લીધેલી. હકુ શાહના પુત્ર જાગીતા તસવીરકાર પાર્થિવ શાહે પણ કપિલાજીના માર્ગદર્શન હેઠળ ખૂબ કામ કરેલું. તેમના મત અનુસાર ‘કપિલાજી કથક શિસ્ત સાથેના ભારે કપરા ‘task master’ હતાં. એટલે કે તેમની નિશ્ચામાં કામ કરવું એક કસોટી, એક ભારે પ્રકાર હતો. કારાશ કે તેમની અપેક્ષા અને મૂલ્યાંકન ધશા ઊંચાં રહેતાં. તેમની કાર્યદર્શિ અને શિસ્ત પણ ગજબની હતી. તેમની સાથે કે તેમના હાથ નીચે કામ કરતી વ્યક્તિની એટલી તૈયારી કે સજજતા ન હોય તો તેનું આવી જ બનતું.’

પાર્થિવ પોતાનો અનુભવ વાર્ષિકતાં કહે છે કે, ‘કપિલાજીની પ્રકૃતિ અને વ્યક્તિત્વ જ એવાં હતાં કે તેમની જોડે કામ કરતા સરકારી અધિકારીઓ તેમને હંમેશાં ગંભીરતાથી લેતા અને સાથે તેમનો આદર પણ કરતા. એમનાં નેતૃત્વ હેઠળ કામ કરવું ખરેખર કઠણ હતું, વળી આ સમય એવો પણ હતો જ્યારે મોટા ભાગના પુરુષોની માનસિકતા હજુ મહિલા બોસ (ઉપરી-અધિકારી) હેઠળ કામ કરવા ટેવાયેલી નહોતી. તેમના મનમાં સતત એક વિરોધી ભાવ રહેતો. પરંતુ આખરમાં સૌ કોઈને એક હડીકત સ્વીકારવી પડતી કે એમના વિષયો પરનું તેમનું જ્ઞાન અને સમજ અભૂતપૂર્વ હતાં.

ગોવર્ધન પંચાલ, હકુ શાહ, પાર્થિવ શાહ અને હજુ એક ગુજરાતી સુપ્રસિદ્ધ

नृत्यसभीकुक अने कलाविद - डॉ. सुनिल कोठारी पण कपिला वात्स्यायनना निकटना वर्तुणमां रहेला. तेमनी असाधारण विद्ताने अंजलि आपतां तेओ कडे छे के तेमाणे भारतीय कलासिकल साहित्य, नृत्य अने शिल्पनो सौपदेली वार संयुक्त, सहक्रियात्मक (synergic) संबंध जोडी आपी ए माचीनकाणना विविध सर्जनोमां सचवाई रहेली एकसूत्रता पर भार मुळेलो. कपिला वात्स्यायने कलासिकल साहित्य अने कलाओने एक महान युगकर्म रुपे निहाणी तेनु आपणने अभंड दर्शन करावेलु. तेमाणे संस्कृत नाटको, भारतीय नाट्यशास्त्र, शिल्प-स्थापत्य, सौंदर्यशास्त्र, अथात अने नृत्य-यित्र जेवी अन्य कलाओने विचार अने कल्पनाशीलताना आधारे जोडीने समजावेली.

भारतीय कलासिकल, पारंपरिक अने समकालीन नृत्योने तेओ परस्परना कोई जटकराव के आंतरविरोध वगर जोई शक्यां. ए बधांमां तेमने लगभग समप्रमाणमां कल्पनाशीलता अने सर्जनात्मकतानां दर्शन थ्यां. परिणामे तेओ एकसरभा आन्वित्यास साथे प्रशिष्ट अने आधुनिक कलाविश्वमां विहार करी शक्यां. एक वार एक मुलाकातमां तेमाणे कडेलु के, ‘हुं क्यारेय आधुनिक नृत्यथी (बीजा) आधुनिक नृत्य तरफ नहोती गई, पारंपरिक नृत्यथी आधुनिक नृत्य तरफ गयेली. परिणामे तेनां आहि, उद्गम अने विकास पाढ्यानां कारणभूत परिभणोने हुं जाणी शकेली.’

भारतीय नृत्योनी साथे साथे कपिलाज्ञामे पाश्चात्य नृत्य-स्वरूपो समजवामां पण खूब रस देखाडेलो. त्यांनां नृत्य-स्वरूपो विशेनुं तेमनुं आकलन ऐवुं हतुं के ‘भारतीय नृत्यपरंपरा पृथ्वी जोडे संवाद साधे छे ज्यारे पश्चिमनी नृत्यपरंपरा तेनाथी मुक्त थवा जंभे छे पण अनेक प्रयासो इतां ए ते करी शकी नथी.’ मूर्तने अमूर्त साथे अथवा गोचरने अगोचर साथे संभिश्चित करवा तेमज कला अने विज्ञान वय्येना संबंधने ओणाखवा तेमाणे गहन चिंतन कर्या. ते उपरांत भारतीय नृत्यस्वरूपोमां नर्तकोना देहना भौमितिक आकारो अने तेमनी क्षंगतमां भारतीय सांस्कृतिक नबोमंडणने तेजेमय करी देती संकुल ताल-रचनाओ संदर्भे पण कपिलाज्ञामे घडी रसप्रद समजूतीओ आपी.

कपिला वात्स्यायने भारतीय नृत्यमां रहेली ‘शारीरिकता’(physicality)नो अभ्यास कर्या. अने बाईमां तेने पाश्चात्य नृत्यनी ‘शारीरिकता’ साथे सरभावी तेना अनोआपणाने समजवा प्रयास कर्या. तेमने प्रतीति थर्थ के एशियन परंपरामां रहेली ‘शारीरिकता’ नृत्य दरभियान नर्तकना शरीरने अतिकमी जती जोवा भणे छे. एशियन नृत्य दृष्टानी धरती साथे जडायेलु छे ज्यारे पाश्चात्य नृत्य अवकाशमां उडवा जंभुं नजरे पडे छे! अने आ तङ्गावत नोंद्धवा इतां बंनेमां रहेली सहक्रियात्मकता(synergy)नी नोंद्ध लेवानुं पण तेओ युक्यां नथी. एक वार तेमाणे कडेलु के ए ग्रयेक पारंपरिक नृत्यशैलीना रुढिगत नीतिनियमोथी बंधाया वगर हुं तेना अंतर्सात्वने पामी शकी. अम पण कडी शकाय के हुं निर्बंध इतां एक प्रकारे ‘बंध’ (अथवा बद्ध) व्यक्ति बनी शकी ! (unbounded bounded person)”.

कपिला वात्स्यायन प्रयोग के परिवर्तनानां सहेज पण विरोधी न हतां. पण तेमनो ए आग्रह जडूर हतो के तमारो दरेक नवो प्रयोग भारतीय कलासिकल नृत्य-स्वरूपोने

આગળ વિકસાવવાના ધ્યેય સાથેનો જ હોય અને તેના મૂળ પ્રાચીન સ્વરૂપને ઓગાળવાનો, તેની અસલિયતને નબળી પાડવાનો કે તેના અંતર્સત્તવથી પ્રેક્ષકોનું ધ્યાન વિચલિત કરવાનો આશય બિલુકુલ ન હોય. અહીં એ પણ યાદ રહે કે કપિલા વાત્સ્યાયનના રસ કે પસંદગીના વિષયોનો વ્યાપ માત્ર ભારતીય નૃત્યો સુધી મર્યાદિત ન હતો. આ બાબત તો તેમનાં લખાણોથી જ સાબિત થઈ જાય છે. જેમ કે એમના આ એક ગ્રંથનું જ મથાળું વાંચો : 'Plural Cultures and Monolithic Structures : Comprehending India and The Indian Arts, their Ideational Background and Principles of Forms.'

ભારતીય નૃત્યપ્રકારોને સમજવામાં કપિલાજીના સર્વોઽિ અભિગમે એક તદ્દન નવો માર્ગ કર્યારો. તેમના પ્રયાસોથી ભારતીય નૃત્યો ન માત્ર વિશ્વના સાંસ્કૃતિક નકશા પર ગૌરવપૂર્ણ સ્થાન પામ્યાં પરંતુ એનો વિસ્તૃત પ્રસાર અને અર્થસભર સમજૂતી દુનિયાના અનેક કલાપ્રેમીઓ અને અભ્યાસીઓને ભારતીય નૃત્યકલાના હજુ આગળ પરના સંશોધન-વિશ્લેષણ તરફ દોરી ગયાં. એમના બહુપરિમાણી વ્યક્તિત્વને કારણે તેઓ સભાન પ્રયાસો વગર ખૂબ જ સહજતાથી તેમના સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારમાં નક્કર સ્વરૂપ આપી શક્યાં. ભારતીય કલાસંસ્કૃતિને તેના ખરા સંદર્ભમાં સમજ શકવા માટે તેમણે બહુવિષયક અભિગમ લાગુ પાડ્યો. હિન્દી કવિ અશોક વજેયી લખે છે કે 'ભારતીય સંસ્કૃતિને કપિલા વાત્સ્યાયને એક વહેતી નદી રૂપે નિહાળી જેની દિશા તો જાણી શકાય પણ તેનું રૂપ, તેનો આકાર, તેના વહેણો અને વમળો સમયની સાથે સાથે નિરંતર બદલાતાં રહે એ હીકીકત સ્પષ્ટ કરી આપી.'

કપિલા વાત્સ્યાયન એક અનુભવસિદ્ધ સંસ્થા-સ્થાપક (Institution Builder) હતાં. તેમણે "Centre for Cultural Resources and Training"ની સ્થાપના કરી. એવી જ રીતે "Indira Gandhi National Centre for the Arts" વિકસાવવાની સંકલ્પના પણ તેમની જ હતી. આ સાથે તેઓ "Indian Council for Cultural Relations"નાં ઉપમુખપદ રહેલાં. તેઓ "Indian International Centre"ના પણ પ્રમુખ હતાં અને "Asiatic International Research Division"ના ચેયરપર્સનપદ પણ રહેલાં. સાહિત્ય, લાલિતકલા અને સંગીત-નાટક જેવી દેશની મુખ્ય ત્રણ રાષ્ટ્રીય અકાદમીઓની સ્થાપના કરવા પાછળ પણ તેમનું જ અધિકતર માર્ગદર્શન રહેલું. તેમની બે વખત રાજ્યસભામાં પણ નિમણૂક થયેલી.

કપિલા વાત્સ્યાયન ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં કલાસંસ્કૃતિ વિભાગનાં મંત્રી પણ રહી ચૂકેલાં. ત્યાં કલાક્ષેત્રે એમની ભૂમિકા સલાહકારની, વહીવટકટરની અને નીતિનિષ્ઠાયિકની હતી. કપિલાજી દેશમાં ઠેર ઠેર ગ્રંથાલયો, સંગ્રહાલયો અને પુરાતન મૂલ્યવાન ચીજવસ્તુઓને એકત્ર કરનાર તેમજ જાળવનાર સંગ્રહસ્થાનો ઊભાં કરવાં અને તેમને ઉત્તરોત્તર વિકસાવવાની પ્રવૃત્તિ સાથે પણ સક્રિયપણે જોડાયેલાં. પાંચ દાયકાઓ સુધી તેઓ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સંબંધો જોડે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સત્તરે સંકળાયેલાં. આઈઆઈસીમાંથી મળતી માહિતી પ્રમાણો તેમના કાર્યકાળ દરમિયાન કપિલા વાત્સ્યાયને અન્ય દેશો જોડે ભારત સરકાર વતી પચાસ જેટલા સાંસ્કૃતિક કરારો કરેલા.

જવાહરલાલ નહેરુની સાંસ્કૃતિક રાજનીતિ સંદર્ભે તેઓ અનેક કલાકારોનાં જૂથોને

અને સાંસ્કૃતિક મંડળોને વિશ્વપ્રવાસે લઈ જવામાં કારણભૂત રહેલાં. મહાન કલાકારો બાલસરસ્વતી અને બિરજુ મહારાજને વૈશ્વિક દર્શકો સમક્ષ લઈ જવા માટે તેઓ જ નિમિત બનેલાં. તેમનો પ્રભાવ અને ઉત્સાહ એ હદના હતા કે ૧૯૮૮માં હિલ્લી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય બિનજોડાણવાઈ ચળવળ સંમેલન પ્રસંગે મુલાકાતી રાજ્યદ્વારોના લાભાર્થી, તમામ કાયદાકીય બંધનો (રેડ ટેપ) ની અવગાણના કરીને પણ ઐતિહાસિક ચોલાવંશની કલાકૃતિઓને દક્ષિણાં મંદિરોમાંથી ઉઠાવી લાવી મર્યાદિત સમય પૂરતી રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં તેઓ સફળ રહેલાં. નહેરુ-ગાંધીના શાસનકાળ દરમિયાન વાત્સયાયન ભારતીય કલાઓના પ્રસાર અને પ્રસ્તુતિ માટે વિશ્વભરમાં ધૂમતાં સાંસ્કૃતિક રાજ્યદ્વાત તરીકેની ઓળખ પામેલાં.

ડૉ. સુનિલ કોઠારી કહે છે કે ભારતીય સાંસ્કૃતિક અને વિવિધ કલાઓનાં મહત્વનાં જટિલ પાસાંઓનું સંશોધન કરવામાં, તેની વધુ શોધખોળ કરવામાં અને તેનું પ્રગતિશીલ અર્થઘટન અને પુનઃઅર્થઘટન કરવામાં કપિલા વાત્સયાયને પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું. કપિલાજીની સધળી ઊર્જા માત્ર એક સમયના યશસ્વી ભૂતકાળની બેકાબૂ ઘેલણાથી રચાયેલી નહોટી, પરંતુ વર્તમાનની આવશ્યક સભાનાતા સાથેના અને આવનાર ભવિષ્યની ગણતરી સાથેના તેમના સંગીત અભ્યાસ પર આધારિત હતી. ડૉ. કોઠારી કહે છે કે, ‘તેમના વિશાળ સમૃદ્ધ પ્રદાનને માત્ર એક સૂત્ર મારફતે સમજબું હોય તો કહી શકાય કે તમામ કલાઓ પ્રયે તેમણે વિકસાવેલો આંતરશાખાકીય અભિગમ (Interdisciplinary approach). ઉદાહરણ તરીકે ભારતીય નૃત્યનો સૌંદર્યાત્મક સિદ્ધાંત (aesthetic theory) વિકસાવવા તેમણે સાહિત્ય, ચિત્ર, સંગીત અને નાટકના અભ્યાસને જરૂરી ગણ્યો. વધુમાં કલાસિકલ નૃત્યો માટેની તેમની ગહન અભિરુચિ જ આગળ ઉપર તેમને ગ્રામીણ લોકનૃત્યો, આદિવાસી અને જનજીતિ સમુદાયોનાં પારંપરિક નૃત્યોને જોવા-સમજવા સુધી દોરી ગઈ. શાઈની વર્ગીજ જેવાં કહે છે કે, ‘અમારા જેવા જિજાસુ લેખકોને કપિલા વાત્સયાયને ભારતીય કલાઓનો ત્રિપરિમાણી દિષ્ટિકોણ સમજાવ્યો.’

કપિલાજીની કુશાગ્ર બુદ્ધિ, અસમાધાનકારી અભિગમ અને દરેક કાર્યમાં ચિવટ અને ચોકસાઈનો આગ્રહ તેમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ હતી. તેમની હેઠળ કામ કરનાર લોકો માટે કપિલાજીની અપેક્ષાઓ મુજબનું કાર્ય સંપન્ન કરી આપવું અત્યંત કપણું, દુષ્કર ગણવામાં આવતું. આને કારણે જ તેઓ એક કડક, કાબેલ અને શિસ્તઅદ્ભુત વહીવટકાતની સાથે સાથે શ્રેષ્ઠ પરિણામો લાવનાર એક કુશળ સંસ્થા-સ્થાપક પણ બની શક્યાં. બીજું, કલાસાંસ્કૃતિક પ્રસારનાં સૂત્રો તેમને હસ્તક હોવાથી કપિલાજીને સૌથી મોટો લાભ એ મળ્યો કે તેમને કમલાદી ચંદ્રોપાચાય, જવાહરલાલ નહેરુ, મૌલાના આજાદ, ડૉ. રાધાકૃષ્ણાન્ન અને હિંદિયા ગાંધી જેવાંઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનું થયું. આ તમામ પ્રતિભાશાળી મહાનુભાવો પાસેથી તેમને કંઈ ને કંઈ મૂલ્યવાન ગ્રહણ કરવાને મળ્યું.

પોતાના અગાધ જ્ઞાનને કારણે જ કપિલાજી દુનિયાભરનાં મેધાવી કલાવિશેખજો સાથે ફળદારી સંવાદ સાધી શક્યાં અને ભારતીય કલાઓની ઝીંકી ઝીંકી ભારીકીઓ કે

વિશેષતાઓને તેના તત્કાલીન સામાજિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક સંદર્ભમાં રજૂ કરી વિદેશી નિષ્ણાતોને ભારતના આંતરિક સૌંદર્ય અને ઊંચાઈનો ખરો પરિયય કરાવી શક્યા. એવા પણ પ્રસંગો વારેવાર આવતા જ્યારે અચાનક, કોઈ જ પૂર્વતીયારી વગર તેમને વિવિધ દેશોના રાજ્યદ્વારો કે સાંસ્કૃતિક પ્રતિનિધિઓ સાથે ભારતીય કલાઓ વિશે વાતચીત કે વાર્તાલાપ કરવાની જરૂર પડતી અને એવા સંજોગોમાં પણ કપિલાજી બધાને આસાનીથી પ્રભાવિત કરી જતાં.

કપિલા વાત્સયાયનની પ્રકૃતિમાં જ્ઞાન કે વિદ્વત્તાનો સહેજ પણ ઘમંડ નહોતો. તેમણે આજના કેટલાંક નામાંકિત નૃત્યસમીક્ષકો અને કલાવિવેચકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જે કોઈ પરિસંવાદો, પ્રદર્શનો, સંગ્રહાલયો, કલાવિષ્ટિકાઓ, કલા-મહોત્સવો આયોજિત કર્યા તેમાં ભાગ લેનાર ઊગતા કે નામાંકિત હર કોઈ કલાકાર કે વિશેષજ્ઞને તેમણે સમાનભાવે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. કપિલાજી વાત્સયાયનના જીવનકાર્યને સન્માનિત કરવા ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોઈ પ્રદાન કર્યા. આ ઉપરંત તેમને બીજા પણ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન અને પાર્ચિતોષિકો મળેલાં.

૮૨ વર્ષે થેલા તેમના નિધનજા સમાચારથી આધાત પામેલા તેમનાં મિત્રો, સાથીઓ અને ચાહકો દ્વારા તેમની વિદ્વત્તાને, ભારતીય કલાઓને વિશ્વભરમાં પ્રસિદ્ધ અપાવી હોવાનાં તેમનાં મૂલ્યવાન કાર્યોને યાદ કરી શક્યાંજિવ આપવામાં આવી. ૧૯૬૦ પહેલાંથી કપિલાજ્ઞા ઘનિષ્ઠ પરિયયમાં રહેલા વિભ્યાત હિન્દ્બી કવિ શ્રી અશોક વાજપેયીએ તેમના નિધનને પોતાની સૌથી ‘મોટી અંગત ખોટ’ ગણાવીને કહું કે, ‘વાત્સયાયનની વિદાયથી ભારતીય કલાસંસ્કૃતિએ પોતાને વિશ્વના નકશા પર મૂકી આપનાર એક મહેનતુ રાહબર ગુમાયો છે.’ વાજપેયીએ વધુમાં જણાયું કે, ‘કપિલા વાત્સયાયન એક ઉત્કૃષ્ટ કોટિનાં સંસ્થા-નિર્માતા (institution-builder) હતાં. તેમના સમયગાળાના લગભગ તમામ પ્રસિદ્ધ કલાકારો અને કલાવિશેપજોના સંપર્કમાં તેઓ આવેલાં. તેમની અધિકૃત આત્મકથામાં તેમને પરિચિત એવાં ૨૦૦૦ જેટલાં નામો જોવા મળે છે.’

આઈઆઈસીના ભૂતપૂર્વ મંત્રી રહેલા અને લગભગ બે દાયકા સુધી કપિલાજી સાથે કામ કરી ચૂકેલા શ્રી એન. એચ. રામયંકન કહે છે કે ‘સામાન્ય રીતે લોકોમાં આઈ હિસ્ટોરિયન (કલાઓના ઈતિહાસકાર) તરીકે જાળીતાં કપિલા વાત્સયાયન એક કુશળ કેળવાળીકાર અને વહીવટકર્તા પણ હતાં. તેમની સાથે કામ કરવું ખરેખરમાં એક લહાવો હતો.’ એવી જ રીતે પ્રસિદ્ધ તસવીરકાર પાર્થિવ શાહે જણાયું કે, ‘છેલ્લે છેલ્લે તેમની વધતી જતી વય અને નબળી પડતી જતી નજર છતાંય ભારતીય કલાઓના ઉત્તરોત્તર વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા જીવનના અંત સુધી એવી ને એવી જ જળવાઈ રહેલી. તેઓ ઊર્જથી છલોછલ હતાં. તેમનામાં કામ કરવાની અભૂત શક્તિ પેલી. તેમનું જ્ઞાન અને વિદ્વત્તા બેમિસાલ હતાં. તેમનામાં વિનોદવૃત્તિ પણ ભારોભાર હતાં.’

નૃત્યસમીક્ષક ડૉ. સુનિલ કોઠારીએ કહું કે, ‘તેમની વિદાય સાથે કપિલા

વात्स्यायननुं स्थान विश्वना सुप्रसिद्ध कलाविदो स्टेला केमरिश, एलिस बोनर, डॉ. आनंद कुमारस्वामी अने डॉ. वी. राघवननी यशस्वी हरोणमां आवी गयुँ छे.' मोडर्न आर्ट नेशनल गेलरीना अगाउना डिरेक्टर राज्ञव लोचन कहे छे के, "Vatsyayan straddled tradition and contemporality equally well. For her, it was a continuum." (वात्स्यायन परंपरा अने समकालीनता - बंनेने साथे राखीने चाली शक्या. ऐमां तेमने सातत्य देखायेलुं).

કपिला वात्स्यायननी प्रतिभद्रता राजकीय सत्ता प्रति नहीं पण मात्र ने मात्र भारतीय संस्कृतिना उत्कर्ष माटेनी हती. ए छतां आपणा देशमां जे परंपरा चालती आवी छे ते अनुसार नहेऱु-गांधी परिवार साथे तेमनो नातो जगाझडेर होवाथी बिनकॉग्रेसी सरकारो आवतां तेमनी प्रवृत्तिओ अटडी पडी. तेमने स्वाभाविक रीते ज नहेऱुविधन दृष्टिकोणाथी जोवा-भूलववामां आवतां हतां. परंतु कपिलाज्ञां कार्यो मात्र सरकारकेन्द्री न हतां. एटेहे तेमने माटे व्यक्तिगत निवृत्ति लेवानो सवाल ज नहोतो. कपिला वात्स्यायन माटे एक ज वात कही शकाय के तेमाणे भरपेट ज्ञवनरस माझ्यो. तेमनी ज्ञवनशैली हंमेशां गांधीविचार अनुसार रही.

तेमनुं आत्मविश्लेषणा पण दाद मार्गी ले तेवुं हतु. ज्योति सभरवाले कपिला वात्स्यायन पर लघेली आत्मकथामां कपिलाज्ञ पोताने 'ऐवा गबडता पथ्थर स्वरुपे भूलवे छे जेनी आसपास नकरी शेवाण भाजी गई होय!' आगण बोलतां तेओ ज्ञावे छे के 'ऐटली बधी शेवाण वीट्याई गई छे के हवे आणे पथ्थर ज रखो नथी, तेना पर मारी जन्मभूमि विशेना शाननी शेवाणना थरना थर जाभी गया छे!'

## संदर्भसामग्री

Kapila Vatsyayan, Grand Matriarch of Cultural Research : Anuj Kumar in *The Hindu*

Kapila Vatsyayan, An Unbounded Bounded Person : Sunil Kothari in *The Hindu*

Kapila Vatsyayan : "Art was Expression of Life for Her" : Shiny Vergese in *Indian Express*

*Books By Kapila Vatsyayan :*

Traditions of Indian Folk Dance (1976)

The Square and the Circle of Indian Arts (1997),

Bharata : The Natya Sastra (2006)


Dance in Indian Painting (2004)

Classical Indian Dance in Literature and the Arts (2007)

Transmissions and Transformations : Learning Through the Arts in Asia. (2011)

## હવે ફાધર વાલેસ રહ્યાં નથી

પ્રદૂલ્લ રાવલ



ગુજરાતી ભાષાની સાદાઈનું સૌન્દર્ય અને સામર્થ્ય જો કોઈ લેખકે દર્શાવી આય્યું હોય તો તે ફાધર વાલેસે. મૂળ સ્પેનિશ પરન્તુ ગુજરાતી ભાષાને બરાબર આત્મસાત્કરી અને એક સમાન વિચારબિન્દુઓ એમણે એમનાં લખાણોમાં આયાં જેમ કે;

- પૂરા દિલથી આદરેલો અતિથિધર્મ આપણાને આપોઆપ નીતિપરાયણ બનાવી દે છે.

- નદીની સાર્થકતા સંયમમાં છે.

- મન પર સવાર થયેલો વિચાર દેહનો કબજો વઈને જ જંપશે. કલ્પનામાં ડિઠેલો તરંગ પ્રલયનું તાંડવ મચાવીને જ જંપશે.

- આત્મવિશ્વાસ વગર વિજય ન સંભવે.

- જિજ્ઞાસા એ જ્ઞાનનું આંગણું છે.

એમનાં લખાણો એમની વિચારયાત્રાની ફળશૂતિ છે, જેમાં મનોમંથનનો યોગ છે. ભલે ઈસુસંધના ફાધર વાલેસ પ્રચારક હતા પરન્તુ એમનાં હૃદયદ્વાર સહુ માટે ખુલ્લાં રહેતાં. સામાજિક નિસબત ને સમાજ સાથે અનુબંધ એમની જીવનશૈલી હતી. એમનું જીવનલક્ષ્ય હતું યુવાનોને દિશા ચીધવાનું. યુવાવર્ગ સદ્ગ્યારના રસ્તે ચાલે ને પોતાનું જીવન સફળ બનાવે. એમનાં લખાણોમાં આત્મકથાનું તત્ત્વ ભરપૂર હતું કારણ કે પોતાના અનુભવને જ એ અભિવ્યક્ત કરતા હતા.

ફાધર વાલેસે સાવ જુદી રીતે પોતાની કથા ‘આત્મકથાના ટુકડા’માં લખી છે. એમાં બાની વાત કરી છે તો એન્જિનિયર પિતા સાથે મોટાભાઈનું સ્મરણ કર્યું છે. વીતેલી વીસમી સદીના સાતમા-આઠમા દાયકામાં ફાધર વાલેસે ગુજરાતના—સવિશેષ

અમદાવાદના યુવાનોના હદ્યમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું તે પ્રારંભે એમનાં લખાણોથી અને પછી એમના આચારથી. ૪ નવેમ્બર, ૧૯૮૫ના રોજ સ્પેનમાં જન્મેલા ફાધર વાલેસ પંદર વર્ષની વયે ગૃહત્યાગ કરીને ઈસુસંધની સાધુસંસ્થામાં જોડાયા. તે પૂર્વે એમના પિતાનું અવસાન થયું હતું. આ પિતા વિશે દિલથી ફાધર વાલેસે લખ્યું છે. એમના અવસાન પછીની પરિસ્થિતિ કેવી હતી ! એમના શર્ભોમાં સાંભળીએ :

“તે પહેલાં અમારું કુટુંબ ખૂબ સુખી હતું. બાપુજી સારી પ્રતિકા ધરાવતા, બા કુશળતાથી ઘર ચલાવતાં, અને અમે બે ભાઈઓ સારી રીતે ભાશતા. ભવિષ્ય માટે કોઈ ચિંતા નહોતી. જીવન-વીમો ઉત્તરાવીને એક દિવસ બાપુજી વેર આવ્યા હતા ત્યારે એનાં કાગળિયાં બાને બતાવીને કહ્યું હતું : ‘આપણા હોકરાઓનું ભવિષ્ય આમાં સલામત છે. હવે કોઈ ચિંતા ન કર.’ પણ ભવિષ્ય સલામત નહોતું. તેઓ ગયા એટલું ૪ નહિ પણ એમણે આવા શ્રમથી ઉત્તરાવેલા જીવનવીમાના પૈસા પણ ગયા અને આખી સાચાવેલી મિલકત પણ કરુણા રીતે ગઈ. જીણે એમના અવસાનનું હુંબ પૂર્તું ન હોય એમ બીજે વર્ષ સ્પેનમાં આંતરવિશ્વ ફાટી નીકળ્યો ને દેશના બે ભાગલા પડ્યા. એ જ દિવસે અમે ત્રણે જણાં એક સગાને મળવા બીજા ગામમાં ખાલી પહેલેલે જ કપડે ગયાં હતાં તો યુદ્ધમાં એ ગામ દેશના એક ભાગલામાં જ્યારે અમારું ગામ બીજા ભાગલામાં ગયું હતું. યુદ્ધ પછી અમે અમારા ગામમાં પાછાં ગયાં ત્યારે ધરની ચાર દીવાલ સિવાય અમારું બીજું કંઈ નહોતું. બધું લૂંટાઈ ગયું હતું. મારા નાનાજી અમને મદદ કરતા હતા પણ એમનું પણ યુદ્ધમાં એવું જ બન્યું. એટલે અમે સાવ નિરાધાર રહ્યાં. એક વર્ષે અમે અનાથ થયાં. બીજે વર્ષે નિરાશ્રિત બન્યાં.”

ફાધર વાલેસે ઈસુસંધમાં તાલીમ લીધી અને ગ્રીક પ્રશિષ્ટ સાહિત્યમાં અને પ્રાચીન-અર્વાચીન તત્ત્વજ્ઞાનમાં ડિગ્રી મેળવી. સંઘના આદેશે અધ્યાપક બન્યા. ૧૯૪૮માં ભારત આવ્યા. મદ્રાસમાં ગણિતની સાથે એમ.એ. કર્યું. વલ્લભવિવાનગરમાં ગુજરાતી શીઝ્યા. પૂનામાં ચાર વર્ષ વિશ્વધર્મનો અભ્યાસ કર્યો. એની પરીક્ષા આપતાં પહેલાં એમણે જિંદગીનું પહેલું પુસ્તક લખવાનો આરંભ કર્યો. તેથે ગુજરાતીમાં એ પુસ્તક તે ‘સદાચાર’. આ પુસ્તક બે મહિનામાં એમણે પૂરું કર્યું. પછી ‘ગુપ્ત ગુનાના સંતોષ’ સાથે એમણે પરીક્ષા આપી અને એમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ત્યાર બાદ અમદાવાદ આવીને સેન્ટ એવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક થયા. અધ્યાપન દરમિયાન એમને પુસ્તક છપાવવાની ઈચ્છા તો હતી જ. એક પ્રકાશકનો સંપર્ક સાથ્યો. પરન્તુ પ્રતિભાવ નિરાશાજનક હતો. હાર્યા વગર એમણે પુસ્તકપ્રકાશનના પ્રયાસો કર્યા. જોકે એમને એમાં સક્રિપ્તા ન મળી. ફાધર વાલેસ લખે છે : ‘એટલે છેવેં મેં સ્પેન દેશમાં રહેતાં મારાં પૂ. બાને પત્ર લખીને એમની મદદ માગી. એમણે તરત જરૂરી પૈસા મોકલ્યા અને પુસ્તક છપાયું. મારા હાથમાં મારું પહેલું પુસ્તક આવ્યું ત્યારે મને ઘણો આનંદ થયો. એની કિંમત રાખી હતી ૭૫ પૈસા.’

પહેલા પુસ્તક પછી ફાધર વાલેસ એમની સરળ લેખનશૈલીથી જાણીતા થયા અને બચ્યુભાઈ રાવતના નિમંત્રણે ‘કુમાર’માં લખવાનું આરંભાયું. એ લેખો ‘વ્યક્તિ ઘડતર’

નામે પ્રસિદ્ધ થયા છે. એમની આ લેખમાળાને ૧૯૬૮નો કુમારચંદ્રક અર્પણ થયો. ‘કુમાર’માં એ લેખમાળા ચાલતી હતી ત્યારે ‘ગુજરાત સમાચાર’માંથી આમંત્રાણ મળ્યું અને તાં ‘નવી પેઢીને’ નામક કોલમનો આરંભ થયો. પછી તો એ લેખો એ જ નામે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા. ફાધર વાલેસના મતે ‘નવી પેઢીને’ કોલમે ‘મારે મારે અમદાવાદમાં અને ગુજરાતમાં લોકહદ્યનાં દ્વાર ખોલ્યાં’ પછી તો એમની લેખનયાત્રા વણથંભી વર્ષો સુધી ચાલી. ‘જનકલ્યાણ’ અને ‘સુવિચાર’માં પણ લેખમાળા ચાલી. ૧૯૬૮માં એમને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક પારિતોષિક મળ્યું. ફાધર વાલેસ ગણિતના અધ્યાપક હોઈ ગુજરાત યુનિવર્સિટીએ એમને જી.એચ. હાઈના ‘Pure Mathematics’ના અનુવાદનું કામ સોંઘ્યું અને એમની પાસેથી ‘કેવળ ગણિત’ નામે અનુવાદનું પુસ્તક મળ્યું. ફાધર અને એમના લેખનકાર્યનું એ ‘એક સીમાચિક્ષણ’ ગણાતું જોઈએ એમ માને છે. એમણે ‘સુગણિતમભૂ’ માં લેખો લખ્યા હતા અને જ્ઞાનગંગોની ગ્રંથશ્રેષ્ઠીમાં ડૉ. પ્ર. સુ. વૈદ્ય સાથે ‘ગણિતકદર્શન’ ગ્રંથ લખ્યો હતો. ગુજરાત સાહિત્ય સભા દ્વારા ૧૯૭૮નો રણકિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

૧૯૭૭માં ફાધર વાલેસે પોતાનાં લખાણોના પ્રભાવ સંદર્ભે લોકસંપર્કની ભાવનાથી કોલેજનું રહેઠાણ છોડીને અમદાવાદની પોળોમાં વિહારયાત્રા શરૂ કરી. એ યાત્રા દરમિયાન પોળમાં રહેતા. આ અનુભવો એમણે ‘વિહારયાત્રા’ ભાગ ૧-૨-૩માં વર્ણવ્યા છે. આ વિહારમાં આત્મત્યાગની ભાવના હતી તો લોકસંપર્ક સાધવાની પણ લાગણી હતી. એમણે પોળોપોળે જવાનો એમનો હેતુ સ્પષ્ટ કરતાં લઘ્યું હતું : ‘મારાં લખાણોથી મને ઘણા લોકોનો પરિચય થયો છે. હવે દૂરથી સલાહ અને ઉપદેશ આપવાં સહેલાં છે. પણ વર્થ જ છે. લોકો મને કહે છે : ‘તમે અમારામાના એક બની ગયા છો.’ પણ મને ભાણ રહ્યા કરે છે કે હજુ ઘણું અંતર છે. હું નવરંગપુરામાં, બંગલામાં, પૂરી સગવડોની વચ્ચે રહું, અને મારા વાચકો શેરીઓમાં ને પોળોમાં સંકડાશમાં ને અગવડમાં રહે એ બરાબર નથી. જેમને માટે હું લઘું દુંધું, કામ કરું દુંધું, જીવું જ દુંધું એમની વચ્ચે ને એમની જેમ હું રહ્યી શકું તો જ લખાણો સાચાં ગણાય.’

૧૯૭૭થી એમણે ગુજરાત છોડ્યું એ બધાં વર્ષો દરમિયાન એમણે જે લઘ્યું તેમાં સમાજહંતર એમનો લેખનઉંદેશ રહ્યો હતો. એમનાં લખાણોમાં વિષયોનું વૈવિધ જોવા મળે છે. એનાં ‘જૂજવાં રૂપ’ જે ‘ઈન્દ્રધનુષ્ણની આકર્ષક લીલા’ સમાં છે તેની પાછળ એનું માત્ર ‘શેતરંગ’ છે જે ‘હિલનો શેતરંગ’ છે અને એ જીવનપ્રેમ, પ્રભુપ્રેમ અને પ્રભુનિષ્ઠાથી સભર છે. સુરેખ અને સુશ્રીલાલ આ લેખો ‘વાચકાન ચિત્તમાં વિચારભાવનો તણખો’ મૂકી જાય છે. એમાં કેવળ આનંદભાવ હોય છે. ક્યારેક વિનોદ તો ક્યારેક કટાક્ષ હોય. ચિત્તનકણિકા મળે. એમનાં લખાણોમાં ઉપાલંબભાવ કરતાં મૈત્રીભાવ સવિશેષ છે. એમને રમણલાલ જોશીએ ‘આધુનિક સંત’ તરીકે ઓળખાવ્યા છે. અને ‘એમનાં પુસ્તકો પ્રજ્ઞાન શીલની કેળવણીની બહુમૂલ્ય બાળપોથીઓ છે.’ ક્યારેક એમની શૈલીની એકવિધતા ખૂંચે છે. પરંતુ એની સરળતા અવશ્ય આકર્ષે છે. ‘શબ્દલોક’ જેણું પુસ્તક એમના ભાષાપ્રેમને નિર્દેશ છે. એમનાં પુસ્તકોની સંખ્યા ખાસ્સી મોટી છે. એમણે ગુજરાતી ભાષાના સંદર્ભે

બે પુસ્તકો ભેગાં કરીને ‘વાણી તેવું વર્તન’ પુસ્તક આપ્યું છે તેમાં ગુજરાતી ભાષાની ખૂબી - ખાસ દર્શાવી છે. એમાં રમેશ બી. શાહના મતે ‘ગુજરાતી ભાષામાં વ્યક્ત થતી ભારતની સંસ્કૃતિની ચર્ચા’ છે. ફાધર વાલેસ ગુજરાતી ભાષાને અપરિશ્રદ્ધી માને છે. પ્રેરકરયના ગુજરાતીમાં હોવાનું એમણે નોંધ્યું છે જે અંગેજ ભાષામાં કવચિત્ જ જોવા મળે છે. એમની ચર્ચા રસિક બની છે.

ફાધર વાલેસનાં મોટા ભાગનાં લખાણો કોલમ નિમિત્તે લખાયાં છે એટલે એમાં સમસામયિક પ્રશ્નો-સમસ્યાઓની ચર્ચા અવશ્ય હોય. પરિણામે કાળજીમે કેટલુંક લખાણ અપ્રસ્તુત પણ બની રહે. છાતાંય એમની વાણી અનંતરાય રાવળને ‘વા’લેશરીની વાણી’ લાગી છે. ‘ભૂલો, નભળાઈઓ વગેરેની વાત કરતાં ફરિયાદ કે કચવાટ વ્યક્ત થાય તો તે મૂછુ સહાનુભૂતિભરી વાણીમાં, રોષ કે ઉગ્ર આકોશના સ્વરમાં નહીં.’ ફાધર વાલેસની લોકપ્રિયતા એમનાં લખાણોની સરળતા અને એમના મધુર વ્યક્તિત્વથી ઊભી થઈ હતી. સંગીતના શોખીન ફાધર વાલેસે ૧૯૮૮ તમાં ઉમંગથી કહ્યું હતું : ‘ગુજરાતને મેં મારું સ્મિત આપ્યું છે. એમાં મારી શ્રદ્ધા છે; મારો પ્રેમ છે, મારો ઊડો સંતોષ છે અને ગુજરાતે મને પોતાનો કરીને મારું જીવન ધન્ય બનાવ્યું છે. ગુજરાતે મને પ્રેમ આપ્યો છે, સાચા ચાહકો આપ્યા છે, જેમના વગર મને જીવનું જ ન ગમે એવા અંગત આત્મીય દિલોજન મિત્રો આપ્યા છે. એ મારા જીવનની સાચી મૂડી છે. ગુજરાતમાં સુખી છું, કારણ કે મારા શ્રેષ્ઠ મિત્રો ગુજરાતમાં છે.’ આવું કહેનાર ફાધર વાલેસ પછી તો ગુજરાતથી દૂર ગયા. અલબત્ત, એમની ભાવભૂમિ તો ગુજરાત જ રહી છે. અનેક પ્રેરક પુસ્તકોના કર્તા ફાધર વાલેસે એમનાં લખાણોથી ગુજરાતી ભાષાની અમૃત્ય સેવા કરી છે.

ભારતનું નાગરિકત્વ એમણે મેળવ્યું હતું. એમનો ગણિતપ્રેમ અનન્ય હતો. ગણિતના દેશ-વિદેશના અનેક પરિસંવાદોમાં એમણે ભાગ લીધો હતો. ગુજરાતમાં અનેક પરિસંવાદોમાં એમણે ભાગ લીધો હતો. ગુજરાતમાં હતા ત્યારે અનેક કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ એમણે મિત્રવાણીમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. પ્રેમભર્યા ફાધર વાલેસનું એક કાળે ગુજરાતમાં હોવું એક આનંદઘટના હતી. નેવું વર્ષના ફાધર પાછલી વયે ગુજરાત છોડી એમના વતનમાં ગયા. ત્યાં ઈસુસંધના કાર્યમાં જોડાયેલા. એમની નિધાને સલામ કહેવામાં એમના પ્રત્યેનો ભાવ જ વ્યક્ત થાય છે. ‘વ્યક્તિમંગલ’, ‘સમાજમંગલ’, ‘ધર્મમંગલ’, ‘કુટુંબમંગલ’ અને ‘જીવનમંગલ’ એ પાંચ પુસ્તકોમાં એમનાં સમગ્રલેખનનો અર્ક સમાઈ જાય છે જે ૨૦૦૮માં પ્રસિદ્ધ થયાં છે. હજુ પણ એમનાં પુસ્તકો વાચનક્ષમ તો રહ્યાં છે પણ પેલો જાદુ ઓસરી ગયો છે. નવી પેઢીનો રસ બદલાયો છે તે સાથે એમનાં પુસ્તકોની વાચનરુચિ ઘટતી ગઈ છે. બેઅંક વર્ષ પહેલાં ગુજરાતમાં આવ્યા ત્યારે એમને મળવા લોકો આવ્યા ત્યારે લોકમેળો ભરાયાની લાગણી થઈ હતી. આવા લોકપ્રિય લેખકનું ૮મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ મેટ્રિક્સ, સ્પેનમાં અવસાન થતાં ગુજરાતી સમાજે આત્મજન ગુમાવ્યો છે.



## સાહિત્યવૃત્ત

### સંકલન : પરીક્ષિત જોશી

‘જેસલમેર અને કેનેડા’ તથા ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશે ઓનલાઈન વ્યાખ્યાન

તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સાંજે ૫.૩૦ કલાકે વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભર્દંકર જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશૈક્ષણી અંતર્ગત ‘જેસલમેર અને કેનેડા’ કાવ્યયાત્રા પર શ્રી યોજેશ જોશીનું ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું હતું. તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સાંજે ૫.૩૦ કલાકે યોજાયેલા અન્ય એક ઓનલાઈન કાર્યક્રમમાં ધર્મતત્ત્વ દર્શન વ્યાખ્યાન શૈક્ષણી ડેટન સવાસો વર્ષે શ્રીમદ્ રાજ્યંદ્રરચિત ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશે શ્રી કુમારપાળ દેસાઈએ વક્તવ્ય આપ્યું હતું.

દ્વારા ‘સાહિત્યને સથવારે’માં લોકસાહિત્ય અને ‘નોળવેલની મહેક’

તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ દ્વારા સાહિત્ય સરિતાની ૨૧ તમી બેઠક ‘જુમ’ના મંચ પર યોજાઈ હતી. ‘સાહિત્યને સથવારે’ વિષયમાં વિવિધ ગીત-સંગીતના કાર્યક્રમ સાથે દેવિકા શ્રુતે સત્ત્વશીલ સાહિત્યની વાત માંડી હતી. ગુ. સા. પરિષદના પ્રમુખશ્રી સિતાંશુ યશકંદ્રે ‘નોળવેલની મહેક’ વિશેની સંવિસ્તાર વાત કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભાઈ નવરાત્રિનો સ્વરચિત ગરબો રજૂ કર્યો હતો. જ્યારે અલીભાઈ ચતુરે હાલરડાં-ગીતો વિશે, શ્રી પ્રકાશભાઈ મજુમદારે કાઠિયાવાડી ગીતો, શ્રી ભારતીબહેને શ્રી અવિનાશ વ્યાસનાં ગીત અને શ્રી નીતિનભાઈ વાસે શ્રી જ્યોતીન્દ્ર દવે વિશે વાત કરી હતી.

સુરત ખાતેની વિવિધ સાહિત્યિક સ્પર્ધા : આયોજન અને પરિણામ

અભિલ હિંદ મહિલા પરિષદ બૃહદ્ સુરત શાખા ટ્રસ્ટના ઉપક્રમે નવમી સિમેતા પારેખ સ્પર્ધા ૨૦૨૦ની નવલિકા સ્પર્ધામાં પ્રિયંકા જોશીલિભિત ‘પાંખો’ વાતની પ્રથમ અને ભાવના વકીલનાની ‘અપરિચિત’ વાતની દ્વિતીય ઇનામ મળે છે. બાળવાર્તા સ્પર્ધામાં મહેશ ‘સ્પર્શ’ની ‘આગિયા સાથે સેલ્ફી’ને પ્રથમ અને પ્રવીણ સરવૈયાની ‘પીળકનું ગાન’ વાતની દ્વિતીય ઇનામ પ્રાપ્ત થાય છે. જ્યારે કવિતા સ્પર્ધામાં હસમુખ રાવલના ‘સાચ હજુ’ને પ્રથમ તેમજ બૃહદ દવેના ‘પદ્ધાયા’ને દ્વિતીય ઇનામ મળ્યું છે.

કેતન મુનશી વાર્તા સ્પર્ધા માટે વાર્તા મોકલવાની તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. વાર્તા-લેખકો ધ્યાને લેશો.



## પત્રસેતુ

‘પરબ’ ઓગસ્ટ એટલે યોગેશ જોશીની એકસ્તનીનાં  
નવ સંવેદનો! સાવ નવાં, અણાઓટ્યાં, રોચક  
વિષયનો માતૃત્વમાં વિજય! જ્ય હો યોગેશ!

\*

આધ શંકરાચાર્યજીની માફક યોગેશે સ્વીકાર્યપ્રવેશ  
કર્યો જ છે તો ડાયરીનું પેલું સાવ અંગત પાનું પણ  
ખુલ્લું થાવ!

\*

ગાંડા મદ્દોન્મત હાથીનો  
મારી સાંકડી શેરીમાં પ્રવેશ!  
રોમાંચ ફફડાટ  
એના ઉત્પાતથી ભયભીત હું :

હવે આ શું કરશે ?

એક બંધ રહેલા મારા રાજમહેલના  
દરવાજ તોડી, રોળી નાખશે મારા કુંભ ?

ઓછ!

એના ગંડસ્થળનો મારા ગર્ભગૃહમાં પ્રવેશ  
થથરતી મેં અભીલગુલાલથી વધાવ્યો!

આ શું ?

મારા રજરકતથી અભિષિક્ત  
વિજયી વીર  
મારા દ્વાર પાસે જ લથબથશ્લથ !!

- નરોત્તમ પલાણ



૨૪ સપ્ટે. ૨૦૨૦

ભાઈશ્રી યોગેશભાઈ,  
નમસ્કાર,

‘પરબ’માં સપ્ટેમ્બર ૨૦૨૦ના અંકમાં બહેન દર્શિની દાદાવાલાએ આપેલા સલ્લા  
લેજરલોફ (દર્શિનીબહેનનો ઉચ્ચાર ‘સેલ્મા લોગેલફ) વાંચ્યો. ઘણું વિશેષ જાણ્યાનો

આનંદ થયો. હું રહ્યો Layman લેખક. એટલે અંગ્રેજમાં વાર્તા વાંચતાં જે ઉચ્ચાર મને સૂઝ્યો તે લખ્યો. વાસ્તવમાં, ૧૯૯૪-૯૫-૯૬ દરમિયાન દૈનિક ‘સમભાવ’માં ‘વિશ્વવાર્તા’ શ્રેણી શરૂ કરી ત્યારે સર્વપ્રથમ આ લેખિકાની વાર્તા ‘કિસમસ પુષ્પ’થી શરૂઆત કરેલી. વાર્તા કદાચ સ્વીડનની જૂની લોકકથાનું સલ્બા દ્વારા કરાયેલું નવકથન છે. પણ મને એમાં સમાજનાં તરછોડાયેલાંઓ પ્રત્યેની એક સાધુપુરુષની અપાર અનુકૂળપાની વાત છે તે ગમી ગયેલી. વળી, એમાં શ્રદ્ધા અને સંશેયનો જે દ્વંદ્વ છે એ પણ યાદગાર છે.

આજે પણ આ વાર્તા ફરી વાંચવાનું બને ત્યારે આંખ ભીની થયા વિના રહેતી નથી.

શુભેચ્છા સહ  
- યશવન્ત મહેતા

આદરણીય સિતાંશુ સાહેબ

પ્રણામ...

‘પરબ’ (નવે-’૨૦) પ્રમુખીય ‘દ્વિદલ પર્ણ’નું વિવરણ વાંચ્યું. અનુભૂતિનાં ઊંડાણેથી પ્રગટેલું આપનું ચિંતન કેવળ સાહિત્ય જગતને જ નહીં, આજની સાર્વજનિક જીવન સ્થિતિએ પણ સાચી દિશા ચિંધનાનું મર્મવિધક છે. અનોખી રસાળ શૈલીએ રજૂ કરેલા સાહિત્ય સંબંધમીમાંસાના ગ્રંથે મુશ્ક અધ્યયને ખૂબ રસ પડ્યો.

‘સમકાળીન ભારતીય કવિતા’માં આજાદ ભારતના ભાગલા સમયે વિસ્થાપિત, કવિશ્રી જોતવાણીનાં હૃદયદ્રાવક કાવ્યો, ખાસ તો આપે ‘ગુલમહોરની ભૂમિકા અલગ છે, લીમડાની અલગ’, નો રસાસ્વાદ ખૂબ સરસ રીતે કરાવ્યો છે.

‘...આપણી ઉપર રાત પડી હતી,  
ત્યારે સવાર થતાં થતાં તો  
પૂરાં છ વરસ લાગી ગયાં હતાં.’

\*

હૃદયવેદક કવિકર્મ... દર્દનાક વિપદકથાની અનુભૂતિનો આર્તનાદ ભાવકને ખરેખર હૃદમચાવી નાખે છે !

સંવેદનાસભર આપની કલમે વંદન સાથે

- થોભણ પરમાર



# ‘પરબ’ ૨૦૨૦ : વાર્ષિક સૂચિ

ઉર્મિલા ઠાકર

વર્ષ : 14

\*વર્ષ : 15

જાન્યુ.-જૂન 2020

જુલાઈ-ડિસેમ્બર 2020

અંક : 7-12

અંક : 1-6

## કૃતિસૂચિ

(ગુજરાતી આંકડા મહિનો અને અંગ્રેજ આંકડા કૃતિના પૃષ્ઠકમાંક સૂચવે છે.  
\* આવરણપૂર્ણ દર્શાવે છે.)

### ● અનુવાદ

એક પાત્રની કરુણાન્તિકા (વાત્તી)

લુદ્ધિજ પિરાન્દેલો, ૧૧, 42-47

અનુ. કાન્તિ પટેલ

એક સમાઝ માટે એકલાં (કવિતા)

જેઈને કેન્યન, ૮, 31

જડાઉ પિન (વાત્તી)

અનુ. દીપક રાવલ

જન-જનના રચનાકાર :

આઇજેક બાશોવિસ સિંગર,

અભિજનમ

અનુ. બંકુલ દવે ૬, 33-45

(પરિચયાત્મક લેખ)

આલોકરંજન ૧૨, 43-47

અનુ. પીયુષ ઠક્કર

ગ્રંથ કાવ્યો

ડબ્લ્યુ. બી. યેટ્સ ૮, 48-50

(૧. આભને સીમાએ દરજ્જો

અભુ બક અલ-તુર્તુશી

૨. શોધી શર્કું તો-

ડેલ વિભ્રો,

૩. દર્પણનો દોસ્ત)

અનુ. જયંત મેધાણી

ગ્રંથ કાવ્યો

પીયુષ દઈયા, ૪ અને ૫, 33

પાંચ કાવ્યો (૧. ઉનાળાના આરંભે ફ્લેમિંગો,  
૨. વિજયી વિખાણુ, ૩. રેશનની દુકાને  
કતારમાં, ૪. લોકડાઉનની છટાઓ,  
૫. છૂપો સાખ્યવાદ)

અનુ. વર્ષા દાસ

અશ્વિનીકુમાર, ૧૦, 47-50

અનુ. કમલ વોરા

બે કાવ્યો	પાલ્લો નેરુદા	૨, 31-36
(૧. ફૂતરાનું માતમ, ૨. ઉપકલા)	અનુ.રમણીક અગ્રાવત	
બે કાવ્યો	માર્ક સ્ટેન્ડ,	૧૧, 40-41
(૧. કાળા નકશા, ૨. ટેકરી)	અનુ. મૂકેશ વૈદ્ય	
શહેર (કાવ્ય)	સી.પી. કવાણી,	૮, 34
રવીન્દ્રનાથનું વૈશ્વિક રાખ્રૂણીત	અનુ. પ્રતિષ્ઠા પંડ્યા	
	રવીન્દ્રનાથ	૩, 38-39
	અનુસર્જન નિરંજન	
	ભગત, શૈલેષ પારેખ (નોંધ)	

### ● અભ્યાસ

ઉમાશંકર જોશીનું પત્રસાહિત્ય	જિતેન્દ્ર મેકવાન	૭, 54-70
એક શાલીન મધુર અવાજ	રમણ સોની	૧૧, 51-58
માધવ રામાનુજની કવિતા (અંતરનું એકાંત : માધવ રામાનુજ)		
કવિતા નિષ્પત્ત કરતી ગીતરચનાઓ	વિનોદ જોશી	૬, 56-60
કિશોર વયનાં વતન-સંસ્મરણશોનું વાસ્તવિક આલેખન (‘શક્લતીરથ જેના મનમાં રે !’ : દુંકેશ ઓઝા)	ઉત્પલ પટેલ	૩, 63-67
તેનગીન ત્સુન્દ	વંદના શાંતુઈન્દુ	૩, 67-72
‘નર્મદ અને ગોવર્ધનરામના પરાધીનતાના વૈચારિક અને વાફ્ફમય પ્રતિકારો’	હસ્તિત મહેતા	૨, 60-69
ફરી એક વાર મહાભારત (દાસી, રાજકન્યા અને બ્રહ્મવાદિની)	અરુણા જોડેજા	૧૧, 58-68
મેઘ-સંગીતની પટભૂમિ પર વિરહસુંદર અને યથાર્થરૂપ (અખાઢ કા એક દિનઃ: મોહન રાકેશ)	રાજેશ્વરી પટેલ	૩, 58-62
રધુવીર ચોધરીની નવલકથાઓમાં સામાજિક અને રાજકીય સંપ્રક્ષતા	શરીફા વીજળીવાળા	
રણ – રેશમ રેશમ અને જણજણનું (રણ તો રેશમ રેશમ : ભારતી રાણે) (રણ જણજણનું : ધીરેન્દ્ર મહેતા)	નરોતમ પલાણા	૮, 57-60

સત્સંગથી સુવાસિત અભિનવ	દક્ષા વ્યાસ	૧૧, 68-70
કૃતિ : ‘જીવણ જગમાં જાગિયા’ (‘જીવણ જગમાં જાગિયા’ : બકુલ દવે)		
સેલ્મા લોગેલફ	દર્શિની દાદાવાલા	૩, 60-68
‘હું’ એટલે જે બનવા હશ્ચનું છું તે’	દાસિ પટેલ	૪ અને ૫, 46-52
<b>● અહેવાલ</b>		
‘નોળવેલની મહેક’ વિશે	અભિજિત વ્યાસ	૮, 77-78
ફરી વિષાણુ સામેની વીજાણુની લડત માટે નોળવેલની મહેક	અભિજિત વ્યાસ	૧૧, 86-87
<b>● આપણી વાત</b>		
અનુબંધનો અનોખો આવિજ્ઞાર	સંકલન : પ્રકુલ્લ રાવલ	૭, 86-87
આનંદની ઉજ્જાણી		૧, 79; ૨, 85
ગુ.સા.પ. (જીન્યુ. 2021થી ડિસે. 2023 માટે અમલમાં આવનાર)		
કાર્યવાહક સમિતિની ચુંટણીનો કાર્યક્રમ	૬, 86; ૭, 85; ૮, 76	
પ્રમુખની ચુંટણીનો કાર્યક્રમ	૬, 84; ૭, 83; ૮, 73	
પ્રમુખપદની ચુંટણી વર્ષ 2021-2023	૧૧, 79	
મધ્યરથ સમિતિની ચુંટણીનો કાર્યક્રમ	૬, 85-86; ૭, 84-85; ૮, 74-75	
મધ્યરથ સમિતિની ચુંટણી 2020	૧૧, 80-85	
ગુ.સા.પ. અને તેના ઘટકોનાં અંદાજપત્રોનું સમગ્ર ચિત્ર	૪ અને ૫, 78-85	
ગુ.સા.પ.ના 2016-2017નાં	૨, 86	
પારિસ્થિતિકો, નિષાયિકો અને વિજેતાઓ		
ગુ.સા.પ.ની સામાન્ય સભાની બેઠક	૧, 78	
પુસ્તક-પ્રદર્શન	૧, 79; ૨, 85; ૩, 86	
રવીન્દ્રવનનો કાર્યક્રમ	૩, 86	
<b>● આવરણચિત્ર</b>		
અમિત કલ્લા	૧૦, *આ.પૃ.	
જ્યંત પરમાર	૭, *આ.પૃ.	
શ્રુત મિશ્રી	૬, *આ.પૃ.	
પ્રબોધ પરીખ	૮, *આ.પૃ.	

બિનોય પી.જે.	૯, *આ.પૃ.
ભૈરવી મોઈ	૧ અને ૩, *આ.પૃ.
સતીશ ગુજરાલ	૪ અને ૫, *આ.પૃ.
● આવરક્ષાચિત્ર - સંદર્ભનોંથ	
પીયુષ ઠક્કર	૧, 82; ૩, 89; ૪ અને ૫, 87-88;
	૬, 89-90, ૭, 89-90, ૮, 84-86, ૯, 88-89, ૧૦, 83-84
● આસ્વાદ	
અતીતનાં પાનાં એકાન્તમાં ઉકેલતા	રાધેશ્યામ શર્મા ૧૦, 54-57
પ્રહુલ્લ કવિ... (‘ઘોખા ક્યાં ?’ : પ્રહુલ્લ રાવલ)	ભાવેશ વાળા ૮, 32-34
‘અમદાવાદ’ : સંવેદન હજુ જીવે છે (‘અમદાવાદ’ : રાનેરી, મણિલાલ દેસાઈ)	રમણ સોની ૪ અને ૫, 34-37
એક ત્રિ-અંકી વિનોદ-રચના (નટવરલાલજીનો ગરબો : રામનારાયણ પાઠક ‘શેષ’)	રમણ સોની ૩, 40-43
તર્ક નહીં, કવિકલ્પનાનું સૌંદર્ય (ઉમા-મહેશ્વર : રામનારાયણ પાઠક ‘શેષ’)	ચંદ્રકાન્ત શેઠ ૧૨, 31-37
નવપરિણિત પેલાં : એકત્વથી પૂર્ણત્વ પ્રતિ 'વખાર'માં જળહળતો જીજા નકશીકામવાળો 'ઘાલો' ('વખાર' પૃ. 53 : સિતાંશુ)	રાધેશ્યામ શર્મા ૧, 37-40
વસ્તુનું પર્વસર્જન કાવ્ય-આકારમાં... (ઝુરશી : રાજેન્દ્ર પટેલ)	રાધેશ્યામ શર્મા ૧૧, 48-50
શોષણ અને શાસકના મનોસંઘર્ષનું નિરૂપણ કરતી કલાત્મક વાર્તા ‘અચરજ’	રાજેશ વણકર ૬, 53-55
સંધ્યાકાળે ‘આલ્લે...લે’માં સર્જનમભા	રાધેશ્યામ શર્મા ૨, 46-48
સુભાષિત સ-રસ-વતી ધાર !	વિજય પંડ્યા ૪ અને ૫, 38-40
સુભાષિત સ-રસ-વતી ધાર !	વિજય પંડ્યા ૮, 35-37
અશરીરી તે પ્રેમ હોય ?	વિજય પંડ્યા ૧૨, 37-39
સુભાષિત સ-રસ-વતી ધારા, વિરાટ ઇતાં અશક્તિ	વિજય પંડ્યા ૭, 51-53
સુભાષિત-સ-રસ-વતી ધારા : શિવ-પાર્વતી- સંવાદ-કાવ્ય	વિજય પંડ્યા ૧૦, 51-54
સુભાષિત સ-રસ-વતી ધારા : હાહાકાર મચ્યો !	પરબ ફિસેભાર, 2020 71

## • કવિતા

અ-શીર્ષ	હિતાંશુ ભડ્ય	૧૦, 25-26
અખબાર (લઘુકાવ્યો)	રેણુકા દવે	૩, 27-28
અશ્વત્થભાવ	ઉશનસ્ય	૧૧, 39
આ ઉનાગો	મૂકેશ વૈઘ	૮, 15
આ રસ્તાઓ	ઉશનસ્ય	૧૧, 73
આકાશ	વર્ષા દાસ	૧૨, 14
આંખ મિચાય તે પહેલાં	અનિલ રમાનાથ	૮, 19-20
ઈશ્વરના હસ્તાક્ષર	દિલીપ જોશી	૯, 18
ઉદ્ગાર	કવિ અજ્ઞાત	૧, 25
એક કાવ્ય	વિપાશા	૬, 23
એક તાંકા	ઉમેશ જોધી	૮, 20
એક શૂન્ય કવિતા	અનિલ રમાનાથ	૬, 16-19
ઓગણીસો અઠાર	ઉદ્યન ઠક્કર	૧૦, 15-17
કવિતા ન કરવા વિરો કવિતા	જ્યંત પાઠક	૧૦, 50
કવિતા વિરો કેટલુંક	પરેશ દવે	૨, 23
કાગડા તો બધેય...	રાધિકા પટેલ	૧૧, 22
કાચી માટીની કુલદીમાં	પંચમ શુક્લ	૧૦, 20
કૂવામાં	મનીષ પરમાર	૬, 23
ક્યાં છે રુચિ	રિયાજ દામાણી	૧૨, 18
ક્યાં જશો ?	દિલીપ મોદી	૮, 61
ગાણીને	લિપિ ઓર્જા	૧૦, 24
ચાનક રાખું ને...	જ્યંત પાઠક	૧૦, 86
ચાર કાવ્યો (૧. સુખનો સાકરિયો, ૨. એક અનુભૂતિ, ૩. બેજવાબદાર વાદળાં ન જોઈએ, ૪. સારું થયું કે -)	ચંદ્રકાન્ત શેઠ	૨, 13-15
ચાર ગઝલ (૧. વાતાવરણ જેવું..., ૨. એક રેખા કાલ્યનિક, ૩. યાદ આવે છે કશું ?!, ૪. ધરડાધરમાં ધર સાંભરતું)	રાજેશ વ્યાસ 'મિસ્કીન'	૩, 15-17
ચાર ગઝલ (૧. પિંગળા રાણી !, ૨. વાસ ગુપતનો..., ૩. રાખોડી-, ૪. ફિતા)	લલિત ત્રિવેદી	૯, 19-21

ચાર ગજલ (૧. ગુલાબ ખીલે છે, ૨. નઢી પાડે ભાગ, ૩. રસ્તાના પાણા, ૪. દીવો તો કરવાના.)	હેમંત ધોરડા	૯, 16-17
ચાર ગીત (૧. હું ને તું..., ૨. હવે જાવ, જાવ !, વિનોદ જોશી ૩. પડી પવનમાં આંટી રે !, ૪. પથ્થર ફાડીને કૂપળ ફૂટી-)		૯, 14-15
ચિતારો	જ્યન્ત પાઠક	૧૦, 73
ચિત્ર સામે ચિત્રવત્તુ	પ્રવીષ પંડ્યા	૪ અને ૫, 19-21
ચેત મછંદર ગોરખ આયા	યજોશ દવે	૭, 12-19
જાહુ શું કીધું ગરમાળે !	યામિની વ્યાસ	૬, 23
જવાં	હર્ષદ દવે	૯, 20
હુંગરા	ઉશનસ્કુ	૧૧, 70
તું મને ભૂલી જા ને	પ્રહુલ્લ રાવલ	૭, 25
ત્રણ કાવ્યો (૧. આ તે શા મુજબ હાલ ?, ૨. પદ્ધાયો, ૩. હાલ્ય હરિ, હાલ્ય)	ચન્દ્રકાન્ત ટોપીવાળા	૧૦, 13-14
ત્રણ કાવ્યો (૧. આવ અહીં ઓ રાત, ૨. તપસ્યાભંગ, ૩. મારું પોતાનું પ્રેમગીત)	પ્રતિષ્ઠા પંડ્યા	૩, 17-21
ત્રણ કાવ્યો (૧. સોરઠા, ૨. દોહરા, ૩. આગ)	મહેન્દ્ર જોશી	૪ અને ૫, 17-18
ત્રણ કાવ્યો (૧. તીડ, ૨. ચિતાઓ, ૩. વાંદરાઓ)	રાજેન્દ્ર પટેલ	૧૦, 18-19
ત્રણ ગજલ (૧. કહુ, ૨. બેગ્રાઉન્ડમાં, ૩. ફોરવઈ)	રાજેશ વ્યાસ 'મિસ્કીન'	૮, 16-17
ત્રણ ગજલ (૧. સેવા બનતી લીધી, ૨. રસપાન કર્યા છે, ૩. ઊભો છે કેમ જાંપે ?)	લલિત ન્રિવેદી	૧૧, 15-16
ત્રણ ગજલ (૧. સફરના પ્રસંગો, ૨. આંખના જળમાં, ૩. કાયમ રહ્યા)	હર્ષ બ્રહ્મભણ	૯, 24
ત્રણ ગીત (૧. હંસલો જાગિયો, ૨. શ્રીઝણ બાંધાં, ૩. મૂર્તિમાંથી મુક્ત થયાં)	પારુલ ખઘ્યર	૩, 21-23
ત્રણ ગીત (૧. કબૂતરું, ૨. કાચી નીંદરડીનું નાણું, ૩. જીગતલ ફરફોલો)	પારુલ ખઘ્યર	૧૧, 18-19
ત્રણ રચના (૧. અસલનું ધામ, ૨. 'બેઠો થા...' - સાંઈનો કોલ, ૩. ભેદ ભરમ ભીતરના)	નિરંજન રાજ્યગુરુ	૨, 20-21

થોડો વગડાનો શાસ્ત્ર	જ્યંત પાઠક	૧૦, 41
નોટ	અનિલ રમાનાથ	૩, 14-15
પંખી અને તડકો	રમણીક સોમેશ્વર	૬, 21
પાંચ ગીતો (૧. એક વેલ જોઈ એવી મેં, ૨. આ ધરતીની ધૂળ, ૩. ખોટું મને ખપે ના, ૪. સૂરજ જ્યારે દૂભ્યો..., ૫. કેમ કાઢવું અંતર)	ચંદ્રકાન્ત શેઠ	૬, 12-14
પાંચ ગીતો (૧. સિસૃક્તા, ૨. વણ રે લખેલ..., ૩. આંતરી પડી રે..., ૪. મુરશિદ..., ૫. સીસ નવાવૈ...)	હરીશ મીનાશ્રુ	૧, 21-24
પોખજો	ગુણવંત ઉપાધ્યાય	૧૦, 22
પ્રતિક્ષાની ક્ષણો	મોના લિયા	૩, 23
બક્ષિસ	વહીદા ડ્રાઇવર	૧૨, 14
બટકણી આંખોનાં દશ્ય	કિરણ વી. મહેતા	૧૦, 23-24
બે કાવ્યો (૧. નંદલાલ બોજ, ૨. ફાતિમા ગુલની ચિહ્ની)	ઉદ્યન ઠક્કર	૭, 21-22
બે કાવ્યો (૧. મારા વિના, ૨. ધરી હે તું હવેલીને)	ચન્દ્રકાન્ત ટોપીવાળા	૩, 13-14
બે કાવ્યો (૧. કેટલાક યુવાનોને, ૨. આદર્શ ગામ) થોભજા પરમાર		૧૧, 21
બે કાવ્યો (૧. શુભ મુહૂર્ત, ૨. અને —)	પ્રવીણ દરજી	૧૧, 16-17
બે કાવ્યો (૧. વિસર્જન, ૨. સર્જન)	પ્રવીણ દરજી	૨, 21-23
બે કાવ્યો (૧. આગ કે... ૨. કોણ)	રાજેશ પંડ્યા	૬, 14-15
બે ગજલ (૧. બાકી છે, ૨. આપણી વચ્ચે હતું, છે ને રહેશે)	અનિલ ચાવડા	૬, 22
બે ગજલ (૧. તપાસ કરો, ૨. દેહનો સોદો)	ભરત વિંજુડા	૧૨, 16
બે ગજલ (૧. ચકલીનો દિવસ !, ૨. અણી પર દું !)	સુધીર પટેલ	૧૦, 21
બે ગીત (૧. અલબેલા પંખી, ૨. એવી એક ડાળખી)	જિગર જોધી ‘પ્રેમ’	૧૨, 17
બે ગીત (૧. ફેંકયું તું ઠીકરું, ૨. ભીડની માયા	મનોહર ત્રિવેદી	૪ અને ૫, 16-17
બે સોનેટ (૧. ખેડ, ૨. સંચાર)	રામચન્દ્ર પટેલ	૪ અને ૫, 16
બેઠાં હતાં	છાયા ત્રિવેદી	૮, 18
	પરબ ફિલેઝ્માર, 2020	

બ્રેસ્ટ-કેન્સરગ્રસ્ત કવિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો)	યોગેશ જોધી	૮, 21-25
ભગવાનની વાતો (૧. ભગવાનની રમતો, ૨. પ્રથોગો અને સિદ્ધાંતો, ૩. સત્ય અને ભાંતિ)	દિલીપ જીવેરી	૧, 13-17
ભર્તિઓ	રમણીક સોમેશ્વર	૧૨, 15
ભેસ	રાકેશ ડેસાઈ	૧, 24-25
મા	સમીર ભંડ	૩, 24-27
મારી નિદ્રાના પહેરેદારો	મનીષા જોધી	૬, 19-21
મિજાજ	હસમુખ અબોટી 'ચંદન'	૧૦, 23
મોઝાં	સત્યજિત શર્મા	૧૦, 19-20
રહીએ	રવીન્દ્ર પારેખ	૮, 18-19
રહી રહીને	રાકેશ હાંસલિયા	૮, 17-18
રંગબેરંગી કુંગાઓ	યોગેશ જોધી	૧૨, 19
રામની વાડીએ	ઉશનસ્કુ	૧૧, 78
લીલી પરિકમા	રમેશ આચાર્ય	૮, 19
લીલો અવાજ	નરેશ સોલંકી	૧૧, 20
લોકડાઉનની રમણા	પીયુષ ઠક્કર	૮, 21-22
વતનથી વિદ્યાય થતાં	જગંત પાઠક	૧૦, 84
વળાવી બા આવી	ઉશનસ્કુ	૧૧, 87
વિચાર	કુમાર ભંડ	૧૧, 20
વૃક્ષ	હસમુખ કે. રાવલ ૪ અને ૫,	21
સાંભરણ	જગદીપ ઉપાધ્યાય	૭, 24
સ્થૂણાકણ્ણ	ઉદ્યન ઠક્કર	૨, 16-19
સ્પર્શવિલાસ-!	વીરુ પુરોહિત	૭, 23
સ્વખનવત્તુ	નલિન રાવળ ૪ અને ૫,	15
સ્વીકારી છે	પૂર્વી અપૂર્વ બ્રહ્મભંડ	૧૦, 25
સહેજ મોડા પડ્યા	હર્ષદ ચંદારાણા	૭, 23-24
હાઈકુ	મંગળ રાવળ	૮, 23 'સ્નેહાતુર'
હાઈકુ	રમેશ પટેલ	૮, 18
હાથી	ઇન્દ્ર જોશી	૭, 24-25

<b>• કેફિયત</b>		
અનુવાદ : નિજના ગૌણત્વનું ભાન	અરુણા જોડેજા	૩, 44-51
<b>• ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે</b>		
સ્વાયત્તતાનું જાહેરનામું : ઉમાશંકર જોશી;	સંકલન	૨, 81-84
29 ઓગસ્ટ : દર્શક સંવત્સરી, કૃષ્ણાદિત્ય;	પ્રકાશ ન. શાહ	
પ્રકાશ ન. શાહ; સ્વાયત્તતા વિશે નિરંજન ભગત		
સ્વાયત્તતા, સત્તા અને સાહિત્યકાર	પ્રવીણ પંડ્યા	૧, 64-66
<b>• શાનસત્ર વિશેષ</b>		
ગુજરાતી સાહિત્ય પરિપદનું ૩૧મું શાનસત્ર	અજય પાઠક	૧, 41-50
વર્તમાન શાનસત્રનાં અધ્યક્ષીય પ્રવચનો	ચન્દ્રકાન્ત ટોપીવાળા	૧, 50-51
સર્જકત્વની સમાલોચના	ટી. કેદિત્સુ,	૨, 37-45
	અનુ. ભગવાન થાવરાણી	
<b>• નિબંધ</b>		
ગુજરી	રમેશ કોઠારી	૨, 28-30
ટીકઠેકાણું	કલ્પેશ ચાવડા	૭, 42-46
ગણ વડલા	જયંત ડંગોદરા	૧૧, 35-39
બદામી	દક્ષા પટેલ	૮, 31-33
યાદ આવે, આતા ને વાંસળી	કિંના ગરણિયા	૧, 34-36
રખુનો કાગળ : શામ-એ-બનારસ...	મહેન્દ્રસિંહ પરમાર	૭, 39-42
લેખણ	હર્ષદ ત્રિવેદી	૬, 46-52
<b>• પત્રસેતુ</b>		
આકાશ ટક્કર	૮, 88-89	
ઉકાભાઈ હરિભાઈ વધાસિયા	૧, 85	
દુકેશ ઓઝા	૧૦, 85	
થોભણ પરમાર	૮, 88; ૧૦, 85; ૧૨, 67	
નરોત્તમ પલાણ	૧, 83-84; ૧૨, 66	
નિરૂપમ છાયા	૮, 87-88	
પીયૂષ પારાશર્ય	૧, 84-85	
યશવન્ત મહેતા	૧૨, 66	

● प्रभुभीय	सितांशु यशश्वन्द्र	
द्विदल पर्षि		
१. सर्जकता स्वायतता अने संस्थाओ : एक साहित्यविमर्श	८, 6-9	
समकालीन भारतीय कविता : आपणी वात आपणी रीते लेखांक-29	८, 9-13	
द्विदल पर्षि : लेखांक-2		
१. संस्थाओ अने सत्ताओ : एक संबंध-भीमांसा	१०, 6-8	
२. समकालीन भारतीय कविता : आपणी वात आपणी रीते लेखांक-30	१०, 8-12	
द्विदल पर्षि : लेखांक-3		
साहित्य - संस्थाओ : उपनिषदो, न के अड़ाओ-	११, 6-10	
२. समकालीन भारतीय कविता : आपणी वात आपणी रीते लेखांक-31	११, १०-14	
द्विदल पर्षि : लेखांक-4		
१. कवितानी बधुजेती नजरे आपणे	१२, 6-9	
२. समकालीन भारतीय कविता : आपणी वात आपणी रीते लेखांक-32	१२, 10-13	
समकालीन भारतीय कविता : आपणी वात आपणी रीते लेखांक-22 थी 28	१, 7-12; २, 7-12; ३, 6-12; ४ अने ५, 6-14; ६, 6-11; ७, 6- 11; ८, 6-14; ९, ८	
● प्रस्तावना		
कवितानी केड़ीओ (काव्यना स्पर्श : धीरेन्द्र महेता) उरिकृष्ण पाठक	२, 74-80	
‘फार्बसविरह’ : दलपत्रामनी विरल आत्मलक्षी रमण सोनी	१०, 64-73	
काव्यरचना		
● मुलाकात		
‘धेर जतां’ पूर्वेनी कणाकार कवि संपादक शेखनी सिद्धियात्रा	राधेश्याम शर्मा	१, 67-77
● लघुकथा		
आकार	नसीम महुवाकर	२, 24-25
निःशेष	धीरेन्द्र महेता	२, 24
पूछवानुं रही गयुं	धीरेन्द्र महेता	८, 30

• લાલિત ગથ

વાઈ રમ

શું કહું !

વર્ષા અડાલજા ૧૦, 42-46

પ્રહુલ્લ રાવલ ૭, 47

• વક્તવ્ય

પ્રમુખીય સંબોધન (ગુજરાતીનો અધ્યાપક  
સંઘનું ૬૯મું અધિવેશન)

કીર્તિદા શાહ ૪ અને ૫, 53-61

• વાર્તા

એસ્કેલેટર

ઓહું

જદુનાથનો ઉદ્ર

નિરાંતનો એક શાસ

પખાનું ઘર

પિંડ

બસ, એટલું જ

બાયોમેડિકલ વેસ્ટ

માઇલી

માવહું

મેં તો ઘટ ઘટ દેખા સાંચ

લોકશક્તિ 22928

વેલ્યુ

વેલ્ટિંગ રૂમ-15

દક્ષા પટેલ ૩, 34-37

રવીન્દ્ર પારેખ ૬, 24-27

બિપિન પટેલ ૭, 26-36

કંદ્ર્પ ર. દેસાઈ ૧૧, 30-34

સ્વાતિ મહેતા ૧૦, 27-35

પૂજન જાની ૧૦, 35-41

દેવયાની દવે ૬, 27-32

ઈલા આરબ મહેતા ૩, 29-33

વીનેશ અંતાણી ૮, 25-30

કિસનસિંહ પરમાર ૪ અને ૫,  
22-27

પ્રવીણ ગઢવી ૧૨, 20-30

ગિરિમા ઘારેખાન ૪ અને ૫,  
27-32

સંજ્ય ચૌધરી ૮, 26-30

બહાદુરભાઈ જ. વાંક  
૨, 26-27

જગાદીશ ત્રિવેદી ૭, 36-38

ગિરીશ ભંડ ૧૧, 23-30

પન્ના ત્રિવેદી ૧, 26-33

• વાર્ષિક સૂચિ

'પરબ' 2020

ઉર્મિલા ઠાકર ૧૨, 68-87

પરબ ફિલેમ્બર, 2020

## • વિવેચન

પર્યાવરણ અને પર્યાવરણકેન્દ્રી વિવેચના	પ્રવીષા દરજી	૮, 39-46
ભાતશ પ્રભુ રઘુનાથ કહે	રાજેશ પંડ્યા	૮, 47-61
યૂપસ અને બાપાની પીપર	ચન્દ્રકાન્ત ટોપીવાળા	૮, 35-38

(યૂપસનું ઝાડ, પુશ્કિન; અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા)

સર્જનાન્બક સાહિત્યમાં ભવનની સમસ્યાઓ	ચન્દ્રકાન્ત ટોપીવાળા	૧૨, 48-52
-------------------------------------	----------------------	-----------

## • વિશેષ

‘કદાચ, સૂરજ ઉગે...’	ભરત મહેતા	૧૨, 40-42
નોબેલ પુરસ્કારવિજેતા કવિયિત્રી લુર્ધસ ગલુક	ઉર્મિલા ઠાકર	૧૧, 71-73
સ્વસ્થ જીવનની પારાશીશી	વિજય શાસ્ત્રી	૪ અને ૫, 41-45
(‘મોજમાં રેવું રે !’ : રત્નલાલ બોરીસાગર)		

## • શતાબ્દી વંદના

આકરી ચિકિત્સા અને વિચારોતેજકતા	રમણ સોની	૮, 46-49
ઉશનસુની કાવ્યધારા : તેજ અને તાસીર	ચંદ્રકાન્ત શેઠ	૮, 38-45
સ્વ. જ્યેઠ પાઠકની જન્મશતાબ્દીએ	વિજય શાસ્ત્રી	૧૦, 58-63
પુષ્યસ્મરણ		

## • શ્રદ્ધાંજલિ

અમારા નાટ્યસર્જક શ્રીકાન્ત શાહને	ભરત દવે	૩, 52-57
અલકાજી : મારા કલાગુરુ	ભરત દવે	૮, 50-56
એક સભર, સજગ જીવન	હિમાંશી શેલત ૪ અને ૫,	69-72
કલાવિદૃષ્ટી કપિલા વાત્સયાયન	ભરત દવે	૧૨, 53-60
કવિ દીપક બારડોલીકરને	સંધ્યા ભહુ	૪ અને ૫, 72-73
તબીબકવિ દિલીપ મોદીને સલામ	સંધ્યા ભહુ	૮, 83
નગીનદાસ સંધ્યા, સફરની સલામ	પ્રકાશ ન. શાહ	૮, 80-82
પરિષદ પરિવારની શોકાંજલિ	સ્થિતાંશુ યશશ્વન્દ્ર	૬, 82
પારુલબહેનને શ્રદ્ધાંજલિ	ભરત દવે	૭, 71-73
ફાધર વાલેસ	પ્રહુલ્લ રાવલ	૧૨, 61-64
ભોગળોની પેલે પાર	વર્ષા અડાલજા	૪ અને ૫, 62-69
વિદાય ડૉ. નટવરસિંહ પરમારની	હિમાંશી શેલત	૧૦, 74-77
સહુના આત્મીય પારુલબહેન ચૌધરીની	પ્રહુલ્લ રાવલ	૬, 83
ચિરવિદાય		
સંનિષ્ઠ સારસ્વત શ્રી મોહનભાઈ પટેલ	ગિરિમા ધારેખાન	૧૦, 77-78
પરબુ ફિસેભાર, 2020		79

● समीक्षा/ग्रन्थावलोकन

अनुभवोनुं ऐश्वर्यवान् प्रवासरूप (सात समंदर पार : उकेश ओजा)	જनક रावल	₹, 78-81
કथनां विविध पासांओनुं बहुरंगी दस्तावेज्जकरण (કम्भु : गर्द काल अने आज : हरेश धोणकिया)	મावજ मહेश्वरी	₹, 75-77
‘कथाविश्व’नी समृद्धि (‘कथाविश्व’ : शिरीष पंचाल, संपा.)	हिमांशी शेलत	₹, 61-67
‘कुसुमाख्यान’ : एक जलक (कुसुमाख्यान : भधुभाई)	प्रहुल्ल मહेता	₹, 69-72
गांधीજना अमदावादना दोळ दायकाना संबंधनो ऐतिहासिक दस्तावेज (गांधीજ, अमदावादने आंगणे : माझेक पटेल)	परीक्षित जोशी	₹, 58-61
‘चंद्र’-हंसनुं एनरकाफ्ट, बहुकल्पित उड्यन (एनरकाफ्ट : चन्द्रकान्त टोपीवाणा)	राधेश्याम शर्मा	₹, 74-78
चेषोवनो सर्वांगी परिचय करावतो ग्रंथ (मारो गमतो सर्जक चेषोव : भरत दવे)	अभिजित व्यास	₹, 71-73
ज्ञागवानी आलबेल करती नवलकथा (‘ज्ञवाण जगमां ज्ञागिया’ : बहुल दवे)	हरेश धोणकिया	₹, 70-73
दश्योनी भीतरनो विस्मयलोक (शाहीनुं टीपुं : रमणीक सोमेश्वर)	रमण सोनी	₹, 74-82
नवलकथा ‘अनाहता’ : द्वन्द्वनो ऊजगो चहेरो (अनाहता : कुमारपाण देसाई)	सेजल शाह	₹, 69-77
नवलरामना सीधा वारसदार – पलाश (तपास : नरोत्तम पलाश)	उकेश ओजा	₹, 73-75
निषेधोने उल्लंघी जती कवितानो ‘ग’ सिद्ध करतो ध्यानाहू संग्रह... एक विहंगावलोकन... (‘गणग’ : प्रतिष्ठा पंड्या)	राधेश्याम शर्मा	₹, 68-70
नोभा भिजाजना अनोभा छास्यलेखो (आजनुं काम काले : कल्पना देसाई)	विजय शास्त्री	₹, 52-54
पचासमे पगथिये... परोळ (‘पचासमे पगथिये’ : योगेश न. जोशी)	अजय पाठक	₹, 82-85

‘પરમનો સ્પર્શ’ પામવાનો સરિયામ રસ્તો (‘પરમનો સ્પર્શ’ : કુમારપાળ દેસાઈ)	શ્રદ્ધા ત્રિવેદી	૧, 54-58
પિંડથી બ્રહ્માંડ લગી ફરી વળતી સર્જકચેતના (‘પિંડથી બ્રહ્માંડ’ : હાર્દિક વ્યાસ)	કિશોર વ્યાસ	૩, 77-80
માતૃભાષાના જિજ્ઞાસુ માટેની ખરી હાથપોથી (ગુજરાતી લેખન-પદ્ધતિ : રમણ સોની)	પ્રવીણ કુકડિયા	૪ અને ૫, 74-77
વ્યક્તિત્વની સંભાવનાઓનાં ચિત્રો (‘અરીસામાં યાત્રા’ : અંજલિ પ્રદીપ ખાંડવાલા)	હિમાંશી શેલત	૧૧, 74-76
સંસ્કૃતિભેદને ચીધથું નાટક ‘અરણ્યા’ (અરણ્યા : સતીશ વ્યાસ)	નરેશ શુક્રલ	૧૧, 76-78
સૌંદર્ય અને સંસ્કૃતિનો વિરલ યોગ : પરિક્રમા નર્મદા મૈયાની (પરિક્રમા નર્મદા મૈયાની : અમૃતલાલ વેગડ)	વિપુલ પુરોહિત	૬, 74-78
સ્વીસંવેદનની કવિતા (ધરવખરી : દક્ષા પટેલ)	સંધ્યા ભહે	૩, 80-82
હેરિટેજ સ્ટિ અમદાવાદની ખરી ઓળખ કરાવતો સંદર્ભંથ (અમદાવાદના પોળો અને પરાં : માણેક પટેલ)	પરીક્ષિત જોશી	૧૦, 79-81
‘લાલલીલાજાંબલી’ રંગની ગજલો (‘લાલલીલાજાંબલી’ : ભરત વિંગ્રુડા)	ધનિલ પારેખ	૧, 61-63
‘વહીવટ’ ખરો પણ ‘જાહેર’ નહીં, ‘અંગત’ (‘જાહેર વહીવટ’ : ડેનેશ ઓઝા)	હરિકૃષ્ણ પાઠક	૮, 62-68
‘વાવણી’માં ઉઘડતો તાજગીભર્યો નિબંધફાલ (‘વાવણી’ : દિનેશ પટેલિયા)	ઉત્પલ પટેલ	૮, 78-82

## ● સાહિત્યવૃત્ત

સંકલન : પરીક્ષિત જોશી

અહિંસા નિબંધસ્પર્ધા ૮, ૮૬ • આપત્તિકાળની કૃતિઓનાં પોખરાં ૮, ૭૯ • એકાંકી નાટ્યલેખનસ્પર્ધા ૭, ૮૮ • ઓનલાઈન જલસાગોંડિ ૮, ૮૭ • કર્મણ્ય કાર્યક્રમ ૮, ૮૭ • કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયની નિમિત્ત કાવ્યપઠન • કાવ્યગોંડિ ૧, ૮૦ • કાવ્યમુદ્રા એવોર્ડ ૭, ૮૮ • કેન્દ્રીય સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર ૩, ૮૭ • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યક્રમો ૧, ૮૦-૮૧; ૩, ૮૭; ૮, ૮૭ • ગુજરાતી હાસ્યસાહિત્યવંદના ૨, ૮૭ • ગ્રંથગુલાલ ૩, ૮૮ • નાટ્યમંચન ૧, ૮૧ • નિબંધ અને કાવ્યપાઠ ૮, ૮૬ • પારિતોષિક વિતરણ ૩, ૮૮ • પુસ્તકવિમોચન ૩, ૮૭ • બાળનાટ્યપ્રસ્તુતિ ૩, ૮૮ • ભારતીય સાહિત્ય વિશે યુવા આયામ આયોજિત વિમર્શ ૮, ૮૭ • મનનો જમણવાર ૨, ૮૭ • ‘રેતીનો માણસ’ પોખાયો, ૧૦, ૮૨

- રમેશ આચાર્યનું કાવ્યવિશ ૮, 86 • લધુનવલ સ્પર્ધિમાં ‘કોરું આકાશ’ પ્રથમ ૧૦, 82 • વિશ્વ ગુજરાતી મનાઈ સભ્યપદ ૨, 87 • સિતાંશુ યશશ્વરનાં ઓનલાઈન વાય્યાનો ૬, 86 • હાસ્યરચના સ્પર્ધા ૭, 88

### ● સ્વાયત્તતા સંમેલન

	સંકલન : પ્રકાશ ન. શાહ
અનુમોદના	ઉદ્યન ઠક્કર 3, 85
આ પ્રશ્નને લોકો સુધી પહોંચાડીએ	ધીરુ પરીખ 3, 84
આત્માની પોર્નોગ્રાફી સામે	અનિલ જોશી 3, 84
ઉમાશંકર અને દર્શકની કેડીએ	રમણીક સોમેશ્વર 3, 84-85
વાચકવર્ગનો પૂરો સહકાર	રૂપલ મહેતા 3, 85

### કર્તાસૂચિ

(નોંધ : ગુજરાતી આંકડા અંકનો મહિનો અને અંગ્રેજી આંકડા ફૂતિના પૃષ્ઠકમાંક દર્શાવે છે. \* આવરણપૃષ્ઠ સૂચવે છે.)

અજ્યા પાઠક	૧, 41-50; ૮, 82-85
(કવિ) અજ્ઞાત	૧, 25
અનિલ જોશી	3, 84
અનિલ ચાવડા	૬, 22
અનિલ રમાનાથ	૩, 14-15; ૯, 16-19; ૮, 19-20
અભિજિત વાસ	૯, 71-73; ૮, 77-78; ૧૧, 86-87
અમિત કલ્લા	૧૦ *આ.પુ.
અરુણા જાડેજા	૩, 44-51, ૧૧, 58-68
આકાશ ઠક્કર	૮, 8-89
ઈન્ડુ જોશી	૭, 24-25
ઈલા આરબ મહેતા	૩, 29-33
ઉત્પલ પટેલ	૩, 63-67, ૮, 78-82
ઉદ્યન ઠક્કર	૨, 16-19; ૩, 85; ૭, 21-22; ૧૦, 15-17
ઉમેશ જોખી	૮, 20
ઉશનસ્	૧૧, 39, 70, 73, 78, 87
ગુકાભાઈ હરિભાઈ વધાસિયા	૧, 58
ગુર્મિલા ઠાકર	૧૧, 71-73; ૧૨, 68-87
કમલ વોરા	૧૦, 47-50
કલ્પેશ ચાવડા	૭, 42-46
કંદર્પ ૨. ડેસાઈ	૧૧, 30-34

કાન્તિ પટેલ	૧૧, 42-47
કિરણ વી. મહેતા	૧૦, 23-24
કિશનસિંહ પરમાર	૪ અને ૫, 22-27
કિશોર વ્યાસ	૩, 77-80
કિઝા ગરણિયા	૧, 34-36
કીર્તિદા શાહ	૪ અને ૫, 53-61
કુમાર ભવું	૧૧, 20
ગિરિમા ધારેખાન	૪ અને ૫, 27-32, ૧૦, 77-78
ગિરીશ ભવું	૧૧, 23-30
ગુણવંત ઉપાધ્યાય	૧૦, 22
ચંદ્રકાન્ત ટોપીવાળા	૧, 50-51; ૩, 13-14; ૮, 35-38; ૧૦, 13-14; ૧૨, 48-52
ચંદ્રકાન્ત શેઠ	૨, 13-15; ૬, 12-14; ૮, 38-45; ૧૨, 31-37
છાયા ત્રિવેદી	૮, 18
જગદીપ ઉપાધ્યાય	૭, 24
જગદીશ ત્રિવેદી	૭, 36-38
જનક રાવલ	૬, 78-81
જ્યંત ડાંગોદરા	૧૧, 35-39
જ્યંત પરમાર	૭, *આ.પુ.
જ્યંત પાઠક	૧૦, 41, 50, 73, 84, 86
જ્યંત મેઘાણી	૭, 48-50
જિગર જોખી ‘પ્રેમ’	૧૨, 17
જિતેન્દ્ર મેકવાન	૭, 54-70
દંકેશ ઓઝા	૩, 73-75; ૧૦, 73-75
થોભણ પરમાર	૮, 88; ૧૦, 25; ૧૧, 21
દક્ષા પટેલ	૩, 34-37; ૮, 31-33
દક્ષા વ્યાસ	૧૧, 68-70
દર્શિની દાદાવાલા	૮, 60-68
દૃષ્ટિ પટેલ	૪ અને ૫, 46-52
દિલીપ જોશી	૮, 18
દિલીપ અવેરી	૧, 13-17
દિલીપ મોટી	૮, 61
દીપક રાવલ	૮, 81

દેવયાની દવે	૬, 27-32
ધીરુપરીખ	૩, 84
ધીરેન્દ્ર મહેતા	૨, 24; ૬, 30
ધ્રુવ મિશ્રી	૬, *આ.પૃ.
ધ્વનિલ પારેખ	૧, 61-63
નરેશ શુક્લ	૧૧, 76-78
નરેશ સોલંકી	૧૧, 20
નરોત્તમ પલાણ	૧, 83-84; ૮, 57-60; ૧૨, 66
નલિન રાવળ	૪ અને ૫, 15
નસીમ મહુવાકર	૨, 24-25
નિરંજન ભગત	૩, 38-39
નિરંજન રાજ્યગુરુ	૨, 20-21
નિરૂપમ છાયા	૮, 87-88
પત્રા ત્રિવેદી	૧, 26-33
પરીક્ષિત જોશી	૧, 58-61; ૧, 80-81; ૨, 87; ૩, 87-88; ૭, 88; ૮, 79; ૯, 86-87; ૧૦, 79-82; ૧૨, 65
પરેશ દવે	૨, 23
પંચમ શુક્લ	૧૦, 20
પારુલ ખખખર	૩, 21-23; ૧૧, 18-19
પીયૂષ ઠક્કર	૧, 82; ૩, 89; ૪ અને ૫, 33; 87-88; ૬, 89-90; ૭, 89-90; ૮, 84-86; ૯, 21-23; ૮૮-૮૯; ૧૦, 83-૪; ૧૨, 43-47
પીયૂષ પારાશર્ય	૧, 84-85
પૂજન જાની	૧૦, 35-41
પૂર્વી અપૂર્વ બ્રહ્મભહ્ન	૧૦, 25
પ્રકાશ ન. શાહ	૨, 81-84; ૩, 83-85; ૮, 80-82
પ્રતિજ્ઞા પંડ્યા	૩, 17-21; ૯, 34
પ્રહુલ્લ મહેતા	૮, 69-72
પ્રહુલ્લ રાવલ	૧, 78-79; ૨, 85-86; ૩, 86; ૪ અને ૫, 78-85; ૬, 83-86; ૭, 25, 47, 83-87; ૮, 73-76; ૧૧, 79-85; ૧૨, 61-64
પ્રબોધ પરીખ	૮, *આ.પૃ.
પ્રવીણ કુકરિયા	૪ અને ૫, 74-7૭

પ્રવીષા ગઢવી	૧૨, 20-30
પ્રવીષા દરજી	૨, 21-23; ૮, 39-46; ૧૧, 16-17
પ્રવીષા પંડ્યા	૧, 64-66; ૪ અને ૫, 19-21
બકુલ દવે	૬, 33-45
બહાદુરભાઈ જ. વાંક	૨, 26-27
બિનોય પી.જે.	૮, *આ.પૃ.
બિપિન પટેલ	૭, 26-36
ભગવાન થાવરાણી	૨, 37-45
ભરત દવે	૩, 51-57; ૭, 71-73; ૮, 50-56; ૧૨, 53-60
ભરત મહેતા	૧૨, 40-42
ભરત વિઝુડા	૧૨, 16
ભાવેશ વાળા	૮, 32-34
ભૈરવી મોટી	૧, *આ.પૃ., ૩, *આ.પૃ.
મનીષ પરમાર	૮, 23
મનીષા જોખી	૬, 19-21
મનોહર ત્રિવેદી	૪ અને ૫, 16-17
મહેન્દ્ર જોશી	૪ અને ૫, 17-18
મહેન્દ્રસિંહ પરમાર	૭, 39-42
મંગળ રાવળ ‘સ્નેહાતુર’	૮, 23
માવજી મહેશરી	૩, 75-79
મૂકેશ વૈઘ	૮, 15; ૧૧, 40-41
મોના લિયા	૩, 23
યજોશ દવે	૭, ૧૨-19
યશવન્ત મહેતા	૧૨, 66
યામિની વ્યાસ	૬, 23
યોગેશ જોખી	૮, 21-25; ૧૨, 19
રમણ સોની	૩, 40-43; ૪ અને ૫, 34-37; ૬, 21; ૭, 74-82; ૮, 46-49; ૧૦, 64-73; ૧૧, 51-58
રમણીક અગ્રાવત	૨, 31-36
રમણીક સોમેશ્વર	૩, 84-85; ૧૨, 15
રમેશ આચાર્ય	૮, 19
રમેશ કોઠારી	૨, 28-30
રમેશ પટેલ	૮, 18

રવીન્દ્ર પારેખ	૯, 24-27; ૮, 18-19
રાકેશ દેસાઈ	૧, 24-25
રાકેશ હંસલિયા	૮, 17-18
રાજેન્દ્ર પટેલ	૧૦, 18-19
રાજેશ પંડ્યા	૯, 14-15; ૮, 47-61
રાજેશ વાણીકર	૬, 63-55
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’	૩, 15-17, ૮, 16-17
રાજેશરી પટેલ	૩, 58-62
રાવિકા પટેલ	૧૧, 22
રાહેશ્યામ શર્મા	૧, 37-40, 67-77; ૨, 46-48; ૬, 68-70; ૭, 74-78; ૧૦, 54-57; ૧૧, 48-50
રામચન્દ્ર પટેલ	૪ અને ૫, 16
રિયાજ દામાણી	૧૨, 18
રૂપલ મહેતા	૩, 85
રેણુકા દવે	૩, 27-28
લલિત ત્રિવેદી	૭, 19-21; ૧૧, 15-16
લિપિ ઓઝા	૧૦, 24
વર્ષા અડાલજા	૪ અને ૫, 62-69; ૧૦, 42-46
વર્ષા દાસ	૪ અને ૫, 33; ૧૨, 14
વહીદા ડ્રાઇવર	૧૨, 18
વંદના શાંતુર્ધન્દુ	૩, 67-72
વિજય પંડ્યા	૪ અને ૫, 38-40; ૭, 51-53; ૮, 35-37; ૧૦, 51-54; ૧૨, 37-39
વિજય શાસ્ત્રી	૧, 52-54; ૪ અને ૫, 41-45; ૧૦, 58-63
શરીરકા વીજળીવાળા	૨, 49-60
શ્રદ્ધા ત્રિવેદી	૧, 54-58
સતીશ ગુજરાલ	૪ અને ૫, *આ.પૃ.
સત્યજિત શર્મા	૧૦, 19-20
સમીર ભણ	૪, 24-27
સંજય ચૌધરી	૮, 26-30
સંધ્યા ભણ	૩, 80-82; ૪ અને ૫, 72-73; ૮, 83
સિતાંશુ પશુશ્રાન્દ	૧, 7-12; ૨, 7-12; ૩, 6-12; ૪ અને ૫, 6-14; ૬, 6-11; ૮૨, ૭, 6-11; ૮, 6-14; ૯, 6-9; ૯, 9-13; ૧૦, 6-12; ૧૧, 6-14; ૧૨, 6-13

સુધીર પટેલ	૧૦, 21
સેજલ શાહ	૯, 69-77
સ્વાતિ મહેતા	૧૦, 27-35
હરિકૃષ્ણ પાઠક	૨, 74-80; ૮, 62-68
હરીશ મીનાશ્રુ	૧, 21-24
હરેશ ધોળકિયા	૨, 70-73
હસમુખ અભોટી ‘ચંદન’	૧૦, 23
હસમુખ કે. રાવલ	૪ અને ૫, 21
હસિત મહેતા	૨, 60-69
હર્ષ બ્રહ્મભં	૯, 24
હર્ષદ ચંદરાણા	૭૭, 23-24
હર્ષદ ત્રિવેદી	૬, 46-52
હર્ષદ દવે	૯, 20
હિતાંશુ ભડ્ક	૧૦, 25-26
હિમાંશી શેલત	૪ અને ૫, 69-72; ૬, 61-67; ૧૦, 74-77; ૧૧, 74-76
હેમંત ધોરડા	૯, 16-17



## સાભાર સ્વીકાર

### બાળ સાહિત્ય

જાડવાં ફળ નથી ખાતાં રે કનુ આચાર્ય, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮ + ૫૨, રૂ. ૬૦. ટારઝન રાણીનો માનીતો નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૧૦ + ૬૨, રૂ. ૭૦ ટારઝન સોનાની નગરીમાં નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૧૦ + ૬૬, રૂ. ૭૫. ટારઝનનું લોહી નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૧૦ + ૭૦, રૂ. ૮૦. કાળા-ધોળા હરીશ નાયક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪ + ૬૪, રૂ. ૧૨૦ ફૂલનો દરિયો કીર્તિદા બ્રહ્મભં, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૮ + ૪૪, રૂ. ૮૦ પંચતંત્ર વિનોદ જાની, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૬ + ૮૮, રૂ. ૧૭૦. દયા ધરમ કા મૂલ હૈ હરીશ નાયક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪ + ૬૪, રૂ. ૧૨૦. આ વૃક્ષને સલામ કરો હરીશ નાયક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪ + ૬૪, રૂ. ૧૨૦. ઊર્યું શિખર ઊંચી શિખ હરીશ નાયક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪ + ૬૪, રૂ. ૧૨૦.

## આ અંકના લેખકો

ગર્મિલા ઠાકર	: ૨૦૨, અરિહત ઓન્કલેવ, ધનવંતરિ ગાર્ડન સામે, ફિલેઇનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
ચન્દ્રકાન્ત ટોપીવાળા	: વી/૬, પૂર્ણશ્વર ફ્લોટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫
ચંદ્રકાન્ત શેઠ	: બી/૮, પૂર્ણશ્વર ફ્લોટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫
જિગર જોખી 'પ્રેમ'	: પૈઠ, ગંગોત્રીપાર્ક, યુનિવર્સિટી રોડ, સવાણી કિડની હોસ્પિટલ સામે, રાજકોટ-૩૬૦૦૦૫
થોભણ પરમાર	: ૨૨, સરિતા રોડ હાઉસ, એલ. પી. સવાણી સ્કૂલ પાસે, અડાજણા-પાલ, સુરત-૩૮૪૫૧૦
નરોત્તમ પલાણ	: 'દર્શન', ૩, વાડી પ્લોટ, પોરબંદર-૩૬૦૩૭૫
પરીક્ષિત જોશી	: ૬, તપસ્વી જલારામ સોસાયટી, જ્ઞાનદા બસસ્ટેન્ડ પાસે, જીવરાજપાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧
પીયુષ ઠક્કર	: ૮૦૩, યોગીસૂચિ ઓપાર્ટમેન્ટ, વહાણવટી માતા મંદિર પાસે, ઓઢવપુરા, ઈલોરા પાર્ક, વડોદરા-૩૬૦૦૨૩
પ્રહુલ્લ રાવલ	: ૩, રાજમહેલ ફ્લોટ, આઈ.ઓ.સી. કોલોની રોડ, વીરમગામ- ૩૮૨૧૫૦
પ્રવીણ ગઢવી	: આસવલોક, ૪૬૬/૨, સેક્ટર-૧, ગાંધીનગર-૩૮૨૦૦૭
ભરત દવે	: બી/૭૦૩, રૂદ્રપ્રયાગ ફ્લોટ, હોટલ મેરિયોટ પાછળ, રેવતી બિલ્ડિંગ સામે, અમદાવાદ
ભરત મહેતા	: બી/૮૭, 'મંદાર', યોગીનગર ટાઉનશીપ, છાણી, રામાકાકા દૂધની ડીપી પાસે, વડોદરા
ભરત વિસુડા	: 'રામકૃપા', ખાડી કાર્યાલય પાસે, સાવરકુંડલા
યશવંત મહેતા	: ૪૭/અ૧, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
યોગેશ જોખી	: બી/૩૦૩, અર્જુન ગ્રીન્સ, નીલકંઠ મહાદેવ પાસે, કે.કે.નગર રોડ, રનાપાર્ક, અમદાવાદ-૩૮૦૦૬૧
રમણીક સોમેશ્વર	: C/o. દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી પાસે, ભુજ-૩૭૦૦૦૧
રિયાજ દામાણી	: સદરુદ્દિન વીરજ કોલોની, બ્લોક નં. ૭, વાંડળીયા રોડ, અમરપરા, બાબરા (જિ. અમરેલી)-૩૬૪૪૨૧
Varsha Das	: Z176, Park View Apts. B/2, Vasant Kunj, New Delhi - 110070
વહીદા ઝાઈવર	: એ/૧૦૫, યુનિક ઓપાર્ટમેન્ટ, દરગાહ રોડ, નવસારી - ૩૮૬૪૪૫
વિજય પંડ્યા	: ૧૧/અ૧, ન્યૂ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યૂબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮
સિતાંશુ યશશ્વન્દ	: ૩૦૨, ટાવર બી, શ્રવણ રેસિન્સી, કોસ્મિક ઓન્કલેવ, સમા રોડ, વડોદરા - ૩૬૦૦૨૪

## રંગદ્વાર પ્રકાશન

G-15, યુનિવર્સિટી ખાજા, દાદસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-380009  
ફોન નંબર : 079-27913344, વેબ સાઇટ : <http://www.rangdwar.com>

### નવલક્ષણ

લાગાડી	રધુવીર ચૌધરી	100
ઉપરવાસ કથાત્રયીનો સેટ	રધુવીર ચૌધરી	700
છચ્છાવર	રધુવીર ચૌધરી	150
થોમાકાકાની ખોલી (Uncle Tom's Cabinનો અનુવાદ) અનુ. રેમંડ પરમાર	350	
વચ્ચું ફળિયું	રધુવીર ચૌધરી	180
વેણુ વત્સલા	રધુવીર ચૌધરી	150
વિહેંગા	રાવિકા પટેલ	140
ગોકુળ, મથુરા, દ્વારકાનો સેટ	રધુવીર ચૌધરી	520
અમૃતા	રધુવીર ચૌધરી	250
બદલાતી ભોસમ	રક્ષા દેસાઈ	180
વિજય બાહુબલી	રધુવીર ચૌધરી	120
લોકલીલા	રધુવીર ચૌધરી	160
એક મુહી આસમાન (The Great Expectationનો અનુવાદ) અનુ. રેમંડ પરમાર	200	
સોમતીર્થ	રધુવીર ચૌધરી	200
આવરણ	રધુવીર ચૌધરી	150
આજની ઘડી તે....	કંદ્રપ ર. દેસાઈ	160
અંતર	રધુવીર ચૌધરી	120
કોતરની ઘાર પર, ડહેલું	કાનજી પટેલ	90
મનનું માણસ લે. સુનીલ ગંગોપાધ્યાય અનુ. પ્રીતિ સેનગુપ્તા	100	

# દાહીંક ભાવાંજલિ



તાજેતરમાં  
અવસાન પામેલા  
સવાયા ગુજરાતી  
શાધર વાલેસનાં  
નવી પેટીનું  
સંસ્કારધડતર  
અને  
ચારિષ્યધડતર  
કરતાં  
સદાબહાર પુસ્તકો

પ્રેરણાપરબ (પુરસ્કૃત)	100
વાણી તેવું વર્તન	500
બ્યાંઝિંથડતર	120
સમાજમંગલ	200
બ્યાંઝિંથગલ	280
ધર્મમંગલ	150
શિક્ષણમંગલ	200
સદાચાર	125
યુવાધર્મ	50



પ્રસન્નતાની પાંખડીઓ	80
ગાંધીજી અને નવી પેઢી (પુરસ્કૃત)	100
આકશવાણીના સૌજન્યથી	13
રોમેરોમે	13
સેવાધર્મ	90
મુરલી	100
લગ્નસાગર	251



## ગુર્જર ગંધીરણ કાર્યાલય

રટનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001

■ ફોન : 22144663, 22149660 ફેક્સ : 22144663

■ ઈ-મેઈલ : goorjar@yahoo.com

ગુર્જર સાહિત્ય પ્રકાશન : 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઈટેનિયમ સિટીસેન્ટર  
પાસે, સીમા હોલની સામે, 100 ફૂટ રોડ, પ્રફ્લાન્ડનગર, અમદાવાદ-15.  
ફોન : 26934340, મો. 9825268759 ઈમેલ : gurjarprakashan@gmail.com

# કેટલાંક નોંધપાત્ર પ્રકાશનો



## મહાત્મા

સ્વારાજીની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો

લેખક : ગંભીરસિંહ ગોહિલ

સંપાદક : કેતળ રૂપેરા

₹ 220

એ વાધણને પ્રેમપત્રો  
Love Poems to the Tigress

બ્રૂક્સ હોક્મેન (ભરત મિવેદી)

અનુવાદ : ચિંતન શેતલ

₹ 399

પુ. લ. એટલે પુ. લ.

અનુવાદ અને લેખન : અરૂપા જાડેજા  
₹ 350

મારી જીવનયાાા : દાડતર અને ચારાતર

ઇન્દ્રયામ ન. પટેલ

₹ 200

સૌગાત : પાંચ ભાષાનાં કાવ્યો

અનુવાદ : દીપક બારડોલીકર  
₹ 130

શાણદવેદી

સંકલન : ઉર્વીશ વાસવા

નરસિંહ મહેતાની સમગ્ર કવિતા


₹ 540

નિરંજન ભગત

સંપાદક

મનુલ રાવલ

₹ 220



કાળની કેડીએ

ઇડીક સંગ્રહ

નિરંજન ભગત

અદ્યયન ગ્રંથ

સંપાદક

રઘુવીર ચોદરી

ચમેશ ર. દવે

કિરીટ દૂધાત

₹ 500

ગ્રંથવિહાર

ગુજરાતી સાહિત્ય પરિષદ, 'ટાઈમ્સ'ની પાષળ, આશ્રમમાર્ગ,  
અમદાવાદ-09 • ફોન : 079-26587949 (બપોરે 12થી સાંકે 5)

ઘરે બેઠાં પુસ્તક મેળવવા માટે છોટ્સઅન્ન નં. 98987 62263 • કુદિયર ચાર્જ અવગાણી



## રન્નાદે પ્રકાશન

પૈઠ/૨, બીજે માળે, દેવસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧  
ફોન : ૨૨૧૧૦૦૮૧-૨૨૧૧૦૦૬૪

### ચિંતનાત્મક નિબંધો

#### પ્રવીષા દરજી

પુસ્તકનું નામ	કિંમત રૂ.
કોઝીમગ	૧૫૦.૦૦
સમયબોધ	૧૭૦.૦૦
એકમેકના જરૂખા	૧૭૫.૦૦
કોણ સાંભળે છે ?	૧૬૦.૦૦
ગીતાસ્વાદ	૧૮૦.૦૦
અંશ અને વંશ	૧૬૦.૦૦
જીવન જીવો, જીવન જીતો	૧૧૦.૦૦
માણસથી માણસ	૨૦૦.૦૦
વર્તુળની બહાર	૮૫.૦૦
પરિપ્રેક્ષન	૮૫.૦૦

#### ડૉ. ચંદ્રકાન્ત મહેતા

પુસ્તકનું નામ	કિંમત રૂ.
ચિંતનયાત્રા (ચિંતન કષ્ટિકાઓ)	૨૦૦.૦૦
જીવન તો કર્મયોગનું જરાણું	૧૫૫.૦૦
જ્યોતિ કલશ છલકે	૧૩૫.૦૦
પંથ જૂએ છે વાટ	૮૦.૦૦
તું હારવા જન્મ્યો નથી	૮૦.૦૦
કદમ, તને સલામ	૬૦.૦૦
થોડુંક આકાશ.... થોડીક ધરા	૨૪૦.૦૦

#### લાભશંકર ઠાકરે

પુસ્તકનું નામ	કિંમત રૂ.
એક મિનિટ!	૩૬.૦૦

## ફાધર વર્ગીસ પોલ

પુસ્તકનું નામ	કિંમત રૂ.
સફળ જીવનનો માર્ગ	૧૫૫.૦૦
ઈસ્ટ્રોબોધ	૧૭૦.૦૦
સફળ જીવનનો માર્ગ	૧૫૫.૦૦
નવું જીવન, નવી દિલ્હી	૧૫૦.૦૦
પ્રેમ અને પ્રસાન્તતાનો પ્રવાહ	૭૦.૦૦
મધ્યમધ્યતું જીવન	૭૦.૦૦
જીવનસંગીત	૭૦.૦૦
તમારું હૃદય ગાશે	૭૦.૦૦
જીવન સફર	૭૦.૦૦
માણસને માણસ તરીકે જુઓ	૭૦.૦૦
પ્રેમનું ઓજસ	૬૦.૦૦

## રમણ પાર્ઠક ‘વાચસ્પતિ’

પુસ્તકનું નામ	કિંમત રૂ.
ઉજાસનાં એંધાશ	૮૫.૦૦
આનંદની આરાધના	૧૦૦.૦૦
સંશયની સાધના	૬૫.૦૦

## ચીનુભાઈ ગી.શાહ

પુસ્તકનું નામ	કિંમત રૂ.
મૈં નીંદ ઉડાને આયા હું (એજન્સી)	૪૦.૦૦
ચમત્કારોની ચકાસાડી (એજન્સી)	૨૦.૦૦
હું દિગમ્બર અને હું ચેતામ્બર (એજન્સી)	૫.૦૦
ગીતા ઘડપણની (એજન્સી)	૪૦.૦૦
હળાહળ ઝેર કોમવાદનું (એજન્સી)	૮.૦૦
મરણ પછી શું ? (એજન્સી)	૧૨.૦૦

અંગ્રેજમાં ‘અંકલ ટોમ્સ કેબિન’ નામની એક નવલકથા લખાઈ છે. હેરિયટ બિચર સ્ટોવે નામની લેખિકાની આ નવલકથામાં રંગભેદ નિશાન પર હતો. રંગભેદ વિરોધી આ પુસ્તકની એટલી ચર્ચા થઈ કે એનાથી અમેરિકામાં ગુલામીની પ્રથા નાખૂં થઈ. અભાહમ લિંકનના સમયમાં રાજકીય ઊથલપાથલમાં આ નવલકથાએ મોટો ફાળો આપ્યો અને લોકજાગૃતિ એવી ફેલાઈ કે રંગભેદની નાખૂં બની ગઈ.

#### — યાસીન દલાલ

ગ્રીસીમાં વિશ્વભરમાં કાન્ટિનું વાતાવરણ હતું. રશ્યાની કાન્ટિએ યુરોપના કંગાળ રાષ્ટ્રના શ્રમિકોને ખમીરવંતા બનાવ્યા હતા. એની પૂર્વભૂમિકામાં જ ઉમાશંકરનું ‘જઠરાજિન’, સુન્દરમ્ભનું ‘ધણ ઉઠાવ’ અને મેઘાંજીનું ‘જગો જગના કુધાર્ટ’ જોવું જોઈએ.

#### — ભરત મહેતા

મૂળ ઈજિમના અને હાલ લંડનમાં સ્થિત, હિશામ માતર પાસેથી આપણાને ૨૦૧૬માં પ્રકાશિત ‘ધ રિટન’ ફૂતિ સાંપડે છે. લેખક અંગત વેદનાને વાચ્યા આપવા, કર્નલ ગદ્વારીના આપખૂં શાસન દરમિયાન ગુજારવામાં આવેલા અમાનવીય સિતમોનું બયાન કરે છે. ઈતિહાસકારને છાજે એવો અભિગમ અપનાવી લિબિયા પર શાસન કરી ચૂકેલા, જુદા જુદા કાળખંડના સરમુખત્વારોની માનસિકતા, નિર્દ્યતા, અમાનુષીપણાનો પરિચય કરાવે છે.

#### — રમેશ કોઠારી

દુંગલેન્ડની પાલમેન્ટમાં વિજયી થયેલા મજૂર પક્ષના ઉમેદવારોને પૂછ્યું કે, તમે કઈ પ્રેરણાથી મજૂર પક્ષમાં આવ્યા ? ત્યારે મોટાભાગનાએ જવાબ આપેલો ‘અન ટુ વિસ લાસ્ટ’ના વાચન થક્કી. મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે કે, ‘નવા યુગના અર્થશાસ્ત્રી હોબસને રસ્ટિકન વાંચીને મહાનિંબંધ લખેલો. અને મહાત્મા ગાંધીએ પણ આ પુસ્તક પોતાના એક પ્રવાસમાં વાંચેલું અને તેમનું જીવન પરિવર્તન થયેલું.’

#### — ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય

: સ્થાનસમર્પિત :

ડૉ. અરુણ જે. કક્કડ

ઓસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ, દેવમણી કોલેજ, વિસાવદર



રજિસ્ટ્રેશન નં. E - ૨૬૭ (સૂરત)

## નર્મદ સાહિત્ય સભા

**કાર્યાલય : સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૩૮૫૦૦૧  
મો. નં. ૯૮૨૫૧૪૪૪૨૭, ૬૩૫૨૨૨૩૦૫**

રજિસ્ટ્રેશન નં. E - ૨૬૭ (સૂરત)

## નર્મદ સાહિત્ય સભા

**કાર્યાલય : સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે,  
ગોપીપુરા, સુરત-૩૮૫૦૦૧ મો. નં. ૯૮૨૫૧૪૪૪૨૭, ૬૩૫૨૨૨૩૦૫**

### નર્મદ સાહિત્ય સભાનાં છ ચંદ્રકો

### માટે પુસ્તકો મોકલવાની જાહેરાત

નીચે જાણાવેલા વર્ષના ગાળામાં અને વિષયોનાં પ્રગટ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં, મૌલિક શ્રેષ્ઠ પુસ્તકને નર્મદ સાહિત્ય સભા તરફથી નીચે પ્રમાણેનાં ચેદકો એપાયત કરવામાં આવશે. સર્વે લેખકો અને પ્રકાશકોને તા. ૩૦-૦૧-૨૦૨૧ સુધીમાં દરેક પુસ્તકની બન્ધે નકલો, ‘કયા ચંદ્રક માટે છે’ તે વિગત અને લેખકનું પૂર્ણ નામ-સરનામું તથા મોબાઇલ નંબર પુસ્તકના પહેલાં પાંચ પર લખીને નર્મદ સાહિત્ય સભા, C/o સાહિત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત-૩૮૫૦૦૧ પર મોકલી આપવા વિનંતી છે.

૧. નર્મદચંદ્રક : નિબંધ-વિયેચન (વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮) માટે.
  ૨. નંદશંકર ચંદ્રક : નવલિકાસંગ્રહ (વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮) માટે.
  ૩. ડૉ. ફેની રતન માર્શલ ચંદ્રક : બાળસાહિત્ય (વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮) માટે.
  ૪. શ્રી નાનુભાઈ નાયક ચંદ્રક : ગાંધીવાડી વિચારસરણી/લોકશાલી વિચારધારા/ કે સમાજજીવન (વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮) માટે.
  ૫. મોહનલાલ દહે ચંદ્રક : વ્યાકરણ, સંશોધન, વિચેચન (વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮) માટે.
  ૬. રા. બ. કમળાશંકર નિરેદી ચંદ્રક : શિક્ષણ - સંસ્કૃત સાહિત્ય (વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮) માટે.
- કેતન મુનશી વાર્તાસ્પદ-૧૩ માટે વાર્તા મોકલવાની છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૨૦ છે. નિયમો માટે ઉપરોક્ત મો. નં.નો સંપર્ક કરવો.**

### પ્રમુખ

ડૉ. પ્રકુળ દેસાઈ (મોબાઇલ : ૯૮૭૯૪૯૬૬૦૨)

ઉપપ્રમુખો

શ્રી બદુલેશ દેસાઈ (મોબાઇલ : ૯૮૨૫૧ ૫૨૮૨૩)      ડૉ. હિલીપ મોટી (મોબાઇલ : ૯૮૨૫૮૩૪૦૦)

શ્રી પ્રશા વશી (મોબાઇલ : ૯૮૨૮૩૭૧૧૫૧)      શ્રી યામની વ્યાસ (મોબાઇલ : ૯૮૨૫૧૮૫૨૮૮)

કોષાય્યક

શ્રી કમલેશભાઈ ધાણી (મોબાઇલ : ૯૮૭૪૭૨૨૭૧)

મંત્રીઓ

## સ્પૃહા ભાર છે, તે ઉતારો હળવાશ છે

મનને કોઈ પણ, ચાહે લોખંડના, ચાંદીના કે સોનાના પિજરે પૂરનાર સ્પૃહા છે. પણી તે સત્તુ વિષયક હોય કે અસત્તુ વિષયક.

સ્પૃહા કરી કે પુણ્ય ઓછું ફરજનું. તે મેળવવા, આંબવા પનો ટૂંકો પડ્યો.

મનની વિચિત્ર ખાસિયત છે : જે ન મળે તેને જ મેળવવા મથ્યું રહે. તે નિષ્ફળતાના કારણરૂપ પુણ્યની ખામી જુએ તો જ પુણ્ય-સંપત્તિ વધારવા તરફ તે વિચારે. પણ... વો દિન કબ ? તે તો તેને હાંસલ કરવા જ લાગ્યો રહે.

તો, એવી સ્પૃહાનો ભાર લઈને જીવવાને બદલે હળવું જીવન જીવવા માટે કવિ ઉમાશંકરનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે :

‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ,  
બની રહો તે જ સમાધિ યોગ.’

સહજતાથી જીવવું – સારા સંકેતો મળે તો તે તરફ જીવન વાળવું. પ્રત્યેક સંકેતમાં ઈશ્વરની લિપિ જોવી. તેને ઉકેલવાની કોણિશ કરવી. આપણું જીવનકાર્ય શું હોય તેની આપણને ખબર ન હોય તેમ બને, પરંતુ ‘એને’ ખબર છે. તે જે રીતે જીવન દોરે તેની વચ્ચે દખલગીરી ન કરીએ અને ‘તેના’ દોરવાયા દોરવાઈએ. તેના ઈશારાને સમજવા ભરપૂર મહેનત કરીએ. એ સમજાય તો તે તરફ વળીએ. કાંઈક નકર મેળવ્યાના અહેસાસ સાથે જિંદગીની ચોપડીના બીજા પૂંડાને પણ બંધ કરીએ. કો’ક તેને માથે મૂકશે એ શ્રદ્ધા રાખવી ગમે છે એ માટે.

મનને સમજાવવું પડે છે કે સ્પૃહા ન રાખો. પુણ્ય પ્રમાણે સામેથી જ આવશે. જાણો છો ? એના ઉપર આપણું નામ કોતરાયું છે ! બીજું કોઈ એની માલિકી નહીં કરે. મળશે, આપણને જ મળશે. – પણ તેના સમયે અને આપણા કિરમત પ્રમાણે.

ભરોસો રાખજો અને તૈયાર રહેજો.

(પાઠશાળા)

— પ્રધુભનસૂરિ



સ્થાનસમર્પિત

### નિમેષભાઈ ડગલી

એમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

ઉ/એ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,

આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧૩. ફોન : ૩૨૮૦૬૬૫૫૫

## વચનપાલન અને શીલપાલન : આ બન્નેમાં દૃઢતા લાવો

વચનપાલન અને શીલપાલન : આ બન્ને તત્ત્વોમાં આજે ચોતરફ નિર્ભળતાનાં દર્શન થઈ રહ્યાં છે ! આવું અચાનક તો ન બને; તો વિવેકનો આવો અભાવ કેમ ? આનો જવાબ છે :

નિત્ય પ્રભાતે ઊઠીને માતાને પ્રણામ કરવાથી શીલપાલનનું બળ મળે છે અને પિતાને પ્રણામ કરવાથી શક્તિ પ્રગટે છે.

પ્રણામ કરવાથી તેઓના ઉપકારના સ્વીકાર સાથે ‘કૃતજ્ઞતા’ નામનો ઉત્તમ ગુણ પ્રગટે છે – પોખાય છે. નાત્રતા, નિરબિમાનતા વગેરે ગુણો પણ એ રીતે કમશઃ પ્રાપ્ત થાય છે. ચક્કવર્તી ભરત રાજ જેવા માનવમાં દેવ સમા ગણાય; તેવા મહારાજા પણ મરુદેવા માતાને નિત્ય પ્રણામ કરતા હતા.

આપણે પણ આપણા જીવનમાં ભક્તિ અને શુદ્ધિ ખીલવવા માટે આ કર્ત્વ રોજ કરવું જ જોઈએ. (અંક : ૭૮)

### સેવો ઉત્તમને સદા યદિ ચાહો ઉત્કર્ષ પોતા તણો

આગ્રહશક્તિ એ જીવનને હિંશા દેનારી શક્તિ છે.

તમે આ વાત તો સાંભળી જ હશે કે વનના રાજી સિંહ માટે કહેવાય છે : ‘મરે ભૂખે ભાવે મૃગપતિ કદા તૃણ ન ચરે.’

સિંહ ગમે તેવો ભૂખ્યો હોય તોય ધાસમાં મોં ન ધરે. આ એની કુલવટ છે. વિશ્વ ઉત્તમ તત્ત્વોથી વાંઝિયું નથી હોતું. હા, તેની સંખ્યામાં વધ-ઘટ થતી રહે છે. નહીંતર ઉત્તમની સાથે જ જન્મારો જાય ધતાં તેને ઓળખી ન શકે. બહુલતા એ લોકનેય પરપ્રત્યયનેયબુદ્ધિ હોય છે. બીજાના અભિપ્રાય ઉપર વજન દેનારા હોય છે. આપણે એવી ટેવ પાડી દઈએ કે ઉત્તમ સિવાયનું કશું ન ભાવે. જે શ્રેષ્ઠ હોય, ગુજરાતીમાં આગળ હોય તેના ઉપર જ પસંદગી ઉંતરે. અવેજ ન ચાલે; વિકલ્પ ન ચાલે. જો ઉત્તમની જ શોધ હોય તો વહેલું-મોહું તે મળે જ મળે. (અંક : ૬૮)

(પાઠશાળા)



- પ્રદ્યુમનસ્સુરિ

સ્થાનસમર્પિત

**વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ**

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર • અમદાવાદ

## કવિ શ્રી સુન્દરમ્ભૂના નવા કાવ્યસંગ્રહો

૧.	પલ્લવિતા	૧૮૮૫	૮+૩૪૬	રૂ. ૧૬૦
૨.	મહાનદ	૧૮૮૫	૭+૧૬૩	રૂ. ૮૦
૩.	પ્રભુ-પદ	૧૮૮૭	૧૩+૪૪૧	રૂ. ૨૨૫
૪.	અગમ નિગમા	૧૮૮૭	૧૧+૨૬૨	રૂ. ૧૫૦
૫.	પ્રિયાંકા	૧૮૮૭	૧૧+૩૬૭	રૂ. ૧૫૦
૬.	નિત્યશ્લોક	૧૮૮૭	૧૨+૧૮૮	રૂ. ૧૦૦
૭.	નયા પૈસા	૧૮૮૮	૧૩+૩૩૩	રૂ. ૧૭૫
૮.	વરદા	૧૮૮૮	૧૮+૫૨૮	રૂ. ૨૫૦
૯.	ચક્કણું	૧૮૮૮	૮+૨૫૮	રૂ. ૧૨૫
૧૦.	લોકલીલા	૨૦૦૦	૧૩+૨૫૨	રૂ. ૧૦૦
૧૧.	દક્ષિણા-૧	૨૦૦૨	૧૭+૩૨૩	રૂ. ૫૦
૧૨.	મનની મર્	૨૦૦૩	૧૦+૩૮૭	રૂ. ૫૦
૧૩.	ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨+૩૪૫	રૂ. ૫૦
૧૪.	ધ્રુવચિત્ત	૨૦૦૪	૧૭+૨૭૪	રૂ. ૫૦
૧૫.	ધ્રુવપદે	૨૦૦૪	૧૧+૨૫૩	રૂ. ૫૦
૧૬.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૫	૧૬+૩૨૦	રૂ. ૨૦૦
૧૭.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૫	૧૬+૩૭૦	રૂ. ૨૦૦
૧૮.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨+૩૧૭	રૂ. ૨૫૦
૧૯.	મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮+૨૩૮	રૂ. ૧૫૦
૨૦.	તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮+૩૦૪	રૂ. ૨૫૦
૨૧.	સ્વાગતમૂળ ગીતવાહીને	૨૦૦૯	૧૬+૨૦૭	રૂ. ૧૫૦
૨૨.	‘સાવિત્રી’ના કાવ્યખંડો	૧૮૮૫	૨૪+૪૭૩	રૂ. ૩૦૦
	(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriનાંથી. મૂળ અંગ્રેજી સાથે)			
૨૩.	દક્ષિણા-૨	૨૦૦૨	૧૮+૬૭૬	રૂ. ૫૦
	(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી. મૂળ અંગ્રેજી સાથે)			

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

૧. ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાછળ,  
આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રત્નપોળનાકા સામે, ગાંધી માર્ગ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૧

## ગુજરાતી સાહિત્ય પરિષદનાં મહિત્વનાં પ્રકાશનો




ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૫  
(૧૮૯૫-૧૯૩૫) ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કવિઓ  
સંપાદક : રમેશ ર. દવે  
સંપાદન સહાય : પારુલ દેસાઈ  
પાકું પૂર્ક, પૃ. ૧૪+૪૮૪, કિંમત રૂ. ૪૨૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૬  
(ઈ. ૧૮૯૫-૧૯૩૫)  
ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગાંધીસર્જકી  
સંપાદક : રમેશ ર. દવે  
પાકું પૂર્ક, પૃ. ૧૮+૭૩૪, કિંમત ૪૨૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૭  
(ઈ. ૧૯૧૦-૧૯૩૫) સ્વાતંત્ર્યોત્તર યુગ-૧  
સંપાદક : રમેશ ર. દવે, પારુલ કંદર્પ દેસાઈ  
પાકું પૂર્ક, પૃ. ૬૩૨, કિંમત રૂ. ૪૧૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૮/ખંડ-૧  
(ઈ. ૧૯૩૬થી ૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ-૨

સં. પારુલ કંદર્પ દેસાઈ પાકું પૂર્ક, પૃ. ૪૫૬, કિ. રૂ. ૫૬૦/-

‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથશ્રેષ્ઠીના આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાના કવિઓ, નાટ્યકારો, નિબંધકારો અને બાળસાહિત્યકારોનાં સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડણે.



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૮/ખંડ-૨  
(ઈ. ૧૯૩૬થી ૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ-૨  
સં. પારુલ કંદર્પ દેસાઈ પાકું પૂર્ક, ૪૮૬, કિ. રૂ. ૬૨૦/-  
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથશ્રેષ્ટીના આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાના નવલકૃતાકારો, વાતાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો અને સંપાદકોના સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડણે.

**PARAB 2020** December

RNI No. GUJGUJ/2006/17273

Regd. under Postal Registration No.

GAMC-306/2018-2020 valid upto 31-12-2020

Posted at Ahd. PSO on 10th of every month SSP Ah'd

ISSN : 0250-9747



**Fevi kwik®**



फेंको नहीं,  
**जोड़ो**



\*MRP For **500** mg